

**Super Visa/ Visitor to Canada Insurance**

- Best Mortgage Rates
- 1st and 2nd Mortgages
- Life and Critical Illness Insurance
- RRSP/RESP/INVESTMENTS

**Mukund Sheth**  
Financial Advisor  
Serving at 2 locations  
GTA East / GTA West  
Investment | Insurance | Mortgages

Ph.: 416-839-9645  
www.pyramidfinancial.ca  
mukund@pyramidfinancial.ca  
ON LIC # 10530

**પરદેશમાં દેશની મહેક એટલે**

# સ્વદેશ

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH

**FOR BUYING, SELLING & LEASING**  
Investment In Real Estate Can Make Your Future Better...

**FOR SELLERS**

- Free Home Staging Consultation
- Professional Photography & Virtual Tour
- Attractive Advertising
- Social Media Marketing
- Customized Feature Sheet
- Weekly Open House
- Assist in Mortgage & Legal Services

**FOR BUYERS**

- Team of Strong Mortgage Brokers
- Team of Lawyers
- Professional Home Inspectors
- Step by Step Guidance Through out Buying Process

**AMIT SHAH**  
Sales Representative  
Dr: 647-995-5640  
amitgshah@gmail.com

**KOMAL SHAH**  
Sales Representative  
Dr: 647-624-5640  
komalshah@gmail.com

Homekey236@gmail.com  
Web: www.amitshah.ca

FRIDAY, 25 MARCH, 2022 Vol. 19, No. 12 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

# IPL : વાનખેડે પર આતંકી હુમલાની દહેશત

ATSએ પકડેલા શંકમદની પૂછપરછમાં કાવતરાનો ખુલાસો, ખેલાડીઓની હોટલ અને સ્ટેડિયમમાં રેકી થયાનો ઘટસ્ફોટ



મુંબઈ

આઈપીએલની ૧૫મી સિઝનનો 26 માર્ચથી આરંભ થઈ રહ્યો છે ત્યારે આઈપીએલ પર આતંકવાદી હુમલાની દહેશત ઉભી થઈ છે. જેમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આગામી શનિવારે પહેલી મેચ રમાય તે પહેલા જ એક આતંકવાદી કાવતરાનો ખુલાસો થયો છે.

મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડએ આઈપીએલના પ્રારંભ પહેલા એક મોટું કાવતરું ઉઘાડું પાડ્યું છે. અહેવાલો અનુસાર એટીએસએ ગુરુવારે કેટલાક આતંકવાદીઓને ઝડપ્યા છે. આ આતંકવાદીઓની પૂછપરછ કરાતા તેમણે જણાવ્યું હતું કે તેમણે મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ, ખેલાડીઓની હોટલ અને બે સ્થળોને જોડનારા રોડની રેકી કરી હતી.

આતંકવાદી હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને હવે સુરક્ષા માટે નવા નિર્ણય લેવાયા છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમની સુરક્ષા-વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર ક્રિકેટ રિસ્પોન્સ ટીમ સ્પેશિયલ ફોર્સિસ અને રાજ્ય અનામત પોલીસ દળને ખડકવામાં આવી

## સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા

એલર્ટ બાદ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેલાડીઓને હોટેલથી સ્ટેડિયમ સુધી લઈ જતી બસને સ્પેશિયલ એસ્કોર્ટ સેવા અપાશે. તે ઉપરાંત ટીમ હોટેલ ખાતે પણ વિશેષ સુરક્ષા ઉપલબ્ધ કરાવાશે. ટૂનમિન્ટમાં સેવા આપનારા એમ્બાયર્સ અને અન્ય મેચ અધિકારીઓને પણ સુરક્ષા પરી પાડવામાં આવશે. મેચ દરમિયાન ખેલાડીઓની હોટેલ અને સ્ટેડિયમના રૂટ પર પાર્કિંગ સામે પણ પ્રતિબંધ લદાયો છે.

છે. ૨૬ માર્ચથી ૨૨ દરમિયાન, સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન આસુરક્ષાટીમો સ્ટેડિયમ ખાતે સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. ઉપરાંત સ્થાનિક પોલીસ દળ પણ સુરક્ષામાં રહેશે.

## રશિયા-યુક્રેન વચ્ચે ૩૦માં દિવસે પણ યુદ્ધ જરી

# રશિયાના 100થી વધુ ફાઈટર જેટ ધ્વસ્ત કર્યા હોવાનો યુક્રેનનો દાવો

યુક્રેને બેર્ડિયાન્સ્ક બંદરે રશિયાના મહાકાય જહાજને ઉડાવ્યું, ક્રિવ પર થયેલા બોમ્બમારામાં રશિયન પત્રકારે જીવ ગુમાવ્યો

ક્રિવ

રશિયાએ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરુ કરી તેના ૩૦ જેટલા દિવસો થઈ ગયા છે, પરંતુ રશિયાને હજી સફળતા નથી મળી. જમીન પર કબજો મેળવવાની વાત તો દૂર છે પરંતુ રશિયન સેનાને હવામાં પણ યુક્રેનની સેના બરાબરની ટક્કર આપી રહી છે. રશિયાએ વિચાર્યું હશે કે તે યુક્રેનની સરખામણી વધારે શક્તિશાળી છે, માટે સરળતાથી તેને હરાવી દેશે પરંતુ તેના અંદાજ ખોટા પડી રહ્યા છે. યુક્રેન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમની સેનાએ રશિયાના ૧૦૦થી વધારે ફાઈટર જેટ ધ્વસ્ત કર્યા છે.

લેટેસ્ટ અહેવાલો અનુસાર યુક્રેનના દળોએ યુક્રેનના દક્ષિણે આવેલા બેર્ડિયાન્સ્ક બંદરે લાંગરવામાં આવેલા રશિયાના મહાકાય જહાજને ઉડાવી દીધું છે. બીજી તરફ બુધવારે યુક્રેનની રાજધાની ક્રિવમાં રશિયન હુમલામાં એક રશિયન પત્રકારનું મોત થયું હતું. રાજધાની

ક્રિવના પોડોસ્કી જિલ્લામાં રશિયન બોમ્બ વિસ્ફોટમાં 42 વર્ષીય ઓક્સાના બાલિનાએ જીવ ગુમાવ્યો હતો. બાલિના ઈન્વેસ્ટિગેટિવ ન્યૂઝ આઉટલેટ ધ ઈનસાઈડર માટે કામ કરતી હતી અને તે દરમિયાન ન્યૂઝ આઉટલેટ માટે ક્રિવમાં વિનાશના વીડિયો શૂટ કરી રહી હતી.

યુક્રેનની વાયુસેનાના એક અધિકારીએ સીએનએન સાથેની વાતચીતમાં કહ્યું કે, હવે સ્થિતિ શાંતિ તરફ આગળ વધી રહી છે. શરુઆતમાં તેઓ વધારે સંખ્યામાં હોવાને કારણે અમારા પર હાવિ થઈ રહ્યા હતા, પરંતુ હવે સ્થિતિ ઘણી સારી થઈ રહી છે. અનેક રશિયન પાઈલટ ઉડાનથી ઈનકાર કરી રહ્યા છે કારણકે અમે તેમના ફાઈટર જેટ પાડી રહ્યા છીએ. અધિકારીએ જણાવ્યું કે, રશિયન પાઈલટ વધારે આધુનિક લડાકુ વિમાન ઉડાવી રહ્યા છે. તે વધારે દૂરથી મિસાઈલ ફાયર કરવા સક્ષમ છે.

**ABOWATH REAL ESTATE GROUP**  
Valuing Real Estate Transactions Every Step of the Way

**MAAZ ABOWATH**  
BROKER  
416 892 4585  
More info on PAGE 2  
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

**SUPER VISA INSURANCE**  
Get Full REFUND if visa is declined  
Get partial refund if parents leave early\*  
\*conditions apply.... Ask NOW for a free quote...

**Sanjiv Puri**  
Insurance Broker  
Ph.: 416-890-3232  
Email: sanjivpuri@rogers.com

**StarLife**  
Insurance & Investments Inc.  
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE  
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

**રસોઈ કામ માટે બહેનની જરૂર છે**

રસોઈ કામ માટે મારખમ ખાતે ગુજરાતી વેજીટેરિયન, સિલિયર કપલ માટે બહેનની જરૂર છે. અહવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ/અનુક્રમ સમય મુજબ. બહેન પાસે પોતાની કાર હોવી જરૂરી. ફક્ત મારખમ, રીચમોન્ડ હીલ, પીકરીંગ અને નોર્થ-ઈસ્ટ ટોરન્ટોના ઉમેદવારે અરજી કરવી. મિસિસાગા, બ્રામ્પ્ટન, ઇટોબિકોકના ઉમેદવારે અરજી કરવી નહીં.

સંપર્ક કરો- 416-846-8002  
11.00 am થી 4.00 pm વચ્ચે અનુક્રમ સમય મુજબ

**CIBC**  
Mortgage advice that comes to you  
For expert advice contact me today

**Dhiresh Shah**  
Mobile Mortgage Advisor  
Tel : 647-248-0246  
dhiresh.shah@cibc.com

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

**Ashok Travels 416-977-9896** અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

**www.ashoktravel.com**  
Ashok Travels Serving your travel needs in Canada since 1973  
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

✓ Residential  
✓ New Condos  
✓ Investments  
✓ Commercial

**Zakir Patel**  
Broker  
Cell: 416-561-7973  
Office: 416-287-2222

**RE/MAX COMMUNITY**  
Realty Inc., Brokerage  
Independently Owned and Operated  
1265, Morningside Ave. #203  
Toronto, ON M1B 3V9  
Email: patelzakir82@gmail.com

**SS & LAWYERS LLP**

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

**Avni Shah**  
B.A., JD  
Barrister & Solicitor

ashah@sslawyers.ca  
Tel : 416-818-4000  
Fax : 416-740-4002





# મહત્તમ છૂટછાટ સાથે પ્રવાસીઓ માટે ખૂલ્યાં કેનેડાના દ્વાર

માર્ચ 2020માં મહામારી ફેલાતા નિયંત્રણો લદાયા હતા : 1 લી એપ્રિલથી સંપૂર્ણ રસી મુકાવી હોય એવા પ્રવાસીએ કોરોનાનો ટેસ્ટ કરાવવો નહીં પડે

## ઓન્ટેરિયો

મહારોગચાળા બાદ કેનેડાએ પ્રવાસીઓ માટે પહેલી વખત સંપૂર્ણ છૂટછાટો સાથે પોતાના દ્વાર ખુલ્લા મુક્યા છે. માર્ચ 2020માં કોવિડના રોગચાળાને ધ્યાનમાં લઈને કેટલાંક પ્રતિબંધો મૂકવામાં આવ્યાં હતા. જે 2021ના ઉનાળાના પાછોતરા સમય દરમિયાન સંપૂર્ણ રસી મૂકાવનારાઓ માટે હળવા કરવામાં આવ્યાં હતાં.

જ્યારે હવે 1લી એપ્રિલથી સંપૂર્ણ રસી મુકાવી હોય એવા પ્રવાસીએ કેનેડામાં પ્રવેશતા પહેલાં કોવિડ-19 માટે ટેસ્ટ કરાવવો નહીં પડે. ગન્ડાપ્પોરી સાથે સંકળાયેલા પ્રવાસીઓએ કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી કડક તપાસમાંથી પસાર થવું પડશે અને જરૂર પડશે સીબીએસએના અધિકારી આવા પ્રવાસીને ગેરલાયક જાહેર કરી શકે છે. કેનેડાની સરકાર દેશમાં સાચા પ્રવાસીઓ આવે એવું



ઈચ્છે છે. આમ છતાં કેનેડાની સરકાર તમે તમારા ગુન્ડાઈટ રેકોર્ડ સુધારી શકો એ માટે અનેક ઉપાયો સુચવે છે. આવી પહલો ઉપાય ટેમ્પરરી રેસિડેન્ટ પરમિટ (ટીઆરપી) છે. જેઓ કેનેડામાં

કામચલાઉ વ્યવસાય માટે આવતાં હોય તેમને તે અનુકૂળ છે.

ટીઆરપી જેમ કીમિનલ રિહાબિલિટેશન માટે અરજી કરી શકાય છે જો આવી અરજી સ્વીકારવામાં આવે તો ગુન્ડેગારને પુનર્વસનની તક આપવામાં આવે છે. ત્રીજો ઉપાય કાનુની ઓપિનિયન લેટરનો છે. જેમાં કેનેડીયન વસાહતી બાબતોનાં વકીલ તમારા ગુન્ડાઓનું એક ટુકું નિવેદન તૈયાર કરી એમાં તમને શા માટે કેનેડા મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે છે તેની સમજણ આપવામાં આવે છે. આ નિવેદન સીબીએસએને તમને કેનેડામાં શા માટે પ્રવેશ આપવો એનો ખ્યાલ આપવામાં આવે છે. આ લિગલ ઓપિનિયન લેટર અનેક રીતે ઉપયોગી બને છે જેમ કે 1. પૂનર્વસનને પાત્ર વ્યક્તિ, 2. એવી વ્યક્તિ કે જેના પર આરોપ મૂકાયો હોય પણ સજા ન થઈ હોય 3. એવી વ્યક્તિ કે જેને સજા થઈ હોય પણ એ સજા કેનેડાના કાયદા મુજબ ન હોય.

## નાયગ્રા ફોલ્સ રાઉન્ડ ટ્રીપની ફીમાં ઘટાડો

ટોરન્ટોના પ્રવાસીઓ માટે બે પ્રકારના પાસની જોગવાઈ, બાળકોને ફી પાસ મળશે

### ટોરન્ટો

જો સમાહનાં અંતે તમે ઊનાળાના પ્રવેશદ્વાર સમા નાયગ્રા ફોલ્સની મુલાકાત લેવા માંગતા હોવ તો ટોરોન્ટોથી નાયગ્રા ફોલ્સની ટ્રેન ટિકિટમાં તમે 10 ડોલરનો ફાયદો મેળવી શકશો. જો ઓ ટ્રાન્સિટ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, સમાહનાં માટે લોકોને બે પ્રકારના પાસ આપવામાં આવે છે. જેમાં મોટાભાગના લોકો અમર્યાદિત પ્રવાસની સુવિધા માંગતા હોય છે.

પહેલા દિવસે 10 ડોલરના પાસમાં તમે શનિવારથી રવિવાર સુધી સંખ્યાબંધ

સ્થળોનો પ્રવાસ કરી શકશો. જ્યારે બીજા વિકલ્પમાં 15 ડોલરના સમાહનાં પાસ આપવામાં આવે છે, તેમાં સમાહનાં અને અન્ય રજાના દિવસોમાં ગમે તેટલા સ્થળે, ગમે તેટલી વખત જઈ શકશો.

સમાહના અંત માટે આપવામાં આવતા આ પાસ માત્ર ટોરોન્ટોથી નાયગ્રા ફોલ્સ પૂરતા જ મર્યાદિત નથી. પરંતુ આ પાસથી તમે કોઈપણ બસ અથવા ટ્રેન કે જે મૂળ સ્થાનેથી શરૂ થતાં હોય તેની પસંદગી કરી શકો છો અને સમાહનાં અંતમાં કોઈ પણ સ્થળે જઈ શકો છો. 12 વર્ષથી નીચેની વય

ધરાવતાં બાળકોને ઓનલાઈન ફી પાસ આપવામાં આવશે. ટોરોન્ટોથી નાયગ્રા ફોલ્સ સર્વિસ 28 જૂનથી શરૂ થશે, જે શનિવાર, રવિવાર, અન્ય રજાઓ અને સોમવારના દિવસોએ ચાલુ રહેશે. ઓન્ટોરિયોમાં કામકાજની પરિસ્થિતિ ફરીથી થાળે પડી રહી છે ત્યારે તમારે તમારા મિત્રો અને પરિવાર સાથે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને પ્રવાસના સ્થળોનાં આકર્ષણ કેન્દ્ર તરીકે આ એક નવા સ્થળનો તમારી યાદીમાં ઉમેરો કરવો જોઈએ, એમ જીઓ ટ્રાન્સિટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

## 140 કિમી ઝડપે કાર હંકારનારને ઝડપવા પોલીસને પરસેવો પડ્યો

કોઈ નશાની હાલતમાં કાર હંકારી રહ્યું હોવાનો કોલ મળતાં જ પોલીસ હરકતમાં આવી

### સરદામ

એક 11 વર્ષીય છોકરાએ ઓન્ટેરિયોના વ્હાઈટ-બી ખાતે રવિવારે સાંજે પોલીસને તોફાની ઝડપે કાર ચલાવવાની ફરજ પાડી હતી. આ બાબતે ડરહામ રિજિયોનલ પોલીસે જણાવ્યું હતું કે, પોલીસને 11 વર્ષ ઉંમરે ફરિયાદ મળી હતી કે, એક ડ્રાઈવર સંભવત: પીધેલી હાલતમાં રોડ ઉપર બેફામ વાહન ચલાવી રહ્યો છે. જે બાદ અમે જરા પણ સમય ગુમાવ્યા

વિના એ કારનોનો પીછો કર્યો અને એ કાર આગળ ધસી જઈ કારને અટકાવી હતી. આ પહેલાં લગભગ 140 કિમી પ્રતિ કલાકની ઝડપે રોંગ સાઈડમાં આ કાર જઈ રહી હતી અને પાછળની સીટ ઉપર 12 વર્ષનો એક છોકરો બેઠો હતો. પરંતુ આ આખા બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી. કોન્સ્ટેબલ જ્યોર્જ ટુડોસે કહ્યું હતું કે, અધિકારીએ વિરુદ્ધ દિશામાં જઈ વાહનથી બચવા ઘાંસ પર પડ્યા બાદ અધિકારીએ ઈમરજન્સી લાઈટ કરી કારને અટકાવવા યુ ટર્ન લીધો હતો. ટોડોસે કહ્યું હતું કે છોકરાએ કાર પરનો કાબુ ગુમાવતા કાર ફેન્સિંગ સાથે અથડાઈ પડી હતી.


## ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મિસીસાગાની મીટીંગ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ અંગે સંવાદ

### મિસીસાગા

ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મિસીસાગા દ્વારા ગત તારીખ 20-3-2022ના રોજ 10 વાગ્યાથી ઝુમ મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં ડાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વિષય પર સંવાદ અને ચર્ચા કરાઈ હતી.

પંકજભાઈ મહેતાએ મીટીંગમાં જોડાયેલા સભ્યોનું સ્વાગત કર્યા બાદ ડાઈ બ્લડ પ્રેશર અને કિડનીના પ્રોબ્લેમના નિષ્ણાંત અને વક્તા ડોક્ટર રુચિરભાઈ ત્રિવેદીનું પણ સ્વાગત કર્યું હતું.

ગીતાબેન ભટ્ટ ડોક્ટર રુચિરભાઈને મિટિંગ માટે લાવ્યા હતા. ડોક્ટર રુચિરભાઈ ઉચ્ચ કક્ષાના પ્રોફેસર ઓફ Nephrologist and Hypertension ના સ્પેશિયાલિસ્ટ



છે. ડોક્ટર રુચિરભાઈએ ગુજરાતીમાં વિષય સંદર્ભે સમજણ આપી હતી. પ્રમુખ કલાબેન પટેલે, ઉપપ્રમુખ પ્રવીણભાઈ મહેતા તથા કમિટી સભ્યોએ તેમનો આભાર માન્યો હતો. ડોક્ટર રુચિરભાઈ ત્રિવેદીએ પાવર પોઈન્ટ સ્લાઈડ શો દ્વારા માર્ગદર્શન આપી સુચનો કર્યા હતા.

## SHIV FINANCIAL SERVICES

Serving Community Since 2009  
Canada

**BEST RATES AVAILABLE**

**FREE PERSONAL TAX-FILE FOR NEW IMMIGRANTS**

**SUPER VISA MEDICAL INSURANCE & VISITOR TO CANADA MEDICAL INSURANCE**

**JAGDISHBHAI SEVAK**  
Insurance Broker

**647-236-7620**

sevak\_2007@hotmail.com • www.shivfinancialservices.ca

"PROPER INSURANCE COVERAGE IS PEACE OF MIND"

## THINKING OF BUYING, SELLING OR INVESTING?

**આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર**

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.  
મોટાંજ જોઈએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

**CALL 416 893 4585 TODAY!!!**

**SUBHRO CHAKRABORTY**  
SALES REPRESENTATIVE

**SUDHIR PARMAR**  
SALES REPRESENTATIVE

Call us TODAY for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

**MOHAMMAD ABOWATH**  
SALES REPRESENTATIVE

**MAAZ ABOWATH**  
BROKER - TEAM LEADER

**IBRAHIM ABOWATH**  
SALES REPRESENTATIVE

**416 893 4585**

**ABOWATH REAL ESTATE GROUP**

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

**ABOWATH.COM**

**RE/MAX**  
your Local REALTOR



# ટોરોન્ટો પંથકમાં મોટા વેપાર ઉદ્યોગો બે સપ્તાહમાં ધમધમતા થવાના સંકેતો

કામદારોને ફરીથી નોકરી ઉપર રાખવા નોકરીદાતાઓને અપારો પ્રોત્સાહન

## ટોરોન્ટો

બે વર્ષના લાંબા સમયગાળા બાદ ટોરોન્ટોના સરકારી કામદારો આ સપ્તાહથી ઓફિસે જવા લાગ્યાં છે. શહેરમાં મોટા પ્રમાણમાં બિલ્ડિંગો ખૂલવા લાગ્યાં છે. શહેરના ૮૦ ટકા એટલે કે, આશરે ૩૨,૦૦૦ સક્રિય કામદારો મહારોગચાળા દરમિયાન આવશ્યક સેવાઓ માટે સતત પોતાના ઘરની બહાર રહીને ફરજ બજાવતાં હતા. પરંતુ ૨૦ ટકા લોકો માર્ચ ૨૦૨૦થી બેકાર બની ગયા હતા. તેમાંના મોટાભાગના કામદારો પણ નવી હાઈબ્રીડ કાર્ય પ્રણાલીને કારણે ખંડ સમય માટે ઓફિસે આવવા લાગ્યા છે. શહેરમાં પણ જાહેર સ્થળો જેવાં કે નોર્થ યોર્ક સિવિક સેન્ટર, સ્કારબોરો સિવિક સેન્ટર, ઈટોબિકોક સિવિક સેન્ટર અને યોર્ક સિવિક સેન્ટર તથા ઈસ્ટ યોર્ક



સિવિક સેન્ટર ખુલવા લાગ્યા છે. આ અગાઉ ફેબ્રુઆરી ૨૨થી કાઉન્ટર સેવા ચાલુ કરાઈ હતી. મેયર જહોન ટોરીએ સોમવારે સવારે સિટી હોલમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “મને આશા છે કે, વેપાર-ઉદ્યોગ જગત અમને અનુસરશે. એમની સાથેની એક બેઠક બાદ હું જાણી શક્યો છું કે મોટા વેપાર ઉદ્યોગો આવતા બે સપ્તાહથી ધમધમતા થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે, અનેક નોકરીદાતાઓ તેના ઘણા કામદારો નોકરીએ આવી પાછા કામે

લાગી જાય તેમ ઈચ્છે છે. વેપાર ઉદ્યોગ ક્ષેત્ર પણ તેમને આવકારવા રાજી છે અને તેઓ આશા રાખે છે કે, કામદારો સંપૂર્ણ તદ્દરસ્તી સાથે ઉત્સાહથી કામ કરશે.

શહેરમાં કામદારોને આવકારવા જાન્યુઆરીમાં તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ ઓમિકોન વેરિઅન્ટ ફેલાતા વિલંબ થયો છે. રોટ્ટન્ડા સિટી હોલમાં પત્રકારો સમક્ષ ટોરીએ વધુમાં કહ્યું હતું કે “મને આશા છે કે, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાછા ફરી રહેલા કામદારોને કારણે નાના વેપાર-ઉદ્યોગોના વિકાસને વેગ મળશે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, કામના સ્થળે કામદારોએ માસ્ક પહેરવાની જરૂર નથી, કિન્તુ ભારે જોખમવાળા ક્ષેત્રો જેવાં કે પબ્લિક ટ્રાન્ઝિટ જેવા સ્થળોએ રાજ્યની ફરજિયાત માસ્ક નીતિ ચાલુ રહેશે.

# ઓન્ટેરિયો કોલેજ તેમજ યુનિ.માં 2022-23 સુધી ટ્યુશન ફી સ્થગિત

આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને સરેરાશ 660 ડોલરથી ઓછી ફી ભરવાની રહેશે



## ઓન્ટેરિયો

કેનેડામાં કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી જે ટ્યુશન ફી લેવામાં આવે છે, તે આવતા વર્ષથી સ્થગિત કરવામાં આવશે. કોલેજો અને યુનિવર્સિટી વિભાગના મંત્રી જીલ ડનલોપ કે જે પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ સરકારમાં હતા, ત્યારે શિક્ષણ ખર્ચમાં વધારો કરતા પરિવારો પર આર્થિક બોજો વધ્યો હતો.

રાજ્ય સરકારે ટ્યુશન ફીમાં 2019થી 2020 સુધી શૈક્ષણિક વર્ષ

દરમિયાન આ ફીમાં 10 ટકાનો ઘટાડો કર્યો હતો અને તે પછીના બે વર્ષ બાદ ટ્યુશન ફી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે આ નિર્ણયની મુદત 2022-2023ના શૈક્ષણિક વર્ષ સુધી લંબાવી દેવામાં આવી છે. આ નીતિ મૂળ રાજ્ય સરકારની ફી ઘટાડા નીતિના એક ભાગ તરીકે 2019માં શરૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને સરેરાશ 660 ડોલરથી ઓછી ફી ભરવાની રહેશે.

# ઓન્ટોરિયોમાં કારની નોંધણી માટે નવા નિયમો, 7000 ડોલરથી વધશે

કાગળીયા કાર્યવાહીને નિવારીને સમય તથા ખર્ચની બચત થવાની આશા ઓન્ટેરિયો



ઓન્ટોરિયોની સરકારે વાહનોની નોંધણી માટેનાં નિયમોમાં ફેરફાર કર્યા છે અને જ્યારે લોકો નવું વાહન ખરીદે ત્યારે તેને ધ્યાનમાં રાખે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગત મંગળવારે સરકારે ડિજિટલ ડિલરશીપ રજીસ્ટ્રેશનની શરૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કાગળીયા કાર્યવાહીને નિવારીને સમય તથા ખર્ચની બચત થતાં વપરાશકારો અને વેપાર-ઉદ્યોગોને ફાયદો થશે. આ નવી પ્રક્રિયામાં કારની ડિલરશીપ માટે વાહનોની ઓનલાઈન નોંધણી અને પરમિટ તથા લાઈસન્સ પ્લેટ સીધેસીધા ખરીદનારાઓને આપવામાં આવશે.

મંગળવારે સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, નવા ડીડીઆરનો સંપૂર્ણ અમલ કરવામાં આવતાં ઓન્ટોરિયોમાં આશરે 7000 ડિલરશીપનો વધારો થઈ રહ્યો છે અને તેમણે ઓનલાઈન પ્રોગ્રામ

સ્વીકારીને કાગળીયા કામકાજને તિલાંજલિ આપી છે, તેમજ સમયને બચાવતાં સર્વિસ ઓન્ટોરિયો સેન્ટર પણ ખરીદનારાઓને મદદરૂપ બની રહેશે. સરકારે જણાવ્યું હતું કે, ડીડીઆરના સંપૂર્ણ અમલમાં મૂકતાં દર વર્ષે 4.8 મિલિયન ડિલરશીપ રજીસ્ટ્રેશન કરી શકાશે. જેમાં અગાઉથી માલિકી ધરાવતા વાહનો, નામ બદલવું તથા નવી પરમિટ મેળવવી વગેરે તમામ કામ કે જે હાલ માનવબળથી કરવામાં આવે છે, તે બંધ થઈ જશે. વધુમાં વાહનોનું રજીસ્ટ્રેશન વધુ ઝડપી બનશે અને પૂરી ક્ષમતાથી કાર્ય થશે. ડીડીઆર પણ વધુ ચોક્કસ, ક્ષતિરહિત નોંધણી કરીને વાહનની સલામતી અને માલિકીનું ખાનગીપણું જાળવી શકાશે એમ સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું.

# ટૂડોને 2025 સુધી સત્તામાં ટકાવી રાખવા NDP અને લિબરલ્સ વચ્ચે સમજૂતિ

ફેડરલ લિબરલ્સ અને ન્યુ ડેમોક્રેટિક પાર્ટીએ મુસદ્દો તૈયાર કર્યો

## ઓટાવા

ફેડરલ લિબરલ્સ અને ન્યુ ડેમોક્રેટિક એક મુસદ્દો તૈયાર કર્યો છે. જો તેને સ્વીકારી લેવામાં આવશે તો ટૂડોની સરકાર 2025 સુધી સત્તામાં રહેશે. આ લેતીદેતી NDPની લાંબા ગાળાની પ્રગતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, એવો દાવો મીડિયા દ્વારા કરાયો છે.

મીડિયાના અહેવાલો પ્રમાણે આ સમજૂતી ઉપર હજુ નેતાઓએ વિચાર કરવાનો બાકી છે અને તેના પર NDPના સાંસદોએ સહી સિક્કા કર્યા નથી. જો આ સમજૂતી થઈ જશે તો NDPનું જુથ સરકારને ભવિષ્યમાં આવનારો વિશ્વાસમત, અંદાજપત્રનાં મતદાન વખતે મદદ મળશે અને એ બદલ NDPને ફાર્માસ્યુટિકલ્સ અને ડેન્ટલ કેર ક્ષેત્રમાં લિબરલ્સ તરફથી મદદ કરવામાં આવશે. એક લિબરલ સાંસદ કે જેણે સોમવારે ઈનર્જન્સી બેઠકમાં આ વિષય ઉપર ચર્ચા થઈ ત્યારે હાજરી આપી હતી. તેણે કહ્યું હતું કે, સંસદમાં સાથે કામ કરવા માટેની સમજૂતી સાધવામાં આવી છે. પરંતુ તે વિશ્વાસ અને કરારને અનુરૂપ હોવા જોઈએ. NDPના નેતા જગમિત સિંઘ સોમવારે રાત્રે પોતાના સાંસદો સમક્ષ આ મુસદ્દો રજૂ કરશે. લિબરલ્સ સાંસદો લઘુમતિમાં છે અને આ કરારથી લિબરલ્સની કેન્દ્ર સરકારને સ્થિરતા મળશે. તેને કારણે ટૂડોની કેબિનેટ



## કરાર છેતરપિંડીના પ્રયાસથી વધુ કશું જ નથી

લિબરલ્સ અને NDP વચ્ચે થયેલા કરાર બાબતે કન્ઝર્વેટિવના વચગાળાનાં નેતા બર્જને જણાવ્યું હતું કે, આ કરાર છેતરપિંડીના પ્રયાસથી વધુ કશું જ નથી. ટૂડોને સત્તા પર ચીપકી રહેવું છે અને પાછલા બારણેથી સમાજવાદની વાતો કરવી છે. NDP અને લિબરલ્સની સરકાર લોકો સાથે વિશ્વાસઘાત કરી રહી છે અને મતદાતાઓને ખરીદી રહી છે.

અવિશ્વાસની દરખાસ્ત પસાર થવાના ભય વિના કામ કરી શકશે. આ વિષયની ચર્ચા થઈ ત્યારે લિબરલ્સના સાંસદોએ તેને સકારાત્મક ગણાવી હતી. 2019થી લિબરલ્સ લઘુમતિમાં આવી ગયા છે અને ત્યારથી NDP તેમના મુખ્ય સહયોગી તરીકે મતદાન દરમિયાન ટેકો આપતા રહ્યા છે.

# COVID પ્રતિબંધોને દૂર કરવા કન્ઝર્વેટિવની માંગ

પાર્ટીએ ગુરુવારે હાઉસ ઓફ કોમન્સમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો

## ટોરોન્ટો

કન્ઝર્વેટિવ પાર્ટીએ ફેડરલ સરકારને બાકીના તમામ COVID-19 પ્રતિબંધો હટાવવા માટે માંગ કરી છે. પાર્ટીએ જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે, આ આરોગ્ય સંકટના બે વર્ષ પછી તમામ રોગચાળાના પગલાંમાંથી આપણે આગળ વધવું જોઈએ. પાર્ટીએ ગુરુવારે હાઉસ ઓફ કોમન્સમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

સરકારે ફેડરલ પબ્લિક સેવકો, ટ્રાન્સપોર્ટ વર્કર્સ, કેનેડિયન આર્મ્સ ફોર્સીસ કમ્યુનિટી અને RCMP માટે વેક્સીન આદેશ જેવા પગલાંને પડતા મૂકવા પ્રયાસ આદરવા જોઈએ. સરકારે પહેલેથી જ કહ્યું છે કે 1 એપ્રિલથી, તેણે સંપૂર્ણ રસીવાળા પ્રવાસીઓ માટે-આગમન પહેલાના પરીક્ષણ અને ફરજિયાત સંસર્ગ નિષેધ જેવા મોટાભાગના પ્રવાસ-સંબંધિત કોવિડ પ્રતિબંધોને દૂર કરી દીધા છે. જ્યારે કેટલાક પ્રતિબંધો છૂટા કરવામાં આવશે અથવા સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવશે, સરકાર હજી પણ રસી વિનાના વિદેશી નાગરિકોની મુસાફરીને અવરોધિત કરશે આ બાબતે કન્ઝર્વેટિવ્સ કહે છે કે તેઓ ઈચ્છે છે કે આ તમામ પગલાં તાત્કાલિક ઉઠાવવામાં આવે.



કેનેડિયનોએ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે પૂરતો સહયોગ આપ્યો જ છે. કન્ઝર્વેટિવ સાંસદ માર્ક કલ બેરેટે આરોગ્ય વિવેચક, કોમન્સમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, “આપણી પાસેથી અનિશ્ચિત સમય સુધી આ પ્રતિબંધો હેઠળ રહેવાની અપેક્ષા રાખી શકાતી નથી.” કન્ઝર્વેટિવ સાંસદ મેલિસા લેન્ડસમેન, પાર્ટીના ટ્રાન્સપોર્ટ ટીકાકાર અને રસી વિરોધી આદેશના વિરોધના પ્રારંભિક સમર્થક જણાવ્યું હતું કે કોસ-બોર્ડર ટ્રકર્સ અને અન્ય પરિવહન ઉદ્યોગના કામદારો માટે રસીની આવશ્યકતાઓને દૂર કરવાનો સમય આવી ગયો છે.

# મિસીસાગામાં મસ્જિદ પાસે ટોળા પર હૂમલા બાદ સલામતી વ્યવસ્થા સઘન

## ઓન્ટેરિયો

મિસીસાગામાં એક મસ્જિદમાં વહેલી સવારે એકત્ર થયેલાં લોકો ઉપર એક શખ્સે હુમલાખોરે એકાએક ફુલાડી સાથે ધસી જઈ બિયર છાટીને હુમલો કર્યો હતો એમ રવિવારે બંનેલા આ બનાવ વિશે માહિતી આપનાર પ્રત્યક્ષ દર્શીએ જણાવ્યું હતું. એ વખતે દર-અલ-ઈસ્લામિક સેન્ટર ખાતે શનિવારે આ બનાવ બન્યો એ વખતે નમાઝ પઢવા આવેલાં આશરે ૨૦ લોકોના જૂથમાંથી એક નૂરાણિ સાઈર અલીએ જણાવ્યું હતું કે, અમે એ હુમલાખોરને કાબુમાં લેવાના પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે એ વ્યક્તિના એક હાથમાં બીયરનું કેન દેખાયું હતું. જેનાથી તેણે પોતાના એક હાથ પર બીયર સ્પ્રે કર્યું હતું. આ સમયે તેના બીજા હાથમાં ફુલાડી હતી. તે ત્યાં એકત્ર થયેલા અને પહેલી

લાઈનમાં ઉભેલા લોકો ઉપર સ્પ્રે છાંટવા લાગ્યો હતો. સ્પ્રેની તીવ્ર દુર્ગંધને કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જેથી લોકોએ હુમલાખોરનો પ્રતિકાર કર્યો હતો. હુમલાખોર અત્યંત ઝનૂની અને હિંસક હતો. આ ઝપાઝપી દરમિયાન પોલીસ આવી પહોંચી હતી અને પીર રીજીઓનલ પોલીસે આરોપીને ૨૪ વર્ષથી મહમ્મદ મોઈઝ ઓમર તરીકે ઓળખી કાઢી તેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે, આરોપી શસ્ત્રોથી હિંસક હુમલા કરવા, ગેરકાયદે શસ્ત્રો રાખવા, લોકોને ધમકી આપવી, ધારદાર શસ્ત્રો રાખવા અને ધાર્મિક સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવા અનેક આરોપોનો સામનો કરી રહ્યો છે. હાલ મસ્જિદ પાસે સલામતી વ્યવસ્થા વધારાઈ છે.





તંત્રી સ્થાનેથી

# 'કાશ્મીર ફાઈલ્સ': 32 વર્ષ બાદ હિંસાના તાંડવનું સત્ય ઉજાગર

ભારતમાં છેલ્લાં 10 દિવસથી ધ કાશ્મીર ફાઈલ્સની ચર્ચા ચાલી રહી છે. ૧૯૯૦માં કાશ્મીર ખીણમાંથી હિન્દુ પંડિતોને હાંકી કાઢવા છેડાયેલા આતંકવાદી અભિયાનનો ચિતાર રજૂ કરતી આ ફિલ્મ દેશમાં હજારો સિનેમાઘરોમાં રજૂ થઈ છે. આ ફિલ્મને બોલીવુડના કોઈ કલાકાર કે અન્ય મહાનુભાવે પ્રમોટ ન કરવા છતાં દેશમાંથી જબરસ્ત પ્રતિસાદ મળી રહ્યો હોવાથી અત્યાર સુધીમાં આ ફિલ્મે 180 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. દેશના અનેક રાજ્યોમાં આ ફિલ્મને જે તે રાજ્ય સરકાર કરમુક્ત કરી છે.

ભારતના નકશામાં મુગટમણિનું સ્થાન શોભાવતું કાશ્મીર ઈસુના તેરમા સૈકા સુધી હિન્દુ રાજ્ય હતું. જેમાં કેટલાક લોકો બૌદ્ધ ધર્મ પણ પાળતાં હતાં. આદિ શંકરાચાર્યે વર્ષો સુધી આજના શ્રીનગરમાં તપ કર્યું હતું. તેમના નામે ઓળખાતી શંકરાચાર્ય હિલ આજે પણ શ્રીનગરમાં મોજૂદ છે. મોઢેરામાં જેવું જ સૂર્યમંદિર કાશ્મીર ખીણમાં હતું. જેના જીર્ણ અવશેષો આજે પણ માર્તંડ મંદિરના રૂપમાં છે. ઈ.સ. ૧૩૮૯માં સિકંદર બલ્ખીન નામના મુસ્લિમ બાદશાહે કાશ્મીર જીતી લીધું અને હજારો હિન્દુઓની કતલ કરી. સિકંદરે લાખો હિન્દુઓને મુસ્લિમ બનાવ્યા હતા. મુસ્લિમો અને મોગલોના સતત આક્રમણ છતાં કાશ્મીરની આશરે ૧૫ ટકા જેટલી વસતિ હિન્દુ હતી. કાશ્મીરમાં ઈ.સ. ૧૮૪૬થી ૧૯૪૭ સુધી ડોગરા વંશના હિન્દુ રાજાઓનું શાસન રહ્યું, જે દરમિયાન હિન્દુઓ અને મુસ્લિમો સંપીને રહેતા હતા. પરંતુ ઈ.સ. ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનના જિહાદીઓ કાશ્મીર ઉપર ત્રાટક્યા. તેમનાથી ડરીને હિન્દુઓની ૨૦ ટકા જેટલી વસતિ કાશ્મીર છોડીને હિન્દુસ્તાનના અન્ય ભાગોમાં હિજરત કરી ગઈ.

ઈ.સ. ૧૯૮૧ સુધી તો કાશ્મીરની કુલ વસતિમાં હિન્દુઓની ટકાવારી ઘટીને માત્ર પાંચ ટકા પર જ આવી ગઈ હતી. 1990 પહેલાં કાશ્મીર ખીણમાં સદીઓથી પંડિતો વસવાટ કરતા હતા. આખા પ્રદેશમાં લાખોની સંખ્યામાં પંડિતો હોવાથી કેટલાક કટ્ટરવાદીઓને તે ગમતુ ન હતું. આઝાદી સાથે જ ભારત-પાકિસ્તાન એમ બે દેશ અસ્તિત્વમાં આવ્યા અને પીઓકે જેવી સમસ્યા ઉદભવી. જે બંને દેશ માટે વર્ષો સુધી પણ લડાઈનું કારણ બની. 1990માં કાશ્મીરમાં કટ્ટરવાદીઓએ પોતાના અલગ પ્રદેશની માંગ પ્રબળ બનાવી. અલગવાદી નેતાઓએ આ લડતની આગેવાની લીધી. તે પછી આવા કાશ્મીરને આઝાદી આપવાની માંગ સાથે દરરોજ હિંસાનો ખેલ ખેલાયો. ભારતની સેના વિરુદ્ધ હથિયારો સાથે ઉતરેલા આ કટ્ટરવાદીઓને ત્યાં વર્ષોથી વસતા હિંદુ પંડિતો પણ ખૂંચતા હોવાથી નિર્દોષ હિંદુ પંડિતોને પણ નિશાન બનાવવામાં આવ્યા. હત્યા, બળાકાર તથા સતત હિંસાથી કટ્ટરવાદીઓએ એવું વાતાવરણ ઉભું કર્યું કે, લાખો પંડિતો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા.

ફિલ્મમાં રજૂ કરાયેલી હકીકત એવી પણ છે કે, પાકિસ્તાન તરફી ત્રાસવાદીઓના જૂથે ૧૯૮૯ની ૧૯મી જાન્યુઆરીએ કાશ્મીર ખીણમાં હજારો વર્ષોથી વસતા હિન્દુ પંડિતોની કતલ શરૂ કરી. તેમણે નિર્દયતાપૂર્વક ૨૧૯ કાશ્મીરી પંડિતોની હત્યા કરી નાંખી, જેમાં સ્ત્રીઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. આતંકવાદીઓએ હિન્દુઓને ચેતવણી આપી હતી કે, જો તેઓ કાશ્મીર છોડીને ચાલ્યા નહીં જાય તો તેમની પણ હત્યા કરી નંખાશે. કાશ્મીરમાં ત્યારે

ત્રાસવાદીઓનો એટલો પ્રભાવ હતો કે, કાશ્મીરી પંડિતો પોતાનાં ઘરમાં બેસીને 'રામાયણ' સિરિયલ પણ જોઈ શકતા નહોતા. છેવટે ભયભીત થયેલા પંડિતો પોતાનો જીવ બચાવવા કાશ્મીર ખીણમાં આવેલાં પોતાનાં બાપદાદાનાં મકાનો મૂકીને ચાલી નીકળ્યાં.

ઈ.સ. ૧૯૮૯ના અંત સુધીમાં આશરે ૩,૦૦,૦૦૦ પંડિતો કાશ્મીરમાંથી હિજરત કરી ગયા હતા. ભારતનાં પ્રસાર માધ્યમો આ અત્યાચાર બાબતમાં બહુધા મૌન જ રહ્યા છે. વિવેક રંજન અગ્નિહોત્રિ દ્વારા બનાવાયેલી આ ફિલ્મમાં આવી બધી ઘટનાઓનું નિરુપણ કરવાનો પ્રયાસ કરાયો છે.

અનુપમ ખેર, પલ્લવી જોષી અને દર્શનકુમાર જેવા કલાકારોએ પોતાનો અભિનય પણ બખૂબી નિભાવ્યો છે. અનેક પંડિત પરિવારો ૩૨ વર્ષ પછી પણ દિલ્હી અને જમ્મુની નિરાશ્રિત ઇલાકાઓમાં રહે છે. તેમની એક આખી પેઢી નિરાશ્રિત ઇલાકાઓમાં મોટી થઈ છે. 1990 પછીના ૧૦ વર્ષમાં રાહત ઇલાકાઓમાં આશરે લઈને રહેતા આશરે ૮,૦૦૦ લોકો બીમારી અને રોગચાળાનો શિકાર બની ગયા. આ પ્રકારની ઘટનાઓને ધ કાશ્મીર ફાઈલ્સમાં દર્શાવવામાં આવી છે.

આ બધી વાતો અત્યાર સુધી ઘરબાયેલી હતી કે, તેને છુપાવવામાં આવી છે તેવો જનમત દેશમાં વ્યક્ત થઈ રહ્યો છે. આ ફિલ્મથી આખા દેશમાં એવી લાગણી જન્મી છે કે, વર્ષો પછી આ ઘટનાની જાણકારી મળી છે. આમ છતાં કાશ્મીરના એ દરેક વિસ્થાપિત પરિવારોને દેશની સરકાર હવે ન્યાય અપાવે. ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપનું રાજ આવ્યું તે પછી કાશ્મીરી પંડિતોને આશા બંધાઈ હતી કે, સરકારના સંવિચારથી તેઓ પોતાની માતૃભૂમિમાં પાછા ફરી શકશે, પણ તે આશા ઠગારી પુરવાર થઈ હતી. ભાજપના આઠ વર્ષના શાસન પછી પણ જેમને સરકારી નોકરી મળી છે તેવા બહુ ઓછા પંડિત પરિવારો ખીણમાં પાછાં ફરી રહ્યાં છે. વાસ્તવમાં કેન્દ્રમાં ભાજપના મોરચાની સરકાર આવી તેનાં આઠ વર્ષ પછી પણ સરકાર પાસે કાશ્મીરી પંડિતોની ઘરવાપસીનો કોઈ નક્કર પ્લાન દેખાતો નથી.

સરકારના આંકડાઓ મુજબ ૩૭૦ની કલમ દૂર કર્યા પછી પણ માત્ર ૫૨૦ પરિવારો જ કાશ્મીર ખીણમાં પાછાં ફર્યા છે. આ પહેલાં ઈ.સ. ૧૯૯૮થી ૨૦૦૪ દરમિયાન કેન્દ્રમાં એનડીએની સરકાર આવી અને અટલબિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા અને કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે પેકેજ જાહેર કરાયું, પરંતુ તેમાં એટલી બધી શરતો હતી કે, બહુ ઓછા પંડિતો તે સ્વીકારવા માટે તૈયાર થયા હતા. આ પેકેજમાં કાશ્મીરી પંડિતોને નોકરી આપવામાં આવતી હતી, પણ રહેઠાણની વ્યવસ્થા તેમણે જાતે કરી લેવાની હતી. વળી, નોકરીમાં તેમને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી કરવાની સવલત પણ આપવામાં આવી નહોતી.

આખરે તે પેકેજ ફ્લોપ પુરવાર થયું હતું. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા તે પછી તેમણે કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે નવેસરથી પ્રયત્નો આદર્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે, જે કાશ્મીરી પંડિત પોતાનાં વતનમાં પાછા ફરવા માગતા હોય, તેમને સરકારી નોકરી આપવામાં આવશે. પરંતુ ૩૨ વર્ષમાં કાશ્મીરના સમાજજીવનમાં જે પરિવર્તન આવ્યું છે તેને કારણે ઘણા પંડિતો પાછા ફરવામાં ભય અને સંકોચ અનુભવે છે. કેટલાક પંડિતો કાશ્મીર ખીણમાં અલગ પ્રાંતની માગણી કરી રહ્યા છે, જેમાં માત્ર હિન્દુઓ જ વસતા હોય. વર્તમાન સરકાર સામે આ બહુ મોટો પડકાર છે.

manoj1968@yahoo.ca

**RE/MAX**  
**REALTY SERVICES**  
 INC., BROKERAGE

INDEPENDENTLY OWNED AND OPERATED


**JAY PATEL**  
 BROKER

**647.241.3818**

jaypatel1323@gmail.com


**"Let Me Make Your Dream Home Into A Reality"**
**Residential, Commercial & Investment in Real Estate**

Off : 905.456.1000 | Fax : 905.456.1924

295 Queen Street East, Brampton, On., L6W 3R1


**ARISTO PEST CONTROL**

Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



✓ Mice

✓ Rat

**SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL**


✓ Cockroach

✓ Bedbug

✓ Animal Control

**WE SPEAK ENGLISH, GUJARATI & HINDI**

✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal


**24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL**

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

**Written Guarantee And Discounted Rates**

**CALL SANKET TRIVEDI - 647.339.3926**  
 Government Licensed Structural Exterminator



# વિખવાદ થતાં આર્મીમેને પત્નીની હત્યા કરવા માટે 40 હજારમાં સોપારી આપી

મહિલાનો બંને વખત બચાવ થયો : પુણે અને સુરતના યુવાનોની ધરપકડ કરાઈ

સુરત

સુરતના માન દરવાજા સી ટેનામેન્ટમાં 31 વર્ષીય નંદીની વિનોદભાઈ મોરે પર બે અજાણ્યા ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા શરીરના વિવિધ ભાગે ઈજા થઈ હતી. સારવાર વેળા ખુલાસો થયો કે અગાઉ પણ નંદીની મોરે પર ફાયરીંગ થયું હતું. ડિવોર્સ કેસના વિખવાદને લીધે પતિ પર શંકા વ્યક્ત કરાઈ હતી. બંને વાર હુમલો કરનાર વ્યક્તિઓ સમાન હોવાથી કાર્ડમ ગ્રાન્યે ફૂટેજના આધારે તપાસ કરી હતી. જેમાં હુમલાખોરો જે બાઈક પર

આવ્યા હતા તે નંદીનીના પતિ વિનોદ મોરેના મિત્ર દેવની હોવાનું બહાર આવ્યું હતું. તેની પુછપરછમાં વિનોદે ફોન કરી તેના મિત્રને કામ માટે બાઈકની જરૂર હોય ગત 26 ફેબ્રુઆરીના રોજ અને ગત શનિવારે આપી હોવાનું જણાવ્યું હતું. નંદીની પર ફાયરીંગ તે બે દિવસે જ થયું હતું. દરમિયાન બાતમીના આધારે પુણા કડોદરા રોડ સહિયા હેમાદ ગામ જવાના ત્રણ રસ્તા પાસેથી બાઈક સાથે રવિન્દ્ર રઘુનાથ યેશે અને રત્નકલાકાર નરેન્દ્ર ઉર્ફે મયુર રમેશ જાવદને પિસ્તોલ.

2 કારતુસ સાથે ઝડપી લીધા હતા. વિખવાદમાં જ વિનોદે મિત્ર રવિન્દ્રને તેનું રૂ.40 હજારનું દેવું ચૂકતે કરવાની વાત કરી નંદીનીની હત્યા કરવાની સોપારી આપી હતી. વિનોદે જ ગામમાંથી પિસ્તોલની વ્યવસ્થા કરી સુરતમાં મિત્રને ફોન કરી બાઈકની વ્યવસ્થા કરાવી હતી. રવિન્દ્ર સુરત આવ્યો હતો અને પોતાના ગામના નરેન્દ્ર સાથે ગત 26 ફેબ્રુઆરીના રોજ સાંજે તેણે નંદીની પર પાંડેસરા બમરોલી રોડ આશીર્વાદ ટાઉનશીપ સામે ફાયરીંગ કર્યું હતું.

# ભાવ વધતા જરીના ઉદ્યોગકારો હેરાન, 80% ઉત્પાદન બંધ કર્યું

સુરત

કોરોનાકાળ બાદ ધાતુ આ ભાવોમાં વધારો થઈ રહ્યો હતો અને હવે છેલ્લા 20 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુકેન વચ્ચેના યુદ્ધની અસરથી પણ ધાતુના ભાવો વધ્યા છે. જેની સીધી અસર સુરતના વેપાર ઉદ્યોગ પર પડી રહી છે. ધાતુના ભાવમાં સતત વધારાને કારણે જરી ઉદ્યોગને પ્રતિકૂળ અસર થઈ રહી છે. જેના કારણે 80 ટકા જરી ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કરી દીધું છે.

છેલ્લા 20 દિવસથી યુકેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સોના-ચાંદી, તાંબુ અને યાનના ભાવમાં વધારો

થઈ રહ્યો છે. જેની અસર સુરતના ધાતુ સાથે સંકળાયેલ તમામ ઉદ્યોગો પર પડી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ભાવ વધવાના કારણે જરીના ખર્ચમાં પણ વધારો થયો છે. જો ઉદ્યોગકારો આ વધેલા ભાવે કાચો માલ ખરીદીને તેને જરી બનાવીએ અને થોડા દિવસોમાં ભાવ નીચે આવી જાય તો મોટું નુકસાન થઈ શકે છે. તેથી સુરતના મોટાભાગના જરી ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કરી દીધું છે. માત્ર 20-25 ટકા એકમોમાં ઉત્પાદન થઈ રહ્યું છે. જરી એસોસિયેશન ના અગ્રણીએ કહ્યું કે હોળીમાં અમે બે ત્રણ દિવસની રજા રાખતા હોઈએ છે. પણ આ વખતે અમે 10 દિવસ રજા રાખી છે.

# ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ: તપાસ અધિકારીની વધુ ઉલટ તપાસ મોકૂફ

સુરત

ચક્રચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધ મંગળવારે હાથ ધરવામાં આવેલી કેસ કાર્યવાહી દરમિયાન તપાસ અધિકારીની સરતપાસ બાદ આરોપીના બચાવપક્ષે ઉલટ તપાસ હાથ ધરી હતી. જે અધુરી રહેતા મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે વધુ સુનાવણી આવતી કાલે તા.24મી માર્ચ સુધી મોકૂફ રાખી છે. કામરેજ-પાસોદરાના બહુચર્ચિત એવા ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધ સ્પીડી ટ્રાયલની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આ કેસના તપાસ અધિકારીની સરતપાસ પુણે કર્યા બાદ આરોપીના બચાવપક્ષે ઉલટ તપાસ હાથ ધરી હતી.

# બિલ્ડિંગની ટેરેસનો ભાગ તટતાં 3 દટાયા, 2ના મોત: 77નું રેસ્ક્યુ

પાર્કિંગમા કાટમાળ પડતા 40થી વધુ વાહનોને નુકસાન

સુરત

સુરતના કતારગામમાં કિરણ હોસ્પિટલ પાસે આવેલા જરીવાલા કમ્પાઉન્ડ ખાતે સ્ટેન્ડિંગ રીંગ ખાતે બે માળની બિલ્ડિંગની અગાસીની ઉપર પ્રાઈવેટ ડીમોલેશનનું કામ ચાલતુ હતું. જ્યારે બિલ્ડિંગના પહેલા માળે ઓનલાઈન ટ્રેડિંગનું કામ ચાલતુ હતુ. તે સમયે અગાસીમાંથી દિવાલ સહિતનો ભાગ નીચે પાર્કિંગ એરીયા તથા પતરાના શેડ પર જોરદાર ધડાકા સાથે પડ્યો હતો. કોલ મળતા ચીફ ફાયર ઓફિસર બંસત પરીક સહિત ૧૦ અધિકારીઓ અને કતારગામ,

ધાંચી શેરી, કોસાડ ફાયર સ્ટેશનની ૩૦ ગાડીઓ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ધસી ગઈ હતી. કાટમાળ નીચે ત્રણ લોકો દબાઈ ગયા હતા. તેમને બહાર કઢાયા હતા. પણ બે વ્યક્તિ રોહિત રાજુ રાઠોડ અને સમીર મતીઉલ્લા મનીયારને સ્મીમરમાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તાહીર મોહમંદ એલી (૭-૧૮)ને સામાન્ય ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ટ્રેડિંગ સેન્ટરમાં ૭૭ લોકો કામ કરી રહ્યા હતા. તમામને લાશકરોએ સહીસલામત બહાર કાઢ્યા હતા.

# વર્ષ 2022-23માં ટેક્સ. નિકાસનો લક્ષ્યાંક ૬.૮ મિલિયન ડોલર

સુરત

સરકારે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે નક્કી કરેલો નિકાસ લક્ષ્યાંક ચાલુ વર્ષમાં કોસ થઈ જશે. સરકારે 6.1 મિલિયન ડોલરનો લક્ષ્યાંક આપ્યો હતો અને જાન્યુઆરી સુધીમાં 5.9 મિલિયન ડોલરની નિકાસ કરી છે. આવતા વર્ષે લક્ષ્યાંક વધારીને 6.8 મિલિયન ડોલરનો કરવામાં આવ્યો છે. સિન્થેટિક એન્ડ રેયોન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એસઆરટીઈપીસી) દેશમાંથી ટેક્સટાઈલ નિકાસને ઉત્તેજન મળે તે માટે દર વર્ષે એક્ઝિબિશન યોજાતી રહે છે. આ વર્ષે આવું એક એક્ઝિબિશન સોર્સ 2022ના નામે સરસાણા ખાતે યોજાયું હતું. આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી 50 થી વધુ એક્સીબિટર્સ ભાગ લીધો હતો એમ ચેરમેન ધીરેન્દ્ર શાહે જણાવ્યું હતું.

## ગોવર્ધનથાળ

### સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

<p><b>Weekend Special</b></p> <p>રગડા પેટિસ, પાંઉભાજી, છોલેપુરી, કટલેસ, ખાસ્તા કચોરી, સેવ ઉસળ, સમોસા ચાટ</p>	<p><b>Takeout &amp; Catering</b></p> <table style="width: 100%;"> <tr> <td style="width: 50%; text-align: center;"> <p>Limited થાળી (with sweet &amp; Farsan)</p> <p><b>\$9.00 +Tax</b></p> </td> <td style="width: 50%; text-align: center;"> <p>Limited થાળી (without sweet &amp; Farsan)</p> <p><b>\$7.50 +Tax</b></p> </td> </tr> </table>	<p>Limited થાળી (with sweet &amp; Farsan)</p> <p><b>\$9.00 +Tax</b></p>	<p>Limited થાળી (without sweet &amp; Farsan)</p> <p><b>\$7.50 +Tax</b></p>	<p><b>CATERING SPECIAL</b></p> <p><b>\$ 14.99</b> 10 items +Tax</p> <p>Sweet, Farsan, Subji, Kathor, Puri, Dal, Rice Papad, Pickle, Kachumber</p>
<p>Limited થાળી (with sweet &amp; Farsan)</p> <p><b>\$9.00 +Tax</b></p>	<p>Limited થાળી (without sweet &amp; Farsan)</p> <p><b>\$7.50 +Tax</b></p>			

**Franchise Opportunity in GTA**

**Call us for details**

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2





# ભાજપ ફરી ઈલેક્શન મોડમાં, સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં રણનીતિ નક્કી કરાઈ

પાસનાં આગેવાનોએ ખોડલધામના નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા અપીલ કરી

રાજકોટ

કોઈ પણ પક્ષ તરફ ઝુકી શકે તેવા તરલ મતો સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છની 58 બેઠકો પર હોવાની સંભાવના વચ્ચે ભાજપ હવે ફૂલ ઈલેક્શન મોડમાં આવી ગયું છે અને ચૂંટણીની તડામાર તૈયારી સૌરાષ્ટ્ર ખાતે કરી છે. 11 જિલ્લાઓના અગ્રીમ કાર્યકરો માટે રાજકોટમાં આજે ઝોન બેઠક યોજવામાં આવી હતી અને નેતાઓને ક્યા મુદ્દા પર કઈ રીતે પ્રચાર કરવા સહિતની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

પ્રદેશ ભાજપના મહામંત્રીઓએ બેઠક અન્વયે જણાવ્યું કે આગામી સમયમાં યોજનાર વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ ઘડાઈ છે અને મતદાન મથક વાઈઝ ટીફીન બેઠક, સક્રિય કાર્યકરોને કાર્ડ વિતરણ, વોલ રાઈટીંગ, બાઈક રેલી, વિશિષ્ટ લોકોને ભાજપ સાથે જોડવા, સાધુ સંતોને તિર્થધામોનો પ્રવાસ કરાવવા સહિતના કાર્યક્રમો થશે. તા.૬ એપ્રિલથી ભાજપના કાર્યકરોના ઘરે ઘરે ભાજપનો ધ્વજ લગાવવામાં આવશે.

ભાજપમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમો, પક્ષની બેઠકો માટે અગાઉ ટોપી તો હતી પરંતુ, હાલ માસ્કના નિયમની જેમ તેનું મોટાભાગે પાલન ન થતું અને ચલાવી લેવાતું હતું પરંતુ, હવે દરેક નેતાઓ, કાર્યકરોને કેસરી ટોપી ખાસ પહેરવા સૂચના અપાઈ છે. બીજી તરફ પાસનાં ઉત્તર ગુજરાતનાં આગેવાનોએ ખોડલધામની મુલાકાત લઈ ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવાની અપીલ કરી છે.

# દ્વારકાના મંદિરે ભાવિકોની ભીડ ભક્તો ઉત્સવના સાગરમાં ડુબ્યા

રાજકોટ

મહામારીમાંથી મુક્તિનો શ્વાસ લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકોએ આનંદોત્સવના સાગરમાં ડુબીને રંગોના ઉત્સવ ધુળેટીની મન મુકીને ઉજવણી કરી હતી. વર્ષમાં માત્ર એક વાર ધુળેટીના દિવસે બપોરના સમયે ખુલ્લા રહેતા દ્વારકાધીશના જગત મંદિરે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો તેમાં હેયે હેયુ દળાય તેવી ચિત્કાર ભીડ જામી હતી. મંદિર સંકુલમાં અબીલ ગુલાલની છોળો ઉડી અને કાળિયા ઠાકોરને સંગ લોકોએ ભાવ અને ભક્તિભેર અત્યંત ઉત્સાહથી ઉજવણીમાં જોડાયા હતા. આ ઉપરાંત

સૌરાષ્ટ્રના અન્ય અનેક મંદિરોમાં દોલોત્સવ ઉજવાયો હતો તો શહેરો-ગામોમાં આબાલવૃધ્ધ રંગે રમવા મોજથી નીકળી પડયા હતા.

દ્વારકાધીશના મંદિરે બપોરે દોઢ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર બાદ ઠાકોરજીની ઢોલ નગારા શરણાઈના સૂરો સાથે મહાઆરતી યોજાઈ હતી અને ત્યારબાદ કાળિયા ઠાકોરને ચાંદીની પિયકારીમાં કેસુડાના કેસરિયા રંગથી તથા શ્રીજીના હાથે અને લલાટે રંગ લગાવી ઉત્સવનો આરંભ થયો હતો, જય દ્વારકાધીશના નારાથી દ્વારકા ગુંજ ઉઠ્યું હતું અને અબિલ ગુલાલથી ભાવિકો આનંદભેર રંગાયા હતા.

## બાલાચડી સરકારી સૈનિક સ્કૂલમાં ભણી રિક્ષાચાલકનો પુત્ર હવે લેફ્ટેનન્ટ બનશે

નવસારી

જામનગરની બાલાચડી સરકારી સૈનિક સ્કૂલમાં 2014માં દાખલ થયેલો વડનગરના કહીપુરગામનો 17 વર્ષનો કેડેટ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હવે લશ્કરમાં લેફ્ટેનન્ટ તરીકે સેવા આપવા તાલીમ માટે પસંદગી પામ્યો છે. દેશની 30 સૈનિક સ્કૂલો પૈકીની 1961થી કાર્યરત બાલાચડી સૈનિક સ્કૂલે લશ્કરની ત્રણેય પાંખોને અત્યાર સુધીમાં સંખ્યાબંધ બહાદુર અને બાહોશ અધિકારીઓ આપ્યા છે. કહીપુરગામનો રીક્ષાચાલકનો પુત્ર હેમલ શ્રીમાળી ધો-6માં દાખલ થયા બાદ હવે તેણે UPSC પરીક્ષા પાસ કરીને દેશની સેનામાં લેફ્ટેનન્ટ તરીકે સેવા આપવા ખડકવાસલાની નેશનલ ડીફેન્સ એકેડમીમાં તાલીમ લેવાનું શરૂ કર્યું છે.

## રાજકીય અન્યાય સહિતના મુદ્દે 1 મેથી ક્ષત્રિયો અને રાજપૂતોની યાત્રા

રાજકોટ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ચૂંટણીના પડઘમ વગવા સાથે પાટીદાર સમાજના અગ્રણીના રાજકીય પ્રવેશના મુદ્દે સતત અટકળો અને ગઈકાલે કોળી સમાજની રાજકીય અન્યાયના મુદ્દે બેઠક ગઈકાલે યોજાઈ હતી. આજે કરણી સેના દ્વારા ગુજરાતમાં ગામે ગામ ધર્મસ્થળોએ તા.૧ મેથી એકતા યાત્રાનું આયોજન જાહેર કરાયું છે.

રાજકીય ક્ષેત્રે થતા અન્યાય અંગે ક્ષત્રિય-રાજપૂત સમાજમાં એકસૂત્રતા કેળવીને આગામી દિવસોમાં સમાજનું વલણ નક્કી કરવા, સમાજમાં એકતા સાથે કુરિવાજ નાબુદી કરી શિક્ષણ-વ્યવસાય ક્ષેત્રે

જાગૃતિ લાવવાના હેતુથી આગામી તા.૧ મેથી તા.૧૫ મે ગુજરાતભરમાં સૌથી મોટી રથ યાત્રાનું રાજપૂત કરણી સેના દ્વારા આયોજન કરાયાનું કરણી સેનાએ જણાવ્યું હતું.

આ યાત્રા ક્ષત્રિય સમાજના આસ્થા કેન્દ્ર આશાપુરા માતાજીનું મંદિર માતાના મઠ (કચ્છ)થી શરૂ થશે અને તેમાં રાજપૂત કુળદેવીઓની જ્યોત સાથે મોમાઈ મોરા, અંબાજી, સુરજ દેવળ, ચોટીલા, રાજકોટ, મોરબી, ગોંડલ, ખોડલધામ, ગાયત્રી આશ્રમ ગવેથડ, ઉમિયાધામ સીદસર, જુનાગઢ, ભવનાથ, કેશોદ થઈને સોમનાથ ખાતે પૂર્ણાહુતિ થશે.

## હોળી-ધુળેટી નિમિત્તે યાત્રાધામ ચોટીલામાં માનવ મહેરામણ ઉમટ્યું

ચોટીલા

યાત્રાધામ ચોટીલામાં ફાગણી પુનમ અને ધુળેટી પર્વ નિમિત્તે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માતાજીનાં દર્શનાર્થે ઉમટી પડયું હતું. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બે પીઆઈ અને ચાર પીએસઆઈ સહિત ૧૪૪ પોલીસકર્મીનો કાફલો ખડકી દેવાયો હતો. સૌરાષ્ટ્ર ગુજરાત સહિત વિવિધ રાજ્યો અને શહેરોમાંથી માતાજીના ચરણે શીશ ઝુકાવવા આશરે એક લાખ ભાવિકો ઉમટી પડયા હતા. યાત્રીકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ચોટીલા પોલીસે યુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ૨ પી.આઈ., ૪ પી.એસ.આઈ, ૫૦ હે-કો સહિત ૧૪૪ જેટલા કર્મચારીઓએ ખડપગે ફરજ બજાવી હતી.

# THANK YOU FRONTLINE WORKERS



**MORTGAGE DILIGENT**  
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

**5 Yrs Fixed @ 1.84%\* High Ratio Only**  
**5 Yrs Variable @ 1.15%\* High Ratio Only**  
**3 Yrs Variable @ 0.99%\* (Special Promotion)**



Rakesh Patel\*\*  
Vice President- Commercial.



Pranay Jani \*



Nilesh Tailor \*



Bala Shah\*



Vijay Rana\*



Rajesh Khurana, MBA  
Principal Broker

**Cell : 416-616-1300**

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Rates are subject to change without notice.\* FSCO#10252,OAC,E&O.E \* - Mortgage Agent, \*\* - Vice President

\* Some conditions apply



## રાજકોટમાં પ્રેમિકાની હત્યા કરી એસિડ પીનારા પ્રેમીનું પણ મોત

જેમિશે યુવતીની માતાને ફોન ઉપર કહ્યું કે, 'મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે, હું પણ આપઘાત કરું છું'

રાજકોટ ગત તા. ૩ માર્ચના રોજ રાજકોટના કરણસિંહજી મેઈન રોડ પર આવેલી હોટલ નોવા બ્યુટીકમાં એક યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું અને તેની સાથે રહેલા યુવકે એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સારવાર દરમિયાન આરોપી પ્રેમી જેમિશનું પણ મોત થયું હતું. કેસમાં થયેલા ખુલાસા પ્રમાણે યુવકે જ પોતાની પ્રેમિકા એવી યુવતીની હત્યા કરી હતી અને પછી એસિડ ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે આ કેસમાં યુવક સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

રાતના સમયે એક વ્યક્તિએ હોટેલ પહોંચીને પોતાનો ભાઈ જેમિશ આ હોટેલમાં રોકાયો છે અને તેણે ઝેરી દવા પી લીધી છે તેમ જણાવ્યું હતું. આ સાંભળીને હોટેલનો સ્ટાફ તેઓ જ્યાં રોકાયા હતા તે રૂમ તરફ દોડી

ગયો હતો અને ડુપ્લીકેટ ચાવીની મદદથી દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાં જ જેમિશની ગંભીર સ્થિતિ અને બાજુમાં એક યુવતીનો મૃતદેહ જોવા મળ્યા હતા. ત્યાર બાદ હોટેલના સંચાલકે આ મામલે પોલીસને જાણ કરી હતી અને જેમિશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમિશે ધ્રુવાના પિતાને ફોનમાં મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે અને હવે હું પણ આપઘાત કરી રહ્યો છું તેમ કહ્યું હતું. આ કારણે ધ્રુવાના પરિવારજનો પણ રાજકોટ દોડી આવ્યા હતા. રાજકોટના ઝોન-૨ DCP મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે જેમિશ અને ધ્રુવા છેલ્લા ૨ વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. ૩ માર્ચના રોજ તેઓ બંને સાથે જ હોટેલમાં ગયા હતા. સવારે ૧૦:૩૦ વાગતા સુધીમાં જેમિશે લોકરની પટ્ટી વડે ગળેટૂંપો આપીને ધ્રુવાની હત્યા કરી નાખી હતી અને કલાકો સુધી ત્યાં જ બેસી રહ્યો હતો.

## જામનગરમાં નૌસેનાના જહાજ વાલસુરાને રાષ્ટ્રપતિ સન્માન મળશે

જામનગર ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ ક્લર એવોર્ડથી સન્માનિત કરાશે. ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઈન્ડિયન નવલ શિપ (INS) વાલસુરાને ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ ક્લર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે ૧૫૦ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે આદરણીય રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સર્ધન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી તેમજ અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે.

## કોળી તેમજ ઠાકોર સમાજને ૨૦ ટકા અનામત આપો : આગેવાનો

કોળી-ઠાકોર વિકાસ નિગમને ૧૦૦૦ કરોડનું ફંડ ફાળવો, આગામી તા. ૩ એપ્રિલે ગાંધીનગરમાં ચિંતન બેઠક મળશે

રાજકોટ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર સમાજે પોતાનું સંગઠન મજબૂત બનાવવાનો પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે પાટીદાર સમાજ કરતા પણ વધુ જનસંખ્યા ધરાવતા કોળી અને ઠાકોર સમાજનાં લોકોએ પણ એકતા મજબૂત બનાવવા કવાયત હાથ ધરી છે. આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર - ગુજરાતનાં કોળી સમાજનાં આગેવાનોની એક બેઠક મળી હતી તેમાં ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો હોવાનો મૂદો ઉઠાવી આગામી દિવસોમાં દરેક જિલ્લામાં સંમેલન અને તા. ૩ એપ્રિલે ગાંધીનગરમાં ચિંતન બેઠક મળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજકોટમાં મળેલી બેઠકમાં હાજરી આપનાર આગેવાનોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની વસતી ૩૨ ટકા જેટલી છે પરંતુ સંગઠન મજબૂત ન હોવાનાં કારણે તેમજ શિક્ષણનાં અભાવને કારણે રાજકીય

સહિતનાં ક્ષેત્રોમાં પુરતું પ્રતિનિધિત્વ મળતું નથી. આજની બેઠકમાં એવી ચર્ચા કરવામાં આવી હતી કે ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની કુલ જનસંખ્યાનાં આધારે રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને આગામી દિવસોમાં જે રાજકીય પક્ષ સમાજની સાથે રહેશે સમાજ તેની સાથે રહેશે. સમાજમાં એકતા લાવવા માટે દરેક જિલ્લામાં સંમેલનો મળશે અને આગામી તા. ૩ એપ્રિલે ગાંધીનગરમાં ચિંતન શિબિર યોજાશે તેમાં આખા ગુજરાતમાંથી આગેવાનો આવશે. ગુજરાતમાં કોળી અને ઠાકોર વિકાસ નિગમને અન્ય નિગમોની સરખામણીમાં ઓછું ફંડ ફાળવવામાં આવે છે સરકાર આ નિગમને રૂ. ૧૦૦૦ કરોડનું ફંડ ફાળવે અને સરકારી નોકરીઓમાં ઓબીસીની સાથે નહિ પરંતુ અલગથી ૨૦ ટકા અનામત આપે અને હોસ્ટેલ માટે જમીન ફાળવવામાં આવે તેવી માગણી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.

## ૨૦૨૬ને માલધારી વર્ષ તરીકે ઉજવવા અંગેની દરખાસ્તનો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સ્વીકાર

વિશ્વના ૧૦૩ દેશોની ૩૦૨ માલધારી સંસ્થાઓએ ઉજવણીને ટેકો આપ્યો હતો

સંયુક્ત રાષ્ટ્ર સંઘ ૨૦૨૬ માલધારી વર્ષ તરીકે ઉજવવા આવે જેના માટે મોંગોલિયા સરકારે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં દરખાસ્ત મુકેલ જેમા ૧૦૩ વિશ્વના માલધારી દેશો ૩૦૨ વિશ્વની માલધારી સંસ્થાઓએ સમર્થનમાં પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. જેમાં એશિયાના ૮ માલધારી દેશોએ પણ સમર્થન આપ્યું હતું. ભારત દેશમાં ૧૪ માલધારી રાજ્યમાં ગુજરાત રાજ્યના માલધારીઓના પ્રદેશ ગણાતા બન્ની ભેંસ જેવી અમુલ્ય ધરોહરથી જાણીતા બન્ની વિસ્તારમાંથી વર્ષ ૨૦૨૧ના જાન્યુઆરીની તારીખ ૯થી ૧૧ દરમિયાન ત્રિદિવસીય ગૌરવ યાત્રા બન્ની

પશુ ઉછેરક માલધારી સંગઠનના નેતૃત્વરૂપી દેશની પ્રથમ સમર્થન યાત્રાની શરૂઆત કરાઈ હતી. જેમાં સંગઠનના સભ્યો અને સૌ માલધારીઓએ હોશભેર ભાગ લીધો હતો. આ માંગણીને ભારત સરકારે પણ સમર્થન આપી સુર પુરાવી અને સંયુક્ત રાષ્ટ્રીય સંઘ પાસે પ્રસ્તાવમાં ટેકનો આપ્યો હતો. જે માંગણી બન્નીથી શરૂઆત થતા અને ભારત સરકારના સમર્થન અને સંયુક્ત રાષ્ટ્રસંઘના હકારાત્મક વલણથી ૨૦૨૬ના વર્ષને માલધારી તરીકે ઉજવવા તરીકેની દરખાસ્ત સ્વીકારાઈ હતી. આ વાતની જાણ થતાં સંગઠનના હોદ્દેદારો કારોબારી સભ્યો તમામ માલધારીઓ આનંદની લાગણી અનુભવી છે.

## સાળંગપુર ધામમાં ૩૫ વર્ષ બાદ સંતોના સાનિધ્યમાં રંગોત્સવની રંગેચંગે ઉજવણી

બોટાદ યાત્રાધામ સાળંગપુરધામમાં પહેલીવાર ભવ્ય રંગોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે મંગળા આરતી, શણગાર આરતી, સંધ્યા આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે અત્રે પંચરંગી વાદ્ય સહિત અલગ-અલગ ફૂલ અને પાનનું ડેકોરેશન પણ કરાયું હતું. દાદા સમક્ષ વિવિધ રંગ, પિયકારી પણ મૂકવામાં આવી હતી. આ અવસરે બે હજાર કિલોથી વધુ રંગનો વારાફરતી બ્લાસ્ટ કરાયો હતો.



લોખંડની પાઈપમાં ૩ કિલોથી વધુ રંગ ભરીને બ્લાસ્ટ કરાયેલો રંગ ૭૦ ફૂટ સુધી ઊંચે ઉડતાં આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મંદિરના પરિસરમાં ૨૫ હજારથી વધુ અલગ-અલગ ચોકલેટ પણ હરિભક્તો પર ઉડાડવામાં આવી હતી. અમદાવાદ, સુરત

અને બોટાદ સહિતના હરિભક્તોએ ૨ હજારથી વધુ કિલો મોકલાવેલાં કુંકુ, અબીલ સહિતના ઓર્ગેનિક રંગ દાદાને અર્પણ કરી રંગને સંતો દ્વારા હરિભક્તો પર ઉડાવી ઉજવણી કરવામાં આવી હતી. દરેક હરિભક્તોને પ્રસાદીના રંગથી રંગવામાં આવ્યા હતા.

# Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

**24 Hour Service • 7 Days a Week**

Preventing the Spread of COVID-19 :  
Our disinfectant services that we offer are:

**1 Spray Services**

**2 Fogging Services**

**3 Sanitation Services**

**All Pest Control:**

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.  
Total Interior & Exterior Pest Control

**Removal:**

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

First Time Customer gets

**10% Off**

on your first home service

\*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca  
info@imperialpestcontrol.ca  
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

**સ્વદેશ CANADA**

Registration # 869127209  
Publication Mail Agreement /  
Email : info@swadesh.news

**WWW.SWADESH.NEWS**

Return Undeliverable Canadian Address To :

**Shree Balaji Inc.**

**MAILING ADDRESS**

23 Lyric Road,  
Brampton ON L6S 0B4.  
416-996-7755

**Registered Address**

713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi	Designed By
Director : Nilesh Tailor	Sabir Daroga
Sub Editor : Chhaya Gandhi	Mevada Piyush
Montreal Bureau : Vijay Patel (514-826-7442)	Firoz Shaikh
<b>GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT ( INDIA)</b>	





# EDની મોટી કાર્યવાહી : સાંડેસરા બંધુઓની વધુ 20.77 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

વડોદરા

ઈડી દ્વારા વડોદરાના ઉદ્યોગપતિ સાંડેસરા બંધુઓની સામે વધુ એક વખત કાર્યવાહી કરીને તેમની વધુ ૨૦.૭૭ કરોડ રૂપિયાની પાંચ સંપત્તિ ટાંચમાં લીધી છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ થયેલી કાર્યવાહીના ભાગરૂપે જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમાં પાંચ બેન્ક એકાઉન્ટ, શેર તેમજ પાંચ સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. આ તમામની કુલ કિંમત ૨૦.૭૭ કરોડ હોવાનું ઈડીએ જણાવ્યું છે.



વડોદરા ખાતે સ્ટર્લિંગ ગુરુપની કંપનીઓના માલિક સાંડેસરા બંધુઓની ૧૪૫૪૩ કરોડ રૂપિયાની સંપત્તિ અત્યાર સુધીમાં ઈડી ટાંચમાં લઈ ચુકી છે. ઈડીનું કહેવું છે કે, ભવિષ્યમાં હજી બીજી કેટલીક સંપત્તિઓને ટાંચમાં લેવા માટે

કાર્યવાહી કરવામાં આવશે.

મની લોન્ડરિંગના કેસમાં નીતિન સાંડેસરા, તેમના ભાઈ ચેતન સાંડેસરા તથા તેમના પત્ની દિપ્તી સાંડેસરા અને પરિવારના અન્ય એક સભ્ય હિતેશ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવેલા છે. તેમને વિદેશથી પાછા લાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે તેવું સરકારનું કહેવું છે. કેસમાં અત્યાર સુધી પાંચ ચાર્જશીટ ફાઈલ થઈ ચુકી છે. આ કેસમાં આંધ્ર બેન્ક સહિતની બેન્કો સાથે લોનની ૧૬૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ સ્ટર્લિંગ ગુરુપના સાંડેસરા બંધુઓ પર મુકાયેલો છે.

# મહેસાણામાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ રાખવા 9 દિવસમાં નિયમ બનાવાયા

મહેસાણા

સુપ્રિમકોર્ટના આદેશ અનુસાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ અને વન મંત્રાલયે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણમાં રાખવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. તેનો અમલ કરવા તાકીદ કરતું જાહેરનામું બનાવીને સંતોષ માન્યો છે.

મહેસાણા જિલ્લામાં અમલવારી માટે અધિક કલેક્ટર ઇન્ડ્રજીતસિંહ આર.વાળા ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂએ મહેસાણા જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા આદેશ કર્યો છે. રાત્રે ૧૦ થી

સવારના ૬ વાગ્યા સુધી હોર્ન , ધ્વનિ પ્રદૂષણ પેદા કરતા બાંધકામ અંગેના સાધનો, ફટાકડા ફોડવા, લાઉડ સ્પીકર અને વાજીંત્રો વગાડવા ઉપર પ્રતિબંધ છે. જાહેર સ્થળોમાં લાઉડ સ્પીકર સિસ્ટમનો તથા અન્ય સાધનોથી ઉત્પન્ન થતા અવાજની માત્રા જે તે વિસ્તારની નિયત માત્રા કરતાં ૧૦ ડીબી ( એ ) થી વધવી ન જોઈએ. ખાનગી સ્થળોમાં નિયત માત્રા કરતાં ૫-ડીબી ( એ ) થી વધવી ન જોઈએ. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધામક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે.

# સરકાર દ્વારા ચાણોદ, આજવા અને નારેશ્વર પાસે વડ વનનો ઉછેર કરાશે

વડોદરા

વન વિભાગને માધ્યમ બનાવીને આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીની યાદગીરી રૂપે વડના વૃક્ષોની ૭૫ વાટિકાઓ રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ઉછેરવાનું આયોજન કર્યું છે. આ વાટિકાઓ નમો વડ વન નામે ઓળખાશે. સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાએ જિલ્લામાં ત્રણ જગ્યાએ નમો વડ વન ઉછેરવાનું આયોજન કર્યું છે. વડોદરાના નામ સાથે આ વૃક્ષ જોડાયેલું છે અને મહારાજા સયાજીરાવ મહારાજે ગાયકવાડી ગામોમાં જે પાંચ વૃક્ષોના ઉછેરને અગ્રતા આપી હતી. તેમાં વડનો સમાવેશ થાય છે. આજે પણ જીએસએફસીનો લગભગ બસો વર્ષની ઉમરનો ઘેઘૂર વડલો તથા વડોદરામાં ઘણી જગ્યાએ આવેલા વિશાળ વડલા વડોદરાના વડ પ્રેમીની ગવાહી આપે છે.

# ખોટું સોગંદનામું રજૂ કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય સામે ફરિયાદ

નાથા પટેલે ચૂંટણીના ફોર્મમાં મિલકત સંબંધીત હકીકતો છુપાવી હતી

પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ધાનેરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નાથાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેમને રજૂ કરેલ સોગંદનામુંમાં મિલકત સંબંધી વિગતો છુપાવી ખોટું હોવાની ફરિયાદો ઊઠી છે. જે અંગે જાગૃત નાગરીકે ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરતા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે આ અંગે ધારાસભ્ય નથાભાઈ પટેલને નોટિસ આપી ખુલાશો માગ્યો હતો.

જેને લઈ ધારાસભ્યે ચૂંટણી અધિકારીને ખુલાશો રજૂ કર્યો હતો. જે ખુલાશો ઈલેક્શન કમિશનમાં રજૂ કરવામાં આવતા ઈલેક્શન કમિશને ધારાસભ્ય નથાભાઈ પટેલને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૨૫ની કલમ હેઠળ મિલકત સંબંધી ખોટું સોગંદનામું રજૂ કરવા બદલ તેમની સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી એફ.એ. બાબીએ ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

# સાવલી તુલસીપુરાના સરપંચને ધમકી, જેલથી છૂટી તારું મર્ડર કરી નાખીશ

વડોદરા

સાવલી તાલુકાના તુલસીપુરા ગામના સરપંચ મહેશ બાબુભાઈ તળાવીયા ધુળેટીના દિવસે રાત્રે તેમના કુટુંબી ભાઈ નવીનભાઈના ઘેર બેઠા હતા. ત્યારે ગામમાં રહેતા સંદીપ રોહિતભાઈ તળાવીયાએ ફોન કરી સરપંચને જણાવેલ કે મારા મિત્રોને તે હોળીના દિવસે જેલમાં કેમ પુરાવ્યો હતો તેમની ઉપર બળાત્કારનો કેસ કેમ લખાવે છે. આ વખતે સરપંચે જણાવેલ કે આવો કોઈ કેસ લખાવ્યો નથી. હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ તેમ જણાવતા સંદીપે સરપંચને ધમકી આપી હતી કે તું મારી વિરુદ્ધ ફરિયાદ કર. મને એક મહિનો જેલમાં રાખશે અને હું જેલમાંથી છૂટીને આવીશ ત્યારે તારું મર્ડર કરી દઈશ. મારી આગળ-પાછળ કોઈ નથી.

# ડાકોર મંદિરે ૩ લાખથી વધુ શ્રદ્ધાળુ ઉમટયા, ૧૬૦થી વધુ ધજા ચઢાવાઈ

સવારે ૪.૪૫ વાગ્યેથી જ રણછોડરાયના દર્શન માટે શ્રદ્ધાળુ ભક્તોના ટોળા નડિયાદ

યાત્રાધામ ડાકોરના રાજા રણછોડજીનો ફાગણ સુદી પૂર્ણિમાનો ઐતિહાસિક મળો ભરાયો હતો. આ અવસરે પદયાત્રી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. જેને કારણે અમદાવાદથી ડાકોરનો મુખ્ય માર્ગ અને ડાકોર નગર રણછોડમય બન્યું હતું. વહેલી સવારે ૪.૪૫ વાગ્યે મંગળા આરતી ટાણે રાજા રણછોડના દર્શન માટે શ્રદ્ધાળુ ભક્તોનો ભારે ધસારો થયો હતો. યાત્રાળુઓ સવારે શણગાર આરતી અને ત્યારબાદના સમયગાળામાં દર્શન માટે ઉમટયા હતા. પૂનમના દિવસો દરમ્યાન અંદાજે સાડા ત્રણ લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથના દર્શન માટે શિષ નમાવી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ડાકોર મંદિરે ફાગણી પૂનમના મેળા દરમિયાન ગુરૂવાર



સાંજ સુધીમાં ૧૬૦થી વધુ ધજા ચઢાવાઈ હતી. બે વર્ષના લાંબા અંતરાય પછી ફાગણી પૂનમે શ્રીજીના દર્શનના આનુર ભક્તો સંતોષ અને આનંદથી દર્શન કર્યા હતા. લાખો શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે મંદિર કમીટી દ્વારા ડાકોરજીના દર્શન ૫ કલાક વધુ ખુલ્લા રાખવામાં આવ્યા હતા.

# બહુચરાજી-શંખલપુર મંદિરે માઈ ભક્તોનું ઘોડાપુર

ચાણસા

યાત્રાધામ બહુચરાજી અને શંખલપુર ખાતે હોળી-ધુળેટીના પવિત્ર તહેવાર નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે ઉમટી પડયા હતા. તેમજ શુક્રવારે પૂનમની રાત્રે બાલા બહુચરની બે વર્ષ બાદ નગર પરિભ્રમણે નીકળેલી પાલખીમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જોડાઈ બોલ માડી બહુચર જય જય બહુચરના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગજવી મૂક્યું હતું. બહુચરાજીમાં શુક્રવારના



રોજ ફાગણ સુદ પૂર્ણિમાને માઈભક્તો વાહનો લઈને તો લઈ વહેલી સવારતી જ ૨૫ થી વધુ પગપાળા યાત્રા માઈભક્તોનો પ્રવાહ મા સંઘો ડાઘમાં માની ધજા અને રથ ખેંચીને માના ધામમાં પહોંચ્યા હતા. માઈ મંદિરના શિખરે પૂનમે ૧૦૦થી વધુ ધજા ચઢાવાઈ હતી.



**First Flight**  
FFCL Couriers Inc.

દુનિયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

<p>1 LB \$20 વધુ દર LB ના \$6 11 LB \$55 વધુ દર LB ના \$6 23 KG \$185, વધુ દર KG ના \$10 30 KG \$230, વધુ દર KG ના \$10</p>	<p>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</p>
---	---

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

<p><b>Brampton (West)</b> 519, Ray lawson boulevard , Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, ATN Wireless Board Door Open Last Unit Ours Phone 647-761-1317, 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 7.00 PM : SAT-SUN : 1.00 PM to 6.00 PM</p>	<p><b>Scarborough</b> WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road &amp; Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-THU : ----- 2.00 PM to 7.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 11.00 AM to 6.00 PM</p>	<p><b>Mississauga</b> WE MOVED TO 6800 REXWOOD ROAD, UNIT - D : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: MON-FRI : ----- 9.30 AM to 5.00 PM</p>
---	---	--

૬૪૭-૭૬૧-૧૩૧૭ [www.firstflightcanada.com](http://www.firstflightcanada.com)





## અલ્લુ અર્જુન બોલીવૂડમાં ડેબ્યુ કરે તેવી અટકળ

મુંબઈ : સંજય લીલા ભણશાલી સાથે કામ કરવા માટે ભાગના સ્ટાર્સ ઉત્સુક હોય છે. હાલમાં જ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને સંજય લીલા ભણશાલીની ઓફિસ બહાર ખેવા મળ્યો હતો આ પછી તેના વિશે મનોરંજનની દુનિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. અલ્લુ અર્જુન બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે તેવી અટકળ લોકો લગાવી રહ્યા છે. અલ્લુ અર્જુન છેલ્લે દક્ષિણની ફિલ્મ પુષ્પામાં ખેવા મળ્યો હતો. આ ફિલ્મથી અભિનેતા રાતોરાત સ્ટાર બની ગયો છે. તેના ડાયલોગ બોલવાના અંદાજને લોકોએ બહુ પસંદ કર્યો હતો.



# સ્વદેશ

FRIDAY, 25 MARCH, 2022

09

## અભિનય પ્રત્યે ધ્યાન આપવા પોતાના જ નિર્માણ હાઉસનું કામ છોડ્યું

મુંબઈ: અનુષ્કા શર્મા પોતાના ભાઈ સાથે મળીને પોતાના પ્રોડક્શનહાઉસ ક્લીન સ્વેટ ફિલ્મ્સ સાથે સંકળાયેલી હતી. પરંતુ હવે તે પોતાના નિર્માણહાઉસથી છૂટી થઈ ગઈ છે. માતાબન્યા પછી અનુષ્કા અભિનય ક્ષેત્રે મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીની બાયોપિકથી કમબેક કરવાની છે. અનુષ્કા શર્માએ સોશયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, મેં અને મારા ભાઈ કર્ણેશ શર્માએ જ્યારે ક્લીન સ્વેટ ફિલ્મ્સની શરૂઆત કરી હતી, ત્યારે અમારો એક માત્ર અજન્ડા દર્શકોનું મનોરંજન કરવાનો હતો. આજે જ્યારે હું 'ભૂતકાળમા' ડોકિયું કરીને અમે આપેલા કાર્યોને જોઉં છું તો મને ગર્વ થાય છે. આજે માતા બન્યા પછી મેં મારી અભિનયની કારકિર્દીને મહત્વ આપવાનો નિર્ણય કર્યો છે. હું હવે સંપૂર્ણપણે એક્ટિંગ પ્રત્યે જ ફોકસ કરવા માંગુ છું. અનુષ્કાએ સાલ ૨૦૧૩માં પોતાનું પ્રોડક્શનના હાઉસ શરૂ કર્યું હતું. જેના હેઠળ તેણે સાલ ૨૦૧૫માં એનએચ ૧૦, ફિલ્મોરી, પરી અને બુલબુલ જેવી ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત તેણે વેબ સીરીઝ પાતાલ લોક પણ પ્રોડ્યુસ કરી છે. માર્ચ અને કાલા જેવી ફિલ્મો પણ તેના નિર્માણહાઉસ હેઠળ સામેલ છે. કાલા ફિલ્મથી સ્વ. ઈરફાન ખાનનો પુત્ર ડેબ્યુ કરવાનો છે.



ગલીબોય ફ્રેમ રેપર અમસી તોડફોડનું 24 વર્ષની વયે નિધન



ગલી બોય ફ્રેમ રેપર ધર્મેશ પરમાર ઉર્ફે અમસી તોડફોડનું ૨૪ વરસની વયે નિધન થઈ ગયું છે. એક રિપોર્ટના અનુસાર તે અનેક બીમારીથી પીડાતો હતો, ઉપરાંત તેને રવિવારે સ્ટ્રોક પણ આવ્યો હતો જે જીવલેણ નીવડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ધર્મેશે ગલી બોયમાં ગીત ઇન્ડિયા લવને કંઈ આપ્યો હતો. ધર્મેશના અવસાનની જાણકારી તેના બેન્ડ સ્વદેશી મૂવમેન્ટએ સોશયલ મીડિયા પર આપી છે. આ સમાચાર સાંભળતાં જ ગલી બોયના લીડ એક્ટર રણવીર સિંઘ, કો-સ્ટાર સિદ્ધાંત ચતુર્વેદી અને ડાયરેક્ટર ઝોયા અપ્તે શોક વ્યક્ત કર્યો હતો. રણવીરે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પરથી ધર્મેશની તસવીર પર ટૂંકા દિલવાળું ઇમોજી ખેડ્યું હતું. જ્યારે ઝોયાએ તોડફોડની એક જુની તસવીર શેર કરીને લખ્યું હતું કે, તું બહુ જલદી જતો રહ્યો. હું આભારી છું કે રસ્તામાં આપણો સાથ રહ્યો હતો. રેસ્ટ ઇન પીસ.

## Pre-Oscar ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા બાલા અવતારમાં

મુંબઈ: બોલીવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપરા માત્ર તેની એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેની સ્ટાઈલ માટે પણ જાણીતી છે. પ્રિયંકા તમામ પ્રકારના આઉટફિટ્સમાં ખૂબસૂરત લાગે છે. આ સાથે પ્રિયંકા ચોપરાને કયા પ્રસંગે કેવા પ્રકારના આઉટફિટ પહેરવા જોઈએ તે માટે અભિનેત્રી આઉટફિટ કેરી કરે છે. તેનો આત્મવિશ્વાસ દેખાઈ આવે છે અને જો વાત સાડીની હોય તો કહેવું જ શું? આવી જ રીતે જ્યારે પ્રિયંકા બ્લેક સાડીમાં Pre-Oscar ઇવેન્ટ પાર્ટીમાં પહોંચી તો બધા તેની સામે જ જોતા રહી ગયા હતા. સાઉથ એશિયન એક્સલન્સ ફિલ્મ્સની Pre-Oscar ઇવેન્ટ પાર્ટીમાં પ્રિયંકા ચોપરા ભારતીયતાના રંગોમાં રંગાયેલી જોવા મળી હતી. બ્લેક કલરની સાડીમાં દેશી ગર્લ બાલા સુંદર લાગી રહી હતી. સાડી સાથે સ્ટ્રેપલેસ બ્લાઉઝ કેરી કર્યું હતું. આ પાર્ટીને મિંડી કાલિંગ, કુમૈલ નાનજિયાની, અંજુલા અચારિયા, બેલા બાજરિયા, મનીષ કે ગોયલ અને શ્રુતિ ગાંગુલી દ્વારા કો-હોસ્ટ કરવામાં આવી હતી.

## ફિલ્મ RRR રિલીઝ પહેલાં જ સિનેમાગૃહમાં સુરક્ષા વધારાઈ



બાહુબલી ફેમ ડાયરેક્ટર એસ એસ રાજામૌલીની ફિલ્મ RRR 25 માર્ચે સિનેમાગૃહોમાં ધુમ મચાવવા આવી રહી છે. આ ફિલ્મમાં સાઉથનાં બે સુપરસ્ટાર જોવા મળશે જેને લઈને ફેન્સમાં ઉત્સાહ વધી ગયો છે. ફિલ્મના રિલીઝને લઈને પણ તૈયારીઓ ચાલી રહી છે. થિયેટરમાં આ ફિલ્મનાં રિલીઝને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે. જે જાણીને તમને નવાઈ લાગશે. થિયેટરમાં સ્ક્રીનની સુરક્ષાને લઈને થિયેટરનાં માલિકોએ એક નિર્ણય લીધો હતો, આ નિર્ણયનાં પગલે સ્ક્રીનની સામે બિલીઓ લગાવવામાં આવી છે. જેથી લોકો એક્સાઈમેન્ટમાં સ્ક્રીનનેકોઈ નુકશાન ન પહોંચાડી શકે. એક જાણકારી પ્રમાણે, વિજયવાડાના વેકેટેશ્વરલુ અન્નપૂર્ણા થિયેટરમાં સ્ક્રીનની સામે બિલીઓ નાંખવામાં આવી છે. ટૂવીટર પર થિયેટરનાં અંદરનાં ફોટો વાયરલ થઈ રહ્યાં છે. સાઉથની ફિલ્મમાં ત્યાંના ફેન્સ દ્વારા સ્ક્રીન સામે ચઢી જવું અને અભિનેતાના પોસ્ટરને દૂધથી નવડાવવું એ આમ વાત છે. આ બાબત પર થિયેટરનાં પ્રભારીને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, આ કરવાનું એકમાત્ર કારણ એ છે કે, લોકો ઉત્સાહિત થઈને મંચ પર ચઢી ન જાય અને સ્ક્રીનને નુકશાન ન પહોંચાડે. આ ફિલ્મ 25 માર્ચે વિશ્વભરમાં 2D સાથે 3Dમાં પણ રિલીઝ થશે.

## ફિલ્મ 'RRR'નું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રમોશન

નવી દિલ્હી: ભારતના જાણીતા ફિલ્મમેકર એસએસ રાજામૌલી ફિલ્મના જબરદસ્ત પ્રમોશન માટે મલ્ટી-સિટી ટૂરનું આયોજન કર્યું હતું. ફિલ્મની સમગ્ર કાસ્ટ ભારતના પ્રવાસે નીકળી હતી, જેમાં દિગ્દર્શક એસએસ રાજામૌલી અભિનેતા જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે બેંગ્લોર, હૈદરાબાદ અને દુબઈ પછી હવે વડોદરામાં 'સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાત લીધી હતી. રસપ્રદ વાત એ છે કે, આની સાથે જ 'RRR' ફિલ્મ ભારતના ઐતિહાસિક સ્મારકોના પ્રવાસ કરનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે.

**GUARANTEED ACCESS TO PRE-CONSTRUCTION CONDOS IN DOWNTOWN TORONTO & GTA CALL ME NOW!**

**BUY • SELL • INVEST**

**Nadir Shah**  
100% Professional, 0% Attitude Sales Representative  
MBA, ACEA (UK)

**416.625.3580**  
nadir.shah@sympatico.ca

4030, Sheppard Ave. East, Toronto, ON M1S 1S6  
T: 416.291.0929 (24/7) F: 416.291.0984

**CENTURY 21**  
Regal Realty Inc. Brokerage  
Member Broker

Not intended to solicit buyers or sellers already under a contract.





હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

[www.swadesh.news](http://www.swadesh.news)

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

[info@swadesh.news](mailto:info@swadesh.news)

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

ભારતમાં રકતરંજિત રાજ્ય તરીકે કેરળ અને પશ્ચિમ બંગાળ સતત વગોવાયા

# બંગાળમાં મમતારાજમાં માનવતા ફરી શર્મસાર

ભારતના પૂર્વોત્તરમાં આવેલું પશ્ચિમ બંગાળ પહેલાથી જ લોહીયાળ રાજકારણનો ઈતિહાસ ધરાવે છે. આ રાજ્યમાં નાની નાની ચૂંટણીઓમાં પણ મોટી હિંસા અને હત્યાના બનાવો સામાન્ય છે. ડાબેરીઓને પછડાટ આપીને મમતા બેનરજીએ જ્યારે બંગાળની કમાન સંભાળી ત્યારે રાજ્યના નિર્દોષ નાગરિકો અને દેશને આશા હતી કે, મમતા હવે બંગાળની સુરત અને દીશા બંને બદલશે. પરંતુ આજે 3 વખતની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પણ મમતા બંગાળમાં આ મામલે કશું જ પરિવર્તન લાવી શકી નથી. ઉલ્ટું મમતાની ટીએમસી પાર્ટીના કાર્યકરો જ હિંસા, હત્યા, મારપીટ જેવા ક્રિસ્ટાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે જ દેશમાં બંગાળ અને ખુદ મમતાની છબી ખરડાઈ રહી છે. મમતા બેનરજી ઘણાં સમયથી રાષ્ટ્રીય સ્તરે ભાજપને પછડાટ આપવાની મથામણ કરી રહ્યા છે. પરંતુ રાજ્યમાં સતત હિંસાને કારણે હવે મમતાનો પ્રભાવ બંગાળ પુરતો જ સીમીત રહેશે તે નક્કી છે.

બંગાળના બીરભૂમ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા ભાદુ શેખને હુમલાખોરોએ બોમ્બ ફેંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના બાદ ભડકેલા તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ રમખાણ મચાવીને ખૂનામરકી કરી નાંખી છે. શેખની હત્યા રાજકીય અદાવતમાં કરાઈ હોવાની શંકા રાખીને તૃણમૂલના કાર્યકરોએ પહેલાં બહાર તોડફોડ કરીને એક વ્યક્તિની હત્યા કરી નાંખી અને પછી રાજકીય હરીફના ઘર પર હલ્લાબોલ કરી દીધું. આ ટોળાને જોઈને ઘરનાં લોકો ઘરને અંદરથી બંધ કરીને બેસી ગયાં તો તૃણમૂલના કાર્યકરોએ પાંચ ઘરને બહારથી બંધ કરીને આગ ચાંપી દીધી. આ આગમાં 12 લોકો જીવતા જ ભડથું થઈ ગયાં. મંગળવાર સુધીમાં 12 લોકોના સાવ બળી ગયેલા મૃતદેહો મળ્યા હતા.

એકસામટાં આટલા લોકોને ઘરમાં બંધ કરીને સળગાવી નાંખવા એ અત્યંત ઘૃણાસ્પદ ઘટના છે. રાજકારણમાં હરિકો હોય, હારજીત થાય પરંતુ જીવતા લોકોને આગને હવાલે કરવા સુધીની નોબત કોઈપણ સમાજ, ધર્મ કે, દેશ માટે શરમજનક બાબત છે. વળી, આ ઘટના બાદ જરા પણ શરમ ન હોય તેમ મમતા બેનરજીની સરકાર ઢાંકપિછોડો કરવામાં લાગી છે. એક તરફ મમતાએ આ હત્યાકાંડને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી એવી સફાઈ મારી તો બીજી તરફ ત્રણ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) બનાવી તપાસને નામે પણ



તરકટ કર્યું. મમતાએ જે સીટની રચના કરી તેના વડા તરીકે પાછા વગોવાયેલા જ્ઞાનવંતસિંહની નિમણૂક કરી. મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીનો પગ કુંડાળામાં પડ્યો છે એ કોલસા કૌભાંડમાં જ્ઞાનવંત પણ સંડોવાયેલા હોવાનું કહેવાય છે. સીબીઆઈ કોલસા કૌભાંડમાં જ્ઞાનવંતની પૂછપરછ પણ કરી ચૂકી છે.

જ્ઞાનવંત મમતાના માનીતા છે, તેથી તપાસ કેવી હશે એ કહેવાની જરૂર નથી. મમતા ઈચ્છે છે એ રીતે આ રાજકીય હત્યા નથી એવો રીપોર્ટ આપી દેવાશે. રાજકીય હિંસામાં કેરળ અને પશ્ચિમ બંગાળ અગ્રેસર છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં રાજકારણમાં અપરાધી વધારે હોવાની માન્યતા છે પણ કેરળ અને બંગાળ જેટલી રાજકીય હિંસા બીજા કોઈ રાજ્યમાં થતી નથી. ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં નકસલવાદના કારણે મોટા

**પ્રાસંગિક**  
**ધવલ શુક્લ**

મમતા બેનરજી અને ડાબેરીઓ લડયા કરતા એ તરફ દેશનું ધ્યાન નહોતું જતું. કેમ કે, એ વખતે મીડિયા આટલા સ્તરે વિસ્તર્યું ન હતું. મીડિયાનો પ્રભાવ વધ્યો પછી નંદીગ્રામ અને સિંગુરમાં મમતા બેનરજી અને ડાબેરીઓ વચ્ચે જામેલા જંગ અને ગુંડાગીરીની વાતો બહાર આવી. મમતાએ ગુંડાગીરીમાં ડાબેરીઓને પછડાડ્યા પછી થોડો સમય શાંતિ રહી, પણ ભાજપે બંગાળમાં મમતા બેનરજીને હરાવવા કમર કસતા જ મમતા ફરી અસલી રંગમાં આવી ગયાં.

ભાજપને દબાવી દેવા મમતાએ રીતસર ગુંડાગીરી શરૂ કરી. વિધાનસભાની છેલ્લી ચૂંટણી વખતે મમતા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા મરણિયાં બન્યાં પછી તેમણે બધી મર્યાદા બાજુ પર મૂકી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નંડા સુધ્યાં આ ગુંડાગીરીનો ભોગ બની ચૂક્યા છે. મમતાના

ઓફિસોને ઠેર ઠેર આગ લગાવી હતી. ભાજપના કાર્યકરોનાં ઘરોમાં ઘૂસીને હત્યા કરી નાંખી. ભાજપે પોતાના નવ કાર્યકરોની હત્યા થયાનો આક્ષેપ કર્યો હતો. તૃણમૂલ કાર્યકરોએ ભાજપની ઓફિસો અને કાર્યકરોના ઘર પર બોમ્બ ફેંક્યાના વીડિયો પણ ફરતા થયા હતા. ભાજપની મહિલા કાર્યકરો પર પાશવી બળાત્કાર ગુજારાયા હોવાના આક્ષેપો પણ થયા હતા. સોશિયલ મીડિયા પર તૃણમૂલ કાર્યકરોની ગુંડાગીરી અને હિંસાના વીડિયો અને તસવીરો એ વખતે છવાઈ ગયા હતા. અત્યારે જ્યાં તૃણમૂલના નેતાની હત્યાથી ભડકો થયો છે એ બિરભૂમ જિલ્લામાં પણ ભારે હિંસા થઈ હતી. ચૂંટણી બાદની ઘટનાઓમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગંભીર બની મમતા સરકાર પાસે રીપોર્ટ માંગ્યો હતો.

જો કે, તે સમય નક્કર ઠાઈની હદ વટાવતા મમતાએ પોતે મુખ્યમંત્રીપદના શપથ ના લે ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની જવાબદારી ચૂંટણીપંચની છે તેમ કહીને હાથ બંધેરી નાંખ્યા હતા. મમતાને રાજકારણમાં ટકવા માટે હિંસાનો વારસો રાજકારણીઓ પાસેથી મળ્યો છે. બંગાળ અંગ્રેજો સામેની હિંસક લડતનું મુખ્ય કેન્દ્ર હતું. આઝાદી પછી સામ્યવાદીઓએ સત્તા મેળવવા યુનિયન પ્રવૃત્તિના નામે ગુંડાગીરી શરૂ કરી. તેના જોરે સત્તા મળી પછી સત્તા ટકાવવા નકસલવાદને પોષ્યો. નકસલોએ રાજકીય ચળવળના નામે હત્યાઓ કરી અને લૂંટ ચલાવી, સરકાર સામે શસ્ત્રો પણ ઉઠાવ્યાં. કાયદાની એસીતેસી કરીને કોઈની હત્યા કરી નાંખવામાં પણ તેમને છોછ નહોતો. મમતાએ ડાબેરીઓને તેમની જ ગોળી ગળાવીને પછાડયા પછી ગુંડાગીરી તેમની આદત જ બની ગઈ છે. તૃણમૂલના કાર્યકરો મમતાના રસ્તે ચાલે છે. વળી, મમતા આવી ઘટનાઓમાં આંખ આડા કાન કરીને તેમને પોષે છે.

મમતાએ મુખ્યમંત્રી તરીકેની પહેલી ટર્મમાં હિંસા દ્વારા ડાબેરીઓને સાફ કરી નાંખ્યા હતા. ભાજપ મજબૂત બનતાં હવે મમતાએ ભાજપને સાફ કરવા તૃણમૂલના કાર્યકરોને છૂટો દોર આપ્યો છે. બિરભૂમ જેવી ઘટનાઓ મમતાની આ જ નીતિનું પરિણામ છે. આમ તો ગૃહમંત્રી અમીત શાહે બિરભૂમની ઘટનાની નોંધ લઈને મમતા સરકારને શુક્રવાર સુધીમાં અહેવાલ રજૂ કરવા સુચના આપી છે. તેથી ગુરુવારે તો મમતાએ પોત જ અસરગ્રસ્તોની મુલાકાત લીધી. પરંતુ મમતાની આ મુલાકાત પછી તેના શાસનમાં કોઈ સુધારો થશે કે કેમ એ મહત્વનો સવાલ છે.

**TMC નેતાની હત્યા બાદ ભડકેલી હિંસામાં 5 ઘરોને બહારથી તાળા મારી આગને હવાલે કરી દેવાતા 12 લોકો ભડથુ થઈ ગયા, ગૃહમંત્રાલયે રિપોર્ટ માંગતા જ મમતાની દોડધામ**

પ્રમાણમાં રાજકીય હત્યાઓ થાય છે પણ સામાન્ય લોકો રાજકીય હિંસામાં સામેલ હોય, તેનું પ્રમાણ બંગાળ અને કેરળમાં વધારે છે. રાજકીય કારણોસર અથડામણો, મારામારી, હિંસા વગેરે આ બંને રાજ્યોમાં સૌથી વધારે છે.

બંગાળની રાજકીય હિંસા બહુ જૂની છે પણ રાષ્ટ્રીય સ્તરે તેની બહુ નોંધ નહોતી લેવાતી.

ભત્રીજા અભિષેક બેનરજીના ડાયમંડ હાર્બર મતવિસ્તારમાં જ નંડાના કાફલા ઉપર હુમલો થયો હતો. પણ મમતાને કોઈ ફરક નહોતો પડ્યો. બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી તૃણમૂલના કાર્યકરોએ રાજકીય હિંસાનું જે તાંડવ કર્યું તેને લોકો નથી ભૂલ્યાં. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની



# પાટીદારો સામેના 10 કેસો પાછા ખેંચાયા, ચૂંટણી પહેલા બીજા કેસ પણ પાછા ખેંચાશે

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે આંદોલનકારીઓને શાંત પાડવા ભાજપની સ્ટ્રેટેજી

**અમદાવાદ**

વિધાનસભાની ચૂંટણીને જોતાં રાજ્ય સરકારે અનામત આંદોલન વખતે પાટીદારો સામે થયેલાં પોલીસ કેસો પાછા ખેંચવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં દસ કેસો પાછા ખેંચી લેવા નક્કી નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરમાં નોંધાયેલાં દસ કેસો પાછા ખેંચવા માટે સરકાર વતી કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અંગે તા.૧૫મી એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. જોકે, હજુ ૧૮૭ કેસો રાજ્યની જુદી જુદી કોર્ટમાં પડતર છે. આંદોલનકારીઓ આંદોલન

કરે તે પહેલાં કેસો પાછા ખેંચી સરકારે માસ્ટર સ્ટેક માર્યો છે. આ નિર્ણયને પગલે આંદોલનકારીઓનું ટાંચ ટાંચ ફીસ થયું છે. વિધાનસભાની ચૂંટણીઓને પગલે પાટીદાર આંદોલનકારીઓ અનામત આંદોલન વખતે પાટીદારો વિરુદ્ધ નોંધાયેલા કેસો પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને તા.૨૩મી એપ્રિલ સુધી અલ્ટીમેટમ આપ્યું હતું. હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓએ આ મામલે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી નાક દબાવ્યું હતું. જોકે, સરકારે આંદોલન શરૂ થાય તે પહેલાં જ કેસો પાછા ખેંચવાની

કાર્યવાહી તેજ કરી હતી. અનામત આંદોલન વખતે કુલ મળીને ૮૦૦ કેસો નોંધાયા હતાં. તે પૈકી ૪૮૫ કેસો તો ટકી શકે તેમ ન હતાં જેથી તબક્કાવાર કેસો પાછા ખેંચવામાં આવ્યા હતાં. આંદોલન વખતે અમદાવાદમાં સરકારી મિલકતનો નુકશાન પહોંચાડવા બદલ કુલ ૬૩ કેસો નોંધાયા હતાં. પાટીદાર સંસ્થાઓ જ નહીં, પણ ભાજપના પાટીદાર સાંસદોએ પણ કેસો પાછા ખેંચવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આખરે સરકાર તરફથી અમદાવાદ શહેરના ૧૦ કેસો પાછા ખેંચવા નક્કી કરાયું છે.

**સંક્ષિપ્ત સમાચાર**

**પવનની વિરુદ્ધ દિશાથી ફ્લાઇટ ડાઇવર્ટ થઈ**

**અમદાવાદ:** અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે સવારે પવનની વિરુદ્ધ દિશામાં ગતિ હોવાથી એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર (એટીસી) એ ફ્લાઇટ લેન્ડિંગ માટે મંજૂરી નહીં આપતા તેને ઇન્ડોર ડાઇવર્ટ કરવી પડી હતી. આ ફ્લાઇટ ઇન્ડોરથી સવારે રવાના થાય તે પહેલા જ અમદાવાદ એરપોર્ટનો રન-વે બંધ થઈ ગયો હતો. આમ, દિલ્હીના મુસાફરો ટ્રાવેલ ન પડે તે માટે તેમને અમદાવાદથી બાયરોડ વડોદરા એરપોર્ટથી લઈ જવા પડ્યા હતા. જેના કારણે ૪૦૦થી વધુ મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. અમદાવાદથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ સવારે ૮:૩૫ કલાકે ટેકઓફ થાય તે પહેલાં સવાર ૨૧૬ જેટલા મુસાફરોનું સિક્યોરિટી ચેકીંગ થઈ ગયું હતું. ફ્લાઇટ અમદાવાદના રડારમાં આવી પહોંચી હતી.



**અમદાવાદથી જૂનમાં સી પ્લેનની સેવા શરૂ થશે**

**અમદાવાદ:** ૩૧ ઓક્ટોબર ૨૦૨૦થી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ થયેલી સી પ્લેનની સર્વિસ ૧૦ એપ્રિલ ૨૦૨૧ સુધી જ ચાલી હતી. ત્યાર પછીથી આ સેવા બંધ છે. દરમિયાનમાં લોકો તરફથી સી પ્લેનની સુવિધા શરૂ કરવાની માગણીઓ આવી રહી હતી. જેને પગલે ગુજરાત સરકારે સી પ્લેનની સુવિધા નવેસરથી ચાલુ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગત ડિસેમ્બર મહિનામાં સી પ્લેનની સુવિધા શરૂ કરવા માટેનું ટેન્ડર જારી કરાયું હતું. તેમજ ત્રણ ખાનગી કંપનીઓએ ટેન્ડર ભર્યું હતું. જેમાં સૌથી ઓછા ભાવ ભરનારી કંપનીને સી પ્લેન ઉડાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ કંપની ત્રણ વર્ષ સુધી સેવા આપશે. કંપનીનું સી પ્લેન રોજ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ સુધીના બે ફેરા કરશે.

**સ્ટેચ્યુ કરતા પણ સરદારનું કદ ઊંચું: રાષ્ટ્રપતિ**

**ગાંધીનગર:** રાષ્ટ્રપતિએ ગુજરાત વિધાનસભાને પણ સંબોધિત કરતાં આઝાદીની લડાઈમાં ગુજરાતના પ્રદાનથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગુજરાતની વિવિધતામાં એકતા સહિતના અનેક મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ભલે દુનિયાની સૌથી મોટી પ્રતિમા હોય, પરંતુ દેશના લોકોના હૃદયમાં સરદાર પટેલનું કદ તેનાથી પણ ઊંચું છે. દાદાભાઈ નવરોગી, ફિરોઝશાહ મહેતાને યાદ કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ લડાઈને ગુજરાતના લોકો દ્વારા સતત મજબૂત બનાવાઈ અને અંતે મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં આ લડાઈ સ્વતંત્રતા સંગ્રામમાં પરિણમી. ગુજરાતનો ઇતિહાસ અદ્વિતિય રહ્યો છે તેમ જણાવતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ગુજરાત સત્યાગ્રહની ઘરતી પણ છે, બારડોલી સત્યાગ્રહ, નમક આંદોલન તેમજ દાંડીમાર્ચ સ્વતંત્રતા સંગ્રામને નવું સ્વરૂપ આપવાની સાથે વિદ્રોહની અભિવ્યક્તિ અને જનઆંદોલનના સંચાલનને પણ એક નવી ઉચાઈ આપી છે.

**ભાજપમાં ભરતી મેળો: આપના ૩૦૦૦થી વધુ કાર્યકરોએ કેસરિયો કર્યો**

**અમદાવાદ**

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોને સીથે સાથે ભાજપ દ્વારા આપને કાર્યકરોને પણ પોતાની પાર્ટીમાં જોડાવવાનું જાહેર કે અભિયાન શરૂ થઈ ગયું છે અને લોકો ભાજપમાં જોડાઈ પણ રહ્યા છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાંથી ૩૦૦૦થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે. આ અંગે પ્રદેશ સંગઠન મહા મંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે.

**પૂર્વ સીએમ, ડેપ્યુટી સીએમ, ગૃહમંત્રી જાડેજાની સિક્યોરિટીમાં થશે ઘટાડો**

ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં નિર્ણય કરાયો

**અમદાવાદ**

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના ભાજપ સરકારના પૂર્વ પદાધિકારીઓને સિક્યોરિટી ઘટાડવા ગૃહ વિભાગે તૈયારી આદરી છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા અને ગુજરાત સ્થિત સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ

બ્યુરોના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉપરોક્ત ત્રણેય સહિત પૂર્વ પદાધિકારીઓને અપાયેલું સિક્યોરિટી કવચ દૂર કરવા તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સના રિપોર્ટ બાદ પૂર્વ પદાધિકારીઓની સિક્યોરિટી ઘટાડવા નિર્ણય કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. ટોચના અધિકારીના કહેવા મુજબ પૂર્વ પદાધિકારીઓને પદ ઉપરથી ઉતર્યા બાદ એક મહિના સુધી હયાત સલામતી વ્યવસ્થાઓ ચાલુ રાખવામાં આવતી હોય છે. બાદમાં નિયમાનુસાર જોખમના તત્વોની સમીક્ષા અને ઈન્ટેલિજન્સ ઈનપુટને આધારે તેમાં વધઘટ કે પૂર્ણતા: સલામતી કવચ પરત ખેંચવાનો નિર્ણય લેવાતો હોય છે.

# બુલેટ ટ્રેન : ગુજરાતમાં 100 ટકા જમીન સંપાદન, મહારાષ્ટ્ર રાજ્યમાં હજી અધુરું

ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદન પેટે 7,279 કરોડ ચૂકવાયા

**ગાંધીનગર**

અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લાના પાંચ તાલુકાની જમીન સંપાદન કરવામાં આવી છે. આ જમીનનું ક્ષેત્રફળ ૨૭૧૫૧૭ ચોરસમીટર જેટલું થાય છે. જો કે હજી ૭૨૦૩ ચોરસમીટર જમીન સંપાદન કરવાની બાકી છે.



કુલ ૧૦૪૫૪૬૨૨ ચોરસમીટર જમીન સંપાદન કરવામાં આવી છે. આ રકમ પૈકી ૮૮૨.૭૯ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ખેડા જિલ્લાના ખેડા, મહેમદાવાદ, નડીયાદ, વસો અને

માતર તાલુકાની ૯૯૦૦૯૭ ચોરસમીટર જમીન સંપાદન થઈ છે. આ જમીન પેટે ખાતેદારોને ૩૦૬.૦૧ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એવી જ રીતે નવસારી જિલ્લાના નવસારી, ગણદેવી, જલાલપોર અને ચીખલી તાલુકાની ૮૧૩૮૨૫ ચોરસમીટર જમીન સંપાદન કરવામાં આવી છે. આ જમીન પેટે ૪૧૬.૦૨ કરોડ વળતર આપવામાં આવ્યું છે. બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં ૧૦૦ ટકા જમીન સંપાદન પૂર્ણ થયું છે પરંતુ મહારાષ્ટ્રમાં હજી અધુરું છે.

**ગુજરાતીઓએ નવ મહિનામાં રોજ ૩.179 કરોડ બેંકમાં જમા કરાવ્યા**

**અમદાવાદ**

ગુજરાતમાં એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ના નવ મહિનામાં બેંક ડિપોઝીટમાં ૩.૪૯,૦૫૮ કરોડનો વધારો જોવા મળ્યો છે. આમ, ૨૭૫ દિવસમાં દૈનિક ૩.૧૭૮ કરોડની રકમ બેંકોમાં લોકો, વેપારીઓ અને ઉદ્યોગોએ જમા કરાવી છે!

રાજ્યમાં સરકારી બેંકો કરતા ખાનગી અને સ્મોલ ફાઇનાન્સ બેંકનો વૃદ્ધિ દર ઘણો વધારે છે એવું પણ આજે મળેલી સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટીના (SLBC) ના અહેવાલ ઉપરથી જાણવા મળે છે. ગુજરાત રાજ્યમાં ડિસેમ્બર ૨૦૨૦ સામે ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ડિપોઝીટનું પ્રમાણ ૯.૦૯ ટકા અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં આ પ્રમાણ ૬.૭૩ ટકા રહ્યું છે. તેની સામે ખાનગી બેંકોમાં આ સમયમાં ડિપોઝીટ ૧૬ ટકા વધી છે છે અને સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં તે ૪૧ ટકા જેટલી વધી છે.

**કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના ચૂંટણી લડવા પર સસ્પેન્સ યથાવત**

**અમદાવાદ**

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી લડવાનું સસ્પેન્સ યથાવત છે. આ માટે તેને કાનૂની પગલું ભર્યું છે. ૨૦૧૫માં વિસનગર તોફાનોના કેસમાં ૨ વર્ષની સજા થઈ છે. જોકે, હાર્દિક પટેલ અત્યારે આ કેસમાં જામીન પર છે. આ કેસમાં તે દોષિત ઠર્યો હોવાથી તે ચૂંટણી લડવા અયોગ્ય છે. તે પોતાનો દોષ સ્થગિત કરવા માંગે છે. જેથી તે ચૂંટણી લડી શકે.

**બ્રેઇનડેડ નીશાંત મહેતાના અંગદાનથી 6 વ્યક્તિઓનું જીવન નિરામય બન્યું**

**અમદાવાદ:** અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્ટીટ્યુટમાં બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે. બોપલના ૪૨ વર્ષીય નીશાંતભાઈ મહેતાનું માર્ગ અકસ્માત થતા તેઓને બોપલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાન માટેનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. બ્રેઇનડેડ નીશાંતભાઈના પાર્થિવ દેહને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્ટીટ્યુટમાં રીટ્રાઇવલ માટે લાવવામાં આવ્યા. તમામ ટેસ્ટ પૂર્ણ થયા બાદ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ૬ થી ૭ કલાકની ભારે જહેમત બાદ એક હૃદય, બે કિડની, એક લીવર અને બે આંખોનું દાન મેળવવામાં સફળતા મળી છે. અંગદાન નીશાંતભાઈના હૃદયને ગ્રીન કોરિડોર મારફતે મુંબઈની રીલાયન્સ હોસ્પિટલમાં દાખલ દર્દીના પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું છે. જ્યારે કિડની અને લીવરને કિડની ઇન્ટીટ્યુટમાં જ SOTTO હેલ્થ નોંધાયેલ દર્દીમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે.





# તમારા વાળને મજબૂત બનાવવા વિટામિન સી જરૂરી

વાળને સુંદર બનાવવા ઘણી વખત આપણે મોંઘી મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ. એ વાળને નુકસાન પણ પહોંચાડી શકે છે. નેચરલ સોર્સનો ઉપયોગ કરી હેરને હેલ્ધી બનાવી શકાય. વાળને સુંદર અને ગ્લોઈંગ બનાવવા વાળમાં વિટામિન સી લગાવો. એ વાળને સિલ્કી અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એના માટે કુદરતી રીતે નેચરલ સોર્સ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. જે અંગે આજે આપણે જાણીએ.

## લીંબુનો રસ

લીંબુમાં વિટામિન સી હોવાની સાથે સાઈટ્રિક એસિડ હોય છે. તે વાળને સિલ્કી સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. નાસ્તિયેળું તેલ લઈ શકો. આ રેમિડિયનને અડધો કલાક હેરમાં લગાવી રાખો, ત્યારબાદ સાદા પાણીથી અને પછી માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. લીંબુના રસથી ખોડો ઓછો થાય છે અને વાળ શાઈની-મજબૂત બને છે.

## સંતરાંનો રસ

સંતરાંમાં વિટામિન સીવાળ ભરાવદાર બને છે. નિસ્તેજ થઈ ગયેલા વાળમાં ચમક પરત ફરે છે. આ ઉપરાંત વાળમાં ખોડો થયો હોય તો તેને દૂર કરે છે. છાલ ઉતારી લો. છાલને ઉકાળી નાખો. પછી ઠંડું પડે એટલે એ પાણીથી વાળને ધોઈ લો. સંતરાંની છાલનો પાઉર વાળને ચમકદાર થશે.



## આંબળાંનું જ્યૂસ

આંબળાંનો રસ વાળ માટે ઉત્તમ છે. તેનો હેર સિરમની જેમ પણ ઉપયોગ કરી શકાય છે. આંબળાં વિટામિન સીથી ભરપૂર હોય છે. જે વાળનાં મૂળને મજબૂત કરવામાં મદદ કરે છે. તે વાળની ચમકને વધારવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આંબળાં વાળમાં રહેલા ખોડાને પણ દૂર કરે છે.

## દહીં હેર માસ્ક

દહીં ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થાય છે. ઉપરાંત વાળ ગ્લોઈંગ, સ્મૂથ બને છે. વાળમાં લગાવવું ખાટું દહીં લો તેને સ્કેલ્પમાં અને આખા વાળમાં એપ્લાય કરો. તમે ઘસો તો એમાં લીંબુનો રસ મિક્સ કરી શકો. આ માસ્કને અડધો કલાક સુધી વાળમાં લગાવી રાખ્યા બાદ વાળને પહેલાં સાદા પાણીથી ધોઈ નાંખો.

# પોતાના ઘરનું Wi-Fi કેવી રીતે સુરક્ષિત રાખી શકાય

ઘણા રાઉટર્સ તેમના મોડેમ અથવા રાઉટર માટે ડિફોલ્ટ લોગિન વિગતો સાથે આવે છે. આ લોગિન વેબપેજની વિગતો રાઉટર્સના સપોર્ટ વેબપેજ અને ઓનલાઈન ફોરમ પર પોસ્ટ કરવામાં આવે છે. તમારે તમારું રાઉટર સેટ કર્યા પછી તરત જ ડિફોલ્ટ લોગિન માહિતી બદલીને મજબૂત યુઝરનેમ અને પાસવર્ડ સંયોજનનો ઉપયોગ કરવો જોઈએ.

પાસવર્ડની ચોરી ટાળવા માટે તમારા Wi-Fi નેટવર્કને એન્ક્રિપ્ટ કરવું જરૂરી છે. પરંતુ બધા રાઉટર્સ એન્ક્રિપ્શનને સપોર્ટ કરતા નથી. જો તમારું રાઉટર એન્ક્રિપ્શનને સપોર્ટ કરતું નથી, તો તમે નવા મોડલ પર અપગ્રેડ કરવાનું વિચારી શકો છો. તમારા ઘરના ઈન્ટરનેટ કનેક્શન સેટ કરવા માટે સિક્યુરીટી રિસર્ચરની મદદ લો.

SSID બ્રોડકાસ્ટિંગને બંધ કરવું. આ એક એવી સુવિધા છે જે તમને તમારા Wi-Fi નેટવર્કને અન્ય લોકોથી છુપાવવા માટે મદદરૂપ છે. જ્યારે આ સેટિંગ ઓન હોય ત્યારે કોઈ તમારા વિસ્તારમાં ઉપલબ્ધ Wi-Fi નેટવર્ક્સ માટે સ્કેન કરશે ત્યારે તમારું Wi-Fi નામ (SSID) દેખાશે નહીં.

રાઉટર ફર્મવેરને નિયમિત અપડેટ કરો. મોટાભાગના રાઉટર્સ પરફોર્મન્સ અને સુરક્ષા વધારવા માટે તેમના પોતાના ફર્મવેર અપડેટ્સ સાથે આવે છે. આ અપડેટ્સ રાઉટરના લોગીન વેબપેજ દ્વારા આપમેળે ઈન્સ્ટોલ થઈ જાય છે. અથવા તમારા રાઉટરના મોડેલના આધારે મેન્યુઅલ ઈન્સ્ટોલેશનની જરૂર પડી શકે છે. ધ્યાનમાં રાખો કે ફર્મવેરને અપડેટ કરવાથી અસ્થિર કનેક્શન્સ અથવા તો રાઉટરની નિષ્ફળતા પણ થઈ શકે છે. તેથી આગળ વધતા પહેલા અપડેટનું સંશોધન કરવાનું નિશ્ચિત કરો અને રાઉટરના સેટિંગ્સનો બેકઅપ લઈ લો.

ઘરે ન હોય ત્યારે તમારું Wi-Fi બંધ કરો. આ હેક્સને Wi-Fi દ્વારા કનેક્ટેડ તમામ ઉપકરણોને એક્સાઇટ એક્સેસ કરવાથી અટકાવે છે. જો તેઓ એક ઉપકરણની એક્સેસ મેળવે તો ડેટા ભંગ થઈ શકે છે.

ફાયરવોલનો ઉપયોગ કરો. ફાયરવોલ એ સુરક્ષા સોફ્ટવેર છે. જે તમારા કમ્પ્યુટરને અનિચ્છનીય એક્સેસ અને હેકિંગના પ્રયાસોથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે. ફાયરવોલ દૂષિત સામગ્રીને તમારા ઉપકરણ પર ડાઉનલોડ થવાથી પણ અવરોધિત કરી શકે છે. ફ્રી અને પેઈડ એમ બંને પ્રકારના ફાયરવોલ ઉપલબ્ધ છે.

ઘણા રાઉટરમાં WPS (Wi-Fi પ્રોટેક્ટેડ સેટઅપ) મૂળભૂત રીતે ઓન હોય છે. આ એક પાસવર્ડ ફ્રી સુવિધા છે જે રાઉટરમાં બટનના રૂપમાં હોય છે. જે તમને એન્ક્રિપ્શન ફ્રી દાખલ કર્યા વિના તમારા હોમ નેટવર્ક સાથે સરળતાથી નવા ઉપકરણોને કનેક્ટ કરવાની મંજૂરી આપે છે. જો કે તે આગ્રહણીય નથી કારણ કે હેક્સ આ સુરક્ષા ખામીનો ઉપયોગ કરી શકે છે અને બ્રુટ ફોર્સ એટેકનો ઉપયોગ કરીને તમારા Wi-Fi નેટવર્કની એક્સેસ મેળવી શકે છે.

રાઉટરમાં UPnP (યુનિવર્સલ પ્લગ એન્ડ પ્લે) સેટિંગ્સને ઓન કરવાની ભલામણ કરવામાં આવતી નથી કારણ કે તે ઉપકરણોને તમારા રાઉટર પર પોર્ટ ફોરવોર્ડિંગને આપમેળે ગોઠવવાની મંજૂરી આપે છે. જો તમે આ સુવિધાનો ઉપયોગ ન કરતા હોવ તો તમારે રિમોટ મેનેજમેન્ટ સેટિંગ્સને ઓફ કરવું જોઈએ કારણ કે હેક્સ સંભવિતપણે તેમના પોતાના ઉપકરણનો ઉપયોગ કરીને ઘરની બહારથી તમારા નેટવર્કની એક્સેસ મેળવી શકે છે.

VPN નો ઉપયોગ કરો. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) એ એક એન્ક્રિપ્ટેડ કનેક્શન છે. જે તમને અનામી રીતે ઈન્ટરનેટ બ્રાઉઝ કરવાની મંજૂરી આપે છે. આનો અર્થ એ છે કે તમે કઈ વેબસાઇટની મુલાકાત લો છો અથવા તમારી ઓનલાઈન પ્રવૃત્તિને કોઈ જોઈ શકશે નહીં. પરંતુ તમારા IP એડ્રેસનો એક્સેસ કોઈ અન્ય વ્યક્તિ પાસે હોય તો તે આ માહિતી મેળવી શકશે. જે ફક્ત ઉપકરણ પર જ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરીને થઈ શકે છે. VPN સેવાનો ઉપયોગ કરતી વખતે મજબૂત એન્ક્રિપ્શન પ્રદાન કરતી અને વિશ્વભરના વિવિધ દેશોમાં સ્થિત સર્વિસનો ઉપયોગ કરતી હોય તેવી એક VPN સર્વિસ પસંદ કરવી મહત્વપૂર્ણ છે. જેથી કરીને તમે દર વખતે માત્ર એક ચોક્કસ દેશમાંથી કનેક્ટ ન થાવ.

તમારા ઘરમાં સ્માર્ટફોન અને લેપટોપથી લઈને કેમેરા, સ્માર્ટ ટીવી અને સુરક્ષા સિસ્ટમો સુધીના વાયરલેસ રીતે કનેક્ટેડ ઉપકરણોની શ્રેણી હોઈ શકે છે. આ પગલાંને અનુસરીને તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમે અધિકૃત કરો છો તે ઉપકરણો જ તમારા ઘરના Wi-Fi અને સંગ્રહિત કરેલી મૂલ્યવાન માહિતીને એક્સેસ કરી શકે છે. આ હેક્સને Wi-Fi દ્વારા કનેક્ટેડ તમામ ઉપકરણોને એક્સાઇટ એક્સેસ કરવાથી અટકાવે છે. જે ડેટા ચોરી અટકાવી શકે છે.

@beinghumanmj

કવચિત્રી : હિના મોદી,  
શીર્ષક : હૃદય

તીક્ષ્ણ  
ન્હોર સમા કોઈનાં પણ શબ્દોથી -  
હવે,  
હૃદય પર ઉઝરડાં પડતાં નથી.  
કસમચે  
રણકતી ફોનની ઘંટડીથી-  
હવે,  
ધબકારા વધતા નથી.  
અચાનક -  
સ્વપ્ન મળી જવાથી  
લખલખું પસાર થયું નથી.  
લાગે છે -  
હવે,  
આ હૃદય  
સાવ. ...  
નિર્દયી બની ગયું છે.

## અપનાવો આ હેલ્થ ટીપ્સ

- અરિચિની તકલીફ દૂર કરવા ફૂદીનાનો રસ સવાર-સાંજ પીવાથી લાભ થાય છે.
- ઊલટી થવા પર આમલીનું શરબત પીવું.
- હરસથી પીડાતી વ્યક્તિ ઘાણા, કિશમિશ અને ખડી સાકર રાતના પાણીમાં પલાળી સવારે મસળી ગાળીને પીવું.
- લીંબુનો અને તુલસીનો રસ ભેળવી ઘાઘર પર લગાડવાથી તથા ખંજવાળ પર રાહત આપે છે.
- બિલાડી બચકું ભરે તો ઘા પર તલ વાટી લગાડવું.
- શરદીથી દાંતનો દુખાવો થતો હોય તો હળદરનો ટુકડો દાંતની નીચે રાખવો.
- પિત્તની તકલીફમાં આમળાનો મુરબ્બો ખાવાથી ફાયદો થાય છે. કબજિયાતની તકલીફથી છૂટકારો પામવા કાર્યું લસણ ખાવું.
- ગઠિયા વાની તકલીફથી છૂટકારો પામવા રોજ એક સફરજન ખાવું. લીંબુના રસમાં મધ, ગુલાબજળ અને ગ્લિસરિન સમ્રમાલ માત્રામાં ભેળવી ચહેરા પર લગાડવું.
- પેટમાં વીંટ આવતી હોય તો તનાથી રાહત પામવા ખજૂર અથવા દહીં ખાવું.

## DIVINE YOGA

By Geeta

### Children Yoga Class

Every Tuesday 5-6 PM

### Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join today on ZOOM!

: Classes Available :  
One to One Individual  
and Therapeutic

Geeta Tailor

416-456-2261

Contact Geeta at  
divineyogabygeeta@gmail.com  
IG & FB: @divineyogabygeeta



# ડીંગુયા પરિવાર અપમૃત્યુ કેસ : યુએસ અને કેનેડાની સુરક્ષા એજન્સીના ગુજરાતમાં ધામા

૧૬૦૦ કિમીના કોસ્ટલ હાઈવે માટે ૨૪૦૦ કરોડનો ખર્ચ થશે

ગાંધીનગર

રાજ્યમાં કોસ્ટલ હાઈવે માટે ઉમરગામથી નારાયણ સરોવર સુધીના ૧૬૦૦ કિલોમીટર કોસ્ટલ હાઈવે પાછળ રૂપિયા ૨૪૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઉમરગામથી નારાયણ સરોવર સુધીના કોસ્ટલ હાઈવેમાં નવસારી, સુરત, ભરુચ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી જિલ્લાઓને ફાયદો થશે. ઉમરગામથી શરુ થતો અને કચ્છના નારાયણ સરોવર સુધીનો ૧૬૦૦ કિલોમીટર લાંબો રૂટનો હાઈવે ૧૦ મીટર પહોળો તથા તેને અપગ્રેડ કરાશે. આ સિવાય ઉભરાટ-આભવા-સુરતમાં મીઠોળા નદી પર સિનેચર પૂલ માટે ૪૭૦ કરોડ રૂપિયા ખર્ચાશે.

ડીંગુયાના પરિવાર સાથે કેનેડા ગયેલા ૬ લોકોને ટૂંક સમયમાં ભારત મોકલી દેવામાં આવશે

અમદાવાદ

કેનેડાની સરહદથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરતી વખતે ડીંગુયા ગામના ૪ લોકોના મોત થયા હતા. આ ઘટનાના આશરે ૨ મહિના બાદ યુએસ અને કેનેડાની સિક્યુરિટી એજન્સીઓ અને કોન્સ્યુલેટ જનરલ સોમવારે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, ફેડરલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (FBI)ના એક સભ્ય સહિતના પ્રતિનિધિઓ રાજ્યમાં ચાલતાં ગેરકાયદેસર ઈમિગ્રેશન

રેકૉર્ડની તપાસ કરી રહેલા ગુજરાત પોલીસના અધિકારીઓને મળ્યા હતા. ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુયા ગામના એક પરિવારના ૪ સભ્યોએ ૧૯ જાન્યુઆરીએ યુએસ-કેનેડાની બોર્ડરથી ૧૦ મીટરના અંતરે હાડ થીજવતી ઠંડીમાં દમ તોડી દીધો હતો. ત્યારબાદ, ગુજરાત પોલીસે ઉત્તર ગુજરાતમાં ચાલતાં વધુ એક ગેરકાયદેસર ઈમિગ્રેશન રેકૉર્ડનો પર્દાફાશ કર્યો હતો અને ૮ સ્થાનિક એજન્સીની ધરપકડ કરી હતી. આ ઘટનાની જાણકારી ધરાવતા એક

અધિકારીએ જણાવ્યું હતું કે, 'યુએસ અને કેનેડાના અધિકારીઓનો આ કેસમાં વધુ કડીઓ એકત્ર કરવાનો તેમજ રાજ્યમાં ચાલતાં ગેરકાયદેસર ઈમિગ્રેશનને વધુ સારી રીતે ડામી શકાય તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે'. એરલાઈનના અમુક કર્મચારીઓ પણ સ્થાનિક એજન્સીને માનવ તસ્કરીમાં મદદ કરી રહ્યા છે. યુએસ કોન્સ્યુલેટ જનરલના એક અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, ડીંગુયાના પરિવાર સાથે કેનેડા ગયેલા ૬ લોકોને ટૂંક સમયમાં ભારત મોકલી દેવામાં આવશે.

# કોરોનામાં મા-બાપની છત્ર ગુમાવનારા ૨૭,૬૭૪ બાળકોની સહાય માટે ગુહાર સીમલજમાં કિશોરીની આબરુ લુંટવાના પ્રયાસના કેસમાં ૩ આરોપીને ૩ વર્ષની કેદ

અમદાવાદ

ગુજરાતમાં કોરોનામાં માતા અને પિતા બંને અથવા તો કોઈ એક વાલીનું મોત થયું હોય તેવા કિસ્સામાં બાળકને સહાય માટે ૨૭,૬૭૪ અરજી મળી છે, જે પૈકી ૨૦,૯૭૦ અરજીઓ તો મંજૂર કરાઈ છે જ્યારે ૩,૬૬૫ અરજી નામંજૂર કરવામાં આવી છે, આ સાથે જ ૩,૦૦૯ અરજીઓ પડતર છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ બાળકોને અપાતી સહાયની રિસેમ્બર ૨૦૨૧ની સ્થિતિનો આ ચિતાર ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે રજૂ કર્યો છે. એક તરફ ગુજરાત સરકાર કોરોનાથી

રાજ્યમાં ૧૦,૯૪૨ મોત થયાનું જાહેર કરે છે બીજી તરફ કોરોનામાં મા-બાપની છત્રછાયા ગુમાવનારા બાળકોની જ ૨૭,૬૭૪ અરજીઓ આવી છે, આમ સ્પષ્ટ છે કે, ગુજરાત સરકાર કોરોનામાં મોતના આંકડા છુપાવે છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં માતા અને પિતા બંનેનું અવસાન થયું હોય તો દર મહિને ૪ હજાર અને માતા અથવા પિતા કોઈ એકનું અવસાન થયું હોય તો તેવા બાળકને મહિને બે હજારની સહાય ચુકવવામાં આવે છે, ગુજરાતમાં રિસેમ્બર ૨૦૨૧ની સ્થિતિએ જ ૨૦,૯૭૦ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

મરીડા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં બનાવ બંધ્યો હતો

નડિયાદ

ઠાસરા તાલુકાના સીમલજ ગામે સગીરાની આબરુ લેવાના પ્રયાસની ઘટનામાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સીમલજ ગામે ભાથીજીવાળા ફળિયામાં રહેતા મહેશભાઈ રમેશભાઈ તળપદા, કિરણભાઈ રમેશભાઈ તળપદા અને રતીલાલ બચુભાઈ તળપદાએ એક સગીરાની આબરુ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં ઘટનાના અઢી માસ અગાઉ મહેશભાઈએ આ સગીરાની

શારીરિક છેડછાડ કરી હતી. આથી સગીરાના માતા પિતાએ મહેશભાઈને ઠપકો આપ્યો હતો. અને આ બાબતે ઝઘડો અને ત્યારબાદ મારામારી થઈ હતી. આ બનાવ અંગે સગીરાના માતા પિતાએ ડાકોર પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અરજી આપી હતી. આ અરજીની અદાવત રાખી મહેશભાઈ સગીરાને અવાર નવાર રસ્તામાં છેડછાડ કરતા હતા. અને શારીરિક અને માનસિક રીતે હેરાન કરતા હતા. આથી સગીરાને તેના ફોઈ પોતાના નડિયાદ તાલુકાના

મરીડા ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. જ્યાં તા.૨૧.૫.૨૦૨૧ના રોજ રાત્રીના મહેશભાઈ, તેના ભાઈ કિરણભાઈ અને રતીલાલે અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. જ્યાં મહેશભાઈએ સગીરાનો હાથ પકડી તેની સાથે શારીરિક છેડછાડ કરી આબરુ લેવાનો પ્રયાસ કર્યો હતો. આથી સગીરાએ બૂમાબૂમ કરતા મહેશભાઈએ ચપ્પુ બતાવી જો બૂમો પાડીશ તો ચપ્પાથી મારી નાંખીશ તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી.

## ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારી, હાઈકમાન્ડે પ્રદેશનું જમ્બો માળખું જાહેર કર્યું

અમદાવાદ

કોંગ્રેસ હાઈકમાન્ડે અઢી વર્ષના લાંબા વિલંબ બાદ ગુજરાત કોંગ્રેસનું અધૂરું માળખું જાહેર કર્યું છે. જેમાં ૨૫ ઉપપ્રમુખ અને ૭૫ જનરલ સેક્રેટરી અને પાંચ પ્રોટોકોલ સભ્યના નામો જાહેર કરવામાં આવ્યા છે. ઉપપ્રમુખ પદે જાહેર થયેલા નામોમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મહિલા કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલા, સત્યજિતસિંહ ગાયકવાડ, શહેનાઝ બાબી, ડો. વિજય પટેલ, કુલદીપ શર્મા, ભીમા રબારી, કિશન પટેલ, નિશિત વ્યાસ, બીમલ શાહ સહિતના ૨૫ નામો જાહેર કરવામાં આવ્યા છે, નારાજગી ઘોરવી ના પડે તે માટે હોદ્દાદારોની સંખ્યામાં વધારો કરાયો છે. છેલ્લે સંગઠનમાં ૧૮ જેટલા ઉપપ્રમુખ હતા, હવે ૨૫ થયા છે. આ ઉપરાંત ૭૫ જનરલ સેક્રેટરી છે.

## ભારતીય ટ્રાવેલ એજન્સી ઓસ્ટ્રેલિયા અને કેનેડાના બુકિંગ નહિ કરી શકે

એર ઇન્ડિયાએ ભારતીય ટ્રાવેલ એજન્સીને બુકિંગ કરવાની મનાઈ ફરમાવી

અમદાવાદ

ભારતની રાષ્ટ્રીય એર સર્વિસ પ્રોવાઈડર કંપની એર ઇન્ડિયાએ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જનારાઓ માટેની ટિકિટ ભારતીય ટ્રાવેલ એજન્સી ન કરી શકે તેવો વિચિત્ર નિર્ણય કર્યો છે. જેથી ૨૮મી માર્ચે એર ઇન્ડિયાની અમદાવાદની ઓફિસ બહાર દેખાવો કરવાની પરવાનગી આપવાની માગણી કરતા પત્રો એજન્સીએ લખી દીધા છે. જોકે એજન્સી ટિકિટના કાળાં બજાર કરતાં હોવાથી એર ઇન્ડિયાએ બુકિંગ કરવા પર રોક લગાવી હોવાનું

જાણવા મળી રહ્યું છે. અલબત્ત ટ્રાવેલ એજન્સીનું કહેવું છે કે થોડા એજન્સીની ગેરરીતિઓ માટે તમામ એજન્સીને દંડવાની એર ઇન્ડિયાની નીતિ ઉચિત નથી. જોકે ઓસ્ટ્રેલિયા અને કેનેડા જવા માગતા પ્રવાસીઓ-ટ્રાવેલર જાતે ઓનલાઈન બુકિંગ કરાવી શકે તેવી વ્યવસ્થા એર ઇન્ડિયાએ કરી છે. ભારતીય ટ્રાવેલ એજન્સીને મનાઈ ફરમાવીને વિદેશી ટ્રાવેલ એજન્સીને એર ઇન્ડિયાની વેબસાઈટ પર સીધી બુકિંગ કરવાની છૂટ આપી હોવાથી ભારતીય ટ્રાવેલ એજન્સી ગિત્તાયા છે.

## અમદાવાદ: કલર અને પાણી છાંટવા બાબતે બે કોમ વચ્ચે જૂથ અથડામણમાં પથ્થરમારો

અમદાવાદ

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ અને પથ્થરમારો ઘટના પણ બની હતી. જેમાં આમ્રપાલી થિયેટર નજીક જૈન મંદિર પાસે કેટલાક નાના બાળકો ધૂળેટી રમી રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા અફઝલ આબીદહુસેન પઠાણ અને તેના મિત્ર ઉપર પાણી છંટાઈ ગયું હતું. આ કારણે ઉરકેરાઈને તે બંનેએ બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ ૧૫-૨૦ લોકોનું ટોળું બોલાવી લાવીને બિભત્સ શબ્દો બોલીને પથ્થરમારો કર્યો હતો. આ મામલે ફરિયાદીની ડાબી આંખ પાસે તથા તેમના સાથે રહેલી અન્ય એક વ્યક્તિને માથાના પાછળના ભાગે પથ્થરમારોના કારણે ઈજા પહોંચી હતી.

## ડાકોરમાં રણછોડરાયને વસ્ત્રો ધરાવવા માટે હવે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે

નડિયાદ

ડાકોરના રણછોડરાયના દર્શને દુર દૂરથી ભક્તો આવતા હોય છે. છતાં તેમને ભગવાનની સેવા કરવાની તક મળતી ન હતી. જેને કારણે છેલ્લાં ઘણાં સમયથી વૈષ્ણવભાઈઓ અને સેવકો દ્વારા ટેમ્પલ કમીટી સમક્ષ આ સમસ્યાના નિવેડા માટે રજૂઆતો કરાઈ હતી. જેને અનુસંધાને ટેમ્પલ કમીટી અને ટ્રસ્ટી મંડળે ઠાકોરજીના વસ્ત્રો સવાર અને સાંજ એમ બે ટાઈમે વસ્ત્રો ધરાવી શકાશે અને આ માટે જે તે વ્યક્તિએ મંદિરની વેબસાઈટ પરથી બુકિંગ કરાવવાનું રહેશે. આ નિર્ણયથી હવે પરદેશ રહેતા ભક્તો પણ લાભ મેળવી શકશે. આ માટે આગામી ૧લી એપ્રિલથી ૩૧,માર્ચ,૨૦૨૩ દરમિયાન ઠાકોરજીના વસ્ત્રો મંગળા સ્નાન પછી સવારના વસ્ત્રો, અને શયનભોગ આરતી પછીના સાંજના વસ્ત્રો નોંધાવવાના રહેશે. જે બુકિંગ ૨૫.૩.૨૦૨૨ના રોજથી સવારે ૯ વાગ્યાથી મંદિરની વેબસાઈટ [www.ranchhodraji.org](http://www.ranchhodraji.org) પર ઓનલાઈન વસ્ત્રોની નોંધણી કરાવી શકાશે એમ ડાકોર ટેમ્પલ કમીટી દ્વારા જણાવવાયું છે.

## મહીસાગર નદીમાં ડૂબી જવાથી ૪ આશાસ્પદ યુવાનોના મોત

નડિયાદ

હિંમતપુરા ગામે રહેતા ૮થી ૧૦ યુવાનો ગત્ રોજ ધુળેટી પર્વ હોવાથી વણાકબોરી પાસે આવેલ મહી નદીમાં ન્હાવા ગયા હતા. જ્યાં નહાતા સમયે ચાર મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે અચાનક થયેલ આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના અંગે સ્થાનિક તરવૈયાઓને જાણ કરતા આ તરવૈયાઓ અને બાલાસિનોર પોલીસ દ્વારા ડૂબી ગયેલા યુવાનોને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. જ્યાં ભારે જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટના અંગે હિંમતપુરા ગામમાં જાણ થતા યુવાનોના પરિવારજનો ભારે શોકમાં ડૂબી ગયા હતા.

## કોરોના કાળના બે વર્ષમાં અમદાવાદ સિવિલમાં ૨૭,૦૨૭ દર્દીઓનાં મોત

અમદાવાદ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળના વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં કુલ ૨૭,૦૨૭ દર્દીઓનાં મોત થયા છે, જે પૈકી વર્ષ ૨૦૨૦માં ૧૨,૦૮૦ દર્દીનાં મોત થયા હતા, આમ રોજના ૩૩થી ૩૪ દર્દીનાં મોત થયાં છે, જોકે કોરોનાની બીજી લહેર વધારે ઘાતકી સાબિત થઈ હતી એટલે વર્ષ ૨૦૨૧માં સિવિલ હોસ્પિટલમાં ૧૪,૯૪૭ દર્દીએ સારવાર વખતે દમ તોડ્યો હતો, આમ ૨૦૨૧માં રોજના ૪૦થી ૪૧ દર્દીનાં મોત થયા હતા. અન્ય બીમારીના કારણે સિવિલમાં બે વર્ષમાં ૨૫,૩૫૧ દર્દીનાં મોત થયા છે, જ્યારે કોરોનામાં ૧,૬૭૬ દર્દી મોતને ભેટ્યા છે, બુધવારે રાજ્યના આરોગ્ય મંત્રીએ વિધાનસભા ગૃહમાં આ લેખિત માહિતી આપી હતી. વર્ષ ૨૦૨૦ના અરસાની વાત કરીએ તો સિવિલમાં મે ૨૦૨૦માં ૧૩૪૪ અને જૂન ૨૦૨૦માં ૧૧૩૫ મોત થયા હતા, એ પછી ઓક્ટોબરમાં ૧૦૧૮ અને નવેમ્બરમાં ૧૮૫૨ તેમજ ડિસેમ્બર ૨૦૨૦માં ૧૩૩૧ દર્દીનાં મોત થયા હતા. એ પછીના વર્ષ ૨૦૨૧માં સિવિલમાં એપ્રિલમાં સૌથી વધુ ૩,૭૩૩ અને મે માસમાં ૨,૮૨૨ દર્દીનાં મોત થયાં હતાં.





# હૈદરાબાદના બોઈગુડામાં ભીષણ આગ, 11 લોકોનાં મોત, 12 ફસાયેલી આશંકા

મૃતક મોટાભાગના બિહારના રહેવાસી : ભંગારના ગોડાઉનમાં લાગી હતી આગ

હૈદરાબાદ

હૈદરાબાદના બોઈગુડા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. 12 લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના લોકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 10 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. ભીષણ આગને કારણે એક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે લોકો બહાર નીકળી શક્યા નથી.

ભીષણ આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે, લગભગ 8 ફાયર એન્જિન આગ ઓલવવામાં



રોકાયેલા છે. લોકો હજુ પણ આગ ઓલવવા અને રાહત કાર્યમાં લાગેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભંગારના ગોડાઉનમાં કામ કરતા તમામ મજૂરો

બિહારના રહેવાસી છે.

દુર્ઘટના સમયે, લગભગ 8 ફાયર ટેન્ડર આગને બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડના એક અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લાવવામાં સમય લાગ્યો હતો. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જંક વેરહાઉસમાં કામ કરતા તમામ મજૂરો બિહારના રહેવાસી હતા.

# PM કિસાન: ગેરલાયકોના ખાતામાં 4,350 કરોડ રૂપિયા જમા થઈ ગયા

નવી દિલ્હી

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પીએમ-કિસાન યોજનામાં મૂળ લાભાર્થીઓ કરતા જે લોકો લાયકાત નથી ધરાવતા તેમના ખાતામાં કરોડો રૂપિયા જમા કરી દેવાયા હોવાનું સામે આવ્યું છે. દેશભરમાં આશરે ૪,૩૫૦ કરોડ રૂપિયા ગેરલાયક લાભાર્થીઓના ખાતામાં જમા થઈ ગયા હતા.

જેને પગલે હવે કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે પીએમ-કિસાન યોજના હેઠળ જે પણ ગેરલાયક લોકોના ખાતામાં પૈસા જમા થયા છે તેને પરત લેવામાં આવે. ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના એટલે કે પીએમ-કિસાન યોજના જારી કરવામાં આવી

હતી. જે પણ લાભાર્થી ખેડૂતો હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત દર વર્ષે આશરે ૬૦૦૦ રૂપિયા ઓછી જમીન ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

લોકસભામાં લેખીતમાં જવાબ આપતી વેળાએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે આ યોજના અંતર્ગત જે પણ રકમ જમા કરવામાં આવી તેના બે ટકા એટલે કે ૪,૩૫૨.૪૯ કરોડ રૂપિયા એવા લોકોના ખાતામાં જમા થઈ ગયા છે કે જેઓ આ યોજનાનો લાભ લેવાને લાયક ન હોય. જેથી હવે આ લોકોની પાસેથી આ પૈસાને પરત લેવા માટે રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે.

# દિલ્હીમાં 2 માસની પુત્રીનું ગળું દબાવીને ઓવનમાં નાખી દીધી

મહીલાએ પુત્રની લાલસામાં પુત્રીનું ગળું દબાવી હત્યા કરી

નવી દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કળિયુગી માતાએ 2 મહિનાની માસૂમ પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. ગળું દબાવીને હત્યા કર્યા બાદ મહીલાએ માસૂમને ઓવનમાં નાખી દીધી હતી. માતાની નિર્દયતાથી જીવ ગુમાવનાર માસૂમના મૃતદેહને પોલીસે કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઘટના દિલ્હીના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ચિરાગ

દિલ્હી ગામની છે. મળતી માહિતી પ્રમાણે ચિરાગ દિલ્હી ગામમાં એક મહીલાએ પુત્રની લાલસામાં પોતાની બે મહિનાની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ આરોપી મહીલાએ મૃતદેહને ઘરની છત પર પડેલા એક માઈક્રોવેવ ઓવનમાં છૂપાવી દીધો હતો. પરિવારજનોએ બાળકીના ગાયબ થવાની ફરિયાદ પોલીસને કરી હતી. ઘરમાં શોધખોળ દરમિયાન બાળકી અનન્યા કૌશિકનો મૃતદેહ મળી આવ્યો હતો.

# હીરો મોટોકોર્પની ઓફિસ અને કંપનીના ચેરમેન પવન મુંજાલના ઘરે ITના દરોડા

મુંજાલ સામે પોતાના એકાઉન્ટમાં બોગસ ખર્ચા દેખાડીને કરચોરી કરી હોવાનો આરોપ

મુંબઈ

હીરો મોટોકોર્પના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સ્ટ્ર) પવન મુંજાલના ઘર અને ઓફિસ પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આજે સવારે દરોડો પાડ્યો હતો. વિભાગે હરિયાણાના ગુરુગ્રામ સ્થિત મુંજાલની ઓફિસ અને ઘર ઉપરાંત દિલ્હી અને અન્ય કેટલાક શહેરોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મુંજાલ વિરુદ્ધ આરોપ છે કે તેમણે પોતાના એકાઉન્ટમાં બોગસ ખર્ચા દેખાડીને કરચોરી કરી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તે મુદ્દે જ દરોડાની



કાર્યવાહી કરી રહ્યું છે. સૂત્રોના અનુસાર ટીમને જે શંકાસ્પદ ખર્ચ મળ્યા છે, તેમાં કેટલાક ઈનહાઉસ કંપનીઓના

પણ છે. વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે આઈટી અધિકારીઓની ટીમે નાણાકીય દસ્તાવેજો અને કંપની અને તેના પ્રમોટર્સના અન્ય બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સની પણ તપાસ કરી હતી. 68 વર્ષીય પવન મુંજાલની નેટવર્થ

3.2 અબજ ડોલર છે (લગભગ 24.39 હજાર કરોડ રૂપિયા) છે. મુંજાલ 2021માં દેશના સૌથી ધનિક બિઝનેસમેનની યાદીમાં 54મા નંબરે હતા. જ્યારે 2021ની અબજોપતિઓની યાદીમાં 665માં નંબર પર હતા. મુંજાલને ત્રણ સંતાન છે જેમાં વસુધા મુંજાલ, અનુવ્રત મુંજાલ અને સુપ્રિયા મુંજાલ સામેલ છે. હીરો મોટોકોર્પ દુનિયાની સૌથી મોટી ટૂ-વ્હીલર નિર્માતા કંપની છે. તે 40 દેશમાં પોતાનો બિઝનેસ કરે છે. કંપની પાસે ગ્લોબલ બેન્ચમાર્ક ધરાવતા 8 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે.

# મણીપુરમાં બિરેનસિંહ, ગોવામાં સાવંત અને ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ મુખ્યમંત્રી

નવી દિલ્હી

ઉત્તર પ્રદેશ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચારમાં ભાજપે જીત મેળવી હતી. જેને પગલે હાલ આ રાજ્યોમાં ભાજપની સરકારનું ગઠન થયું છે. આ રાજ્યોમાંથી મણીપુરમાં મુખ્યમંત્રી પદે એન. બિરેન સિંહે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ અગાઉ પણ મણીપુરના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

એન. બિરેનસિંહની સાથે સાથે અન્ય પાંચ મંત્રીઓએ પણ કેબિનેટ મંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા. તેમને

રાજ્યપાલ લા ગણેસને શપથ અપાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરેનસિંહને ટૂંક સમયમાં શુભકામના પણ પાઠવી હતી. તેમણે ટૂંક સમયમાં કે મને પુરો વિશ્વાસ છે કે બિરેનસિંહ અને તેમની ટીમ મણીપુરને એક નવી ઉચાઈ પર લઈ જશે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદે પુષ્કરસિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ અગાઉ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા. છેલ્લા ૧૧ દિવસથી ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનેક અટકળો ચાલી રહી

હતી. તેમની શપથવિધીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, મિનાક્ષી લેખી અને પ્રહલાદ જોશી પણ જોડાયા હતા. ધામીની આગેવાનીમાં જ ભાજપે ઉત્તરાખંડની ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. ઉત્તરાખંડમાં ભાજપને ૭૦માંથી ૪૭ બેઠક મળી હતી. ત્રીજા રાજ્ય ગોવામાં પણ ભાજપે જીત મેળવી હતી, ગોવામાં પ્રમોદ સાવંતને આગામી મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા છે. આ માટે તેઓને હાલ ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા.

# 2022-23 દરમિયાન ભારતનો GDP ઘટી 8.5% રહેશે: ફિલ્શ

નવી દિલ્હી

વિશ્વના વિવિધ દેશોની અર્થતંત્રીય રેખા વિષે સતત ધ્યાન રાખતી 'રેટિંગ એજન્સી' ફિલ્શ દ્વારા ભારતમાં એકંદરે આંતરિક ઉત્પાદન (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP) નો વિકાસ દર ૧૦.૩૦ ટકાથી ઘટાડી ૮.૫ ટકા જેટલો નીચો કર્યો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે પહેલા કોવિડ ઓમીકોન અને પછી રશિયા-યુક્રેન યુદ્ધના પરિણામે વધેલા ઈંધણના ભાવ, વિકાસ દરની પીછેહઠના મુખ્ય કારણ છે. આ વર્ષના જૂન ક્વાર્ટરથી ભારતનો વિકાસ દર વધી શકે તેવી પણ સંભાવના દર્શાવી

છે. ફિલ્શએ વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો GDP વિકાસ દર ૬ ટકા વધી તે ૮.૭ ટકા સુધી પણ પહોંચી શકશે તેવું પણ અનુમાન આપ્યું હતું. આમ છતાં સલામત રેખા પર રહી તેણે તે અંક ૮.૫ ટકા જેટલો જ મુક્યો છે. ભારતના GDPના વિકાસના દરમાં થનારા સંભવિત ઘટાડા અંગે આ રેટિંગ એજન્સીએ તેના 'ગ્લોબલ ઈકોનોમિક આઉટલુક-૨૦૨૨'માં જણાવ્યું છે કે કોવિડ ઓમીકોન, મહામારી પછીથી રીકવરીમાં જાગતિક પુરવઠા ઘટને લીધે ઘણો જ આઘાત પહોંચ્યો છે.

# દેશમાં સમાન નાગરિક ધારો સૌપ્રથમ ઉત્તરાખંડ રાજ્યમાં લાગુ થશે

દેહરાદૂન

પુષ્કર સિંહ ધામી આજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ પહેલા પુષ્કર સિંહ ધામીએ વચન આપ્યું છે કે, મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ તેઓ એ તમામ વચનો પૂરા કરશે જે ભાજપે ચૂંટણી પહેલા આપ્યા હતા. તેમાં યુનિફોર્મ સિવિલ કોડનો પણ સમાવેશ થાય છે. તેઓ પારદર્શી સરકાર ચલાવશે અને ચૂંટણી પહેલા ભાજપે જે પણ વચનો આપ્યા હતા તેને પૂરા કરવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા) પણ તેમાંથી એક છે. ચૂંટણી પહેલા ધામીએ પોતાની રેલીઓમાં યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો હતો.

# માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનું પાલન જ ફરજિયાત કરાવવા સૂચના

# 2 વર્ષ બાદ દેશમાં કોરોના પ્રતિબંધ દૂર કરાયા : માસ્ક હજુ ફરજિયાત

નવી દિલ્હી

2019ના ડિસેમ્બરમાં આવેલ કોરોના વાયરસને કારણે સર્જાયેલ મહામારીથી સમગ્ર દુનિયા જાણે અટકી પડી હતી. માર્ચ, 2020થી દેશમાં કોરોનાને કાબૂમાં લેવા માટે લાદવામાં આવેલ પ્રતિબંધોને 2 વર્ષ બાદ સંપૂર્ણપણે દૂર કરવા માટે કેન્દ્ર સરકારે આજે રાજ્યોને પત્ર લખ્યો છે.

ટોચના અધિકારીઓએ જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ

સિવાયના તમામ પ્રતિબંધો 31મી માર્ચથી દૂર કરવા જણાવ્યું છે.

દેશમાં કોરોના વાયરસ કાબૂમાં હોવાથી હવે કડક પ્રતિબંધોની જરૂર નથી અને માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનું જ પાલન હવે ફરજિયાત કરાવવા તંત્રને સૂચના આપવામાં આવી છે. કોરોનાના કેસની વાત કરીએ તો, હાલ, ભારતમાં 4 કરોડ જેટલાં કેસ અત્યારસુધી નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં 12 લાખ કેસ નોંધાયા હતા.

# અખિલેશ યાદવ અને આઝમખાને સંસદ સભ્ય તરીકે રાજીનામા આપ્યા

લખનઉ

યુપીની ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા આઝમખાને સંસદમાંથી રાજીનામા આપી દીધું છે. આ બંને નેતાઓ તાજેતરમાં યુપીની ચૂંટણી લડ્યા હતા અને તેમની જીત થઈ હતી. આ સંજોગોમાં તેમણે સંસદ કે ધારાસભ્ય એમ બે માંથી એક હોદ્દા પરથી રાજીનામા આપવું પડે તેમ હતું. અખિલેશ અને આઝમખાને ધારાસભ્ય પદે ચાલુ રહેવાનું નક્કી કર્યું છે. આમ તેમણે રાજ્યમાં વધારે સક્રિય રહેવાનો નિર્ણય કર્યો હોય તેમ લાગી રહ્યું છે. અખિલેશ યાદવે આજે લોકસભા સ્પીકરને મળીને પોતાનું રાજીનામા સોંપ્યું હતું.



# માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોકસીની કુલ ૧૯,૧૧૧ કરોડની મિલકતો ટાંચમાં 19,111 કરોડ પૈકી ૩.15,113 કરોડની મિલકતો જાહેર ક્ષેત્રની બેંકોને પરત અપાઈ

નવી દિલ્હી

ભાગેડું વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોકસીની અત્યાર સુધીમાં ૧૯,૧૧૧ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમ સરકારે આજે જણાવ્યું હતું.

નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે ત્રણ ભાગેડુંઓએ પોતાની કંપનીઓ દ્વારા પબ્લિક સેક્ટરની બેંકો સાથે છેતરપિંડી કરી હતી. જેના કારણે આ બેંકોને કુલ ૨૨,૫૮૫.૮૩ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.



તેમણે જણાવ્યું હતું કે ૧૫ માર્ચ, ૨૦૨૨ સુધીમાં પીએમએલએ(પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ)ની વિવિધ જોગવાઈઓ હેઠળ ૧૯,૧૧૧.૨૦ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.

૧૯,૧૧૧.૨૦ કરોડ રૂપિયા પૈકી ૧૫,૧૧૩.૮૧ કરોડ રૂપિયાની મિલકતો જાહેર ક્ષેત્રની બેંકોને પરત આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ૩૩૫.૦૬ કરોડ રૂપિયાની મિલકત ભારત સરકારે જપ્ત કરી છે.

ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ૧૫ માર્ચ, ૨૦૨૨ સુધીમાં ત્રણેય ભાગેડું દ્વારા છેતરપિંડી કરાયેલ કુલ રકમમાંથી ૮૪.૬૧ ટકા રકમ ટાંચમાં અથવા જપ્ત કરી લેવાઈ છે. જ્યારે બેંકોને થયેલ કુલ નુકસાન પૈકી ૬૬.૮૧ ટકા રકમ તેમને પરત મળી ગઈ છે.

# બંગાળમાં બીરભૂમ બાદ નદિયામાં વધુ ટીએમસી નેતાની હત્યા કરાઈ બીરભૂમમાં 12 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા



કોલકાતા

પશ્ચિમ બંગાળમાં એક બાદ એક હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બીરભૂમમાં 12 લોકોને જીવતા સળગાવી દેવાનો મામલો હજુ ઠંડો નથી થયો ત્યાં હવે નાદિયા જિલ્લામાં એક TMC નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. પીડિતનું નામ સહદેવ મંડલ જણાવવામાં આવી રહ્યું છે. તેઓ TMCના સ્થાનિક કાર્યકર હતા. સહદેવની પત્ની અનિમા મંડલ બગુલા ગ્રામ પંચાયત નંબર-2ના સભ્ય છે.

બુધવારે રાત્રે સ્થાનિક લોકોએ તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા મળી આવ્યા હતા. આજુબાજુના

લોકો તેમને લઈને બગુલાના સ્વાસ્થ્ય કેન્દ્રમાં પહોંચ્યા હતા. તેમની હાલત વધારે ગંભીર થતા તેમને કૃષ્ણનગર, શક્તિનગરના હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનું મૃત્યું થઈ ગયું હતું.

મળતી વિગતો પ્રમાણે પશ્ચિમ બંગાળમાં બીરભૂમમાં TMCના એક પંચાયત નેતા ભાદુ શેખની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 12 લોકોના સળગીને મૃત્યું થઈ ગયા છે. તેમના ઘરોમાં આગ લગાવી દેવામાં આવી હતી જેમાં તેઓ જીવતા સળગીને મરી ગયા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા હતા.

# પંજાબમાં એન્ટી કર્પ્શન હેલ્પલાઈન નંબર જારી ચંદીગઢ

મુખ્યમંત્રી ભગવંત માને એન્ટી કર્પ્શન હેલ્પલાઈન નંબર જારી કર્યો હતો. આ નંબર પર વ્હોટ્સ એપ કરીને ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકશે. પંજાબ મુખ્યમંત્રી તરફથી જારી મોબાઈલ નંબર 9501200200 છે. દુસૈનીવાલા ફિરોઝપુરમાં શહીદ ભગત સિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા ભગવંત માને કહ્યું કે આજે શહીદી દિવસ છે અને તમામને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આપ ના પાડતા નહીં. રેકોર્ડ કરીને આ નંબર પર મોકલી દેશો અને જાણકારી અમારા સુધી પહોંચી જશે. તેમણે કહ્યું કે મને આ માટે પંજાબના લોકોના સમર્થનની જરૂર છે.

# બિહાર દિવસ ઉજવવા આવેલા 157 બાળકોને ફૂડ પોઈઝનિંગ

બાળકોને પટના સ્થિત પીએમસીએચમાં દાખલ કરાયા : ડોક્ટર્સ અને અધિકારીઓના મોનિટરીંગ દ્વારા સારવાર ચાલી રહી છે

બિહારની રાજધાની પટના ખાતેથી એક ખૂબ જ મોટી ઘટના સામે આવી છે. 'બિહાર દિવસ' કાર્યક્રમમાં સામેલ થવા માટે આવેલા ૧૫૭ બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. રાતે ભોજન કર્યા બાદ તમામ બાળકોની તબિયત લથડી હતી. ત્યાર બાદ તાત્કાલિક બાળકોને પટના સ્થિત પીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સ અને અધિકારીઓના મોનિટરીંગમાં તેમની સારવાર ચાલી રહી છે.

તે સિવાય અન્ય બાળકોને ગાંધી મેદાન સ્થિત સ્વાસ્થ્ય શિબિરમાં સારવાર આપવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ બીમાર બાળકો પૈકીના અનેકની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે, બિહારના વિભિન્ન જિલ્લાઓમાંથી આવેલા સેંકડો બાળકો બિહાર દિવસ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ ઘટના બાદ પ્રશાસનમાં ભારે હડકંપ મચ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે ૨૨ માર્ચના રોજ 'બિહાર દિવસ' કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. બિહાર દિવસ નિમિત્તે યોજાયેલા ૩ દિવસીય કાર્યક્રમનો આજે સમાપન સમારંભ છે.

# શ્રીનગરમાં હુમલો: કોન્સ્ટેબલ શહિદ અનેક આતંકીઓ ઘુસવાની ફિરાકમાં શોપિયામાં ગ્રેનેડ હુમલામાં સામેલ ત્રણ આતંકીઓની ધરપકડ, ચીની પિસ્તોલો સહિત અનેક હથિયારો જપ્ત

શ્રીનગરમાં આતંકીઓ દ્વારા સુરક્ષા જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ શહીદ થઈ ગયા હતા. આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ પોલીસ દ્વારા કવર ઓપરેશન લોંચ કરાયું હતું. જોકે આતંકીઓને પોલીસની હાજરીની જાણકારી મળી જતા ગોળીબાર કરી દીધો હતો. જેમાં કોન્સ્ટેબલ આમિર હુસૈન શહીદ થયા હતા.

નાસી છૂટેલા આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દરમિયાન જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં ગ્રેનેડ વડે હુમલો કરાયો હતો, આ હુમલા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ફઝિલ શાહિદની પૂછપરછ કરાયા બાદ અન્ય બે શંકાસ્પદો કેઝર ખાન અને અન્ય એકની ધરપકડ કરાઈ હતી. તેની પાસેથી ત્રણ ચાઈનિઝ પિસ્તોલ, છ મેગઝિન્સ, ચાર ગ્રેનેડ્સ, ૩૦ રાઉન્ડ્સ હથિયારો જપ્ત કરાયા હતા હતા.

# વિશ્વના સૌથી પ્રદૂષિત 100 શહેરોમાં ભારતના 63: રાજધાની દિલ્હી સતત ચોથીવાર પ્રથમ

ભારતમાં હવા પ્રદૂષણની સ્થિતિ ૨૦૨૧માં અત્યંત વણસી ગઈ છે, એમ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં જણાવાયું હતું. સ્વિસ ફર્મ આઈક્યુએર દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ મુજબ વિશ્વના ટોચના ૧૦૦ પ્રદૂષિત શહેરોમાં ભારતના ૬૩ શહેરોનો સમાવેશ થાય છે. તેમાં પણ નવી દિલ્હી સતત ચોથી વખત વિશ્વની સૌથી વધુ પ્રદૂષિત રાજધાની જાહેર થઈ છે.



સૌથી પ્રદૂષિત રાજધાની જાહેર કરવામાં આવી હતી. સ્વિસના એક સંગઠન આઈક્યુએર દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને વિશ્વ એર ક્વોલિટી રિપોર્ટ ૨૦૨૧ નામ આપવામાં આવ્યું છે.

આ રિપોર્ટને ૧૧૭ દેશોના કુલ ૬૪૭૫ શહેરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વના સૌથી પ્રદૂષિત રાજધાનીમાં દિલ્હી પછી ઢાકાનો સમાવેશ થાય છે. ત્રીજા ક્રમે ચાડનુ એનડીજામેના, તાજિકિસ્તાનનું દુશાનબે, અને ઓમનનું મસકેટ શહેરનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં ૨૦૨૧માં પીએમ ૨.૫માં ૧૪.૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો. ભારત સૌથી પ્રદૂષિત શહેરોમાં પણ આગળ છે. ટોચના સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૩૫ ભારતમાં છે.

# તમિલનાડુમાં 25 વર્ષીય નેશનલ લેવલના કબડ્ડી પ્લેયરે આત્મહત્યા કરી

ચેન્નઈ

તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાના રહેવાસી નેશનલ લેવલના કબડ્ડી પ્લેયર ભાનુમતીએ બુધવારે સુસાઈડ કરી લીધું. માત્ર 25 વર્ષીય ભાનુમતીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી. રાત્રે તેમને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ તેઓ બચી ના શક્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ નોકરી ના મળવાના કારણે ચિંતામાં હતા. યુવા સ્પોર્ટ્સપર્સન ભાનુમતીના પિતા ધર્મરાજ શાકભાજી વિક્રેતા છે. ભાનુમતી ઘરમાં સૌથી નાના હતા. મંગળવારે ભાનુમતી જ્યારે પોતાના રૂમમાં લટકેલી હાલતમાં મળ્યા ત્યારે ઘરના તેમને નજીકના પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયા હતા.

# વિમાનના એન્જિનમાં ધુમાડો દેખાયો હતો, તપાસ શરૂ કરાઈ દિલ્હીથી દોહા જતી ફ્લાઈટનું કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 283 પ્રવાસીનો બચાવ

નવી દિલ્હી

દિલ્હીથી દોહા જતા પેસેન્જર વિમાનનું કરાચીના એરપોર્ટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં ટેકનિકલ ગરબડ જણાઈ હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતો હોવાનું પાયલટે નોંધ્યું હતું એ પછી તુરંત કરાચી એરપોર્ટમાં લેન્ડિંગનો નિર્ણય લેવાયો હતો. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રવક્તા સૈફુર રહેમાને એક નિવેદનમાં કહ્યું હતું કે દિલ્હીથી દોહા

જતી ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચી એરપોર્ટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. કતાર એરલાઈન્સની આ ફ્લાઈટમાં ૨૮૩ મુસાફરો સવાર હતા. વિમાનના કાર્ગોમાંથી ધુમાડો નીકળ્યો હતો, તેના કારણે તાત્કાલિક લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કરાચી એરલાઈન્સે થોડી વાર માટે તમામ એરલાઈન્સને અટકાવી રાખી હતી અને દિલ્હીથી દોહા જતી ફ્લાઈટને લીલી ઝંડી આપીને લેન્ડિંગ કરાવ્યું હતું.

# કોરોનામાં મૃત્યુ વળતરના ખોટા દાવાની તપાસ માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી

નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે જે ખોટા દાવાઓ કરવામાં આવેલા તે અંગે ખૂબ જ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોનાથી થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા જે ખોટા દાવાઓ દાખલ કરવામાં આવેલા તેના આરોપોની તપાસ માટે મંજૂરી આપી છે. તેના અંતર્ગત આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળમાં દાખલ થયેલા વળતરના દાવાઓ પૈકીના ૫ ટકા દાવાઓની સમીક્ષા કરવામાં આવશે. કોર્ટે ૨૮મી માર્ચ સુધી કોરોનાથી જે મૃત્યુ થયા હોય તેના માટે વળતરનો દાવો કરવા ૬૦ દિવસની સમય મર્યાદા નક્કી કરી છે.





# બીડીના શોખીન નેતા ઠાકોરભાઈ દેસાઈએ જ્યારે બીડીની દુકાનનું ઉદ્ઘાટન કર્યું..

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પીઠ નેતા ઠાકોરભાઈ દેસાઈ ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાંથી ૧૯૬૨ની ચૂંટણી હાર્યા અને ૧૯૬૭માં તે જ મત વિસ્તારમાંથી ફરી ચૂંટણી લડ્યા. આ વખતે તેમની જીત થઈ.

આગલી સરકારમાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના વિમાની અકસ્માત બાદ હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રી થયા હતા. તેઓ ૧૯૬૭માં પણ મુખ્યમંત્રીપદે ચાલુ રહે તે સ્વાભાવિક હતું. પરંતુ ઠાકોરભાઈ દેસાઈને કાર્યકરોએ કહી નાંખ્યું કે “આપણે કાંઈ વિધાનસભાનો એક સભ્ય ચૂંટીને મોકલતા નથી. આપણા ગુજરાતનો મુખ્યમંત્રી ચૂંટીને મોકલીએ છીએ.”

ઠાકોરભાઈ દેસાઈ પણ સહજ આનંદમાં હતા. તેમને પેલા કાર્યકર્તાની વાત ટાંકીને કહ્યું : “હું મુખ્યમંત્રી થઈ કે ના થઈ એ વાત જુદી છે, પણ મુખ્યમંત્રી બને તેવાં સંભવીત નામોમાં મારી ગણના થાય છે.”

ઠાકોરભાઈ દેસાઈનું આ વિધાન સાંભળ્યા બાદ હિતેન્દ્રભાઈ દેસાઈના હિતેચ્છુઓને ફાળ પડી અને ઠાકોરભાઈ ખરેખર શું બોલ્યા હતા તે જાણવા દોડાદોડી કરી મૂકી. ઘણા કાર્યકર્તાઓએ ઠાકોરભાઈને કહ્યું : “એકવાર તમે મુખ્યમંત્રી બનવા હા પાડો બસ પછી અમે બધું સંભાળી લઈશું.”

ઠાકોરભાઈ દેસાઈએ કહ્યું : “મુખ્યમંત્રી તરીકે બધા મને પસંદ કરે તો પણ એ કરવા જેવું નથી, કારણ કે એમ કરવાથી કોંગ્રેસની શિસ્ત તૂટી જાય અને બીજું કેન્દ્રમાં મોરારજીભાઈનું સારું ના દેખાય. હું વિધાનસભામાં માત્ર સભ્ય તરીકે બેઠો હોઉં તે જ પૂરતું છે.”

## બેંક એકાઉન્ટ નહોતો

તે પછી હિતેન્દ્રભાઈ દેસાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ઠાકોરભાઈ દેસાઈને પંચાયત, સહકાર, ખેતી ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા. ૧૯૫૨થી ૧૯૭૧ સુધી ઠાકોરભાઈ દેસાઈ અમદાવાદમાં રહ્યા. ૧૯૬૭ સુધી અમદાવાદની કોઈપણ બેંકમાં તેમનો એકાઉન્ટ નહોતો. ૧૯૬૭માં હિતેન્દ્રભાઈ દેસાઈના મંત્રીમંડળના તેઓ પ્રધાન બન્યા અને મંત્રી તરીકેના વેતનનો પહેલો ચેક તેમને મળ્યો ત્યારે તેમના અંગત મદદનીશ છોટુભાઈએ ઠાકોરભાઈના પુત્ર જિતેન્દ્ર દેસાઈને પૂછ્યું : “સાહેબનો બેંક એકાઉન્ટ કઈ બેંકમાં છે?” જિતેન્દ્ર દેસાઈએ કહ્યું : “પિતાજીના નામના કોઈ બેંક એકાઉન્ટ છે જ નહીં.” તે પછી આશ્રમ રોડની સેન્ટ્રલ બેંકમાં એમને બોલાવવામાં આવ્યા. ૧૯૭૧માં તેમનું અવસાન થયું ત્યારે તેમાં નજવું બેલેન્સ હતું. ઠાકોરભાઈ દેસાઈએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી હતી.

## બીજું કાંઈ છે?

ઠાકોરભાઈ દેસાઈનું વ્યક્તિત્વ સ્પષ્ટ, નિખાલસ અને ભાતીગળ હતું. પત્રકારોને તેઓ ગમતા ખરા અને ક્યારેક સાવ વિચિત્ર પણ લાગતા. એ વખતના દેશના રાષ્ટ્રીય નેતા ગોવિંદ વલ્લભ પંત ગુજરી ગયા. ગોવિંદ વલ્લભ પંત આજે જાઉં કે કાલે જાઉં કરતા ખાસ્સા ૩૦થી ૪૦ દિવસ મૃત્યુને પાછું ધકેલ્યું હતું. એ પછી એક મધરાતે તેઓ ગુજરી ગયા. એક ઉત્સાહી પત્રકારે મધરાતે ફોન કરી ઠાકોરભાઈને ઊંઘમાંથી ઉઠાડતાં કહ્યું : “ઠાકોરભાઈ, ગોવિંદ વલ્લભ પંત ગયા.”

ઠાકોરભાઈએ કહ્યું “સારું, બીજું કાંઈ છે?” પત્રકાર શું કહે? બોલ્યા

વગર ફોન મૂકી દીધો.

## બંદૂકની ગોળીઓ પર

ઠાકોરભાઈ કેટલીયવાર બોલે જ એવું કે અખબારોને મસાલો મળી જતો.



નવસારીમાં બીડી વાળનાર કેટલાક મુસલમાન કારીગરોએ પોતે વાળેલી બીડી જાતે જ વેચવી તેમ નક્કી કર્યું હતું. તે માટે તેમણે દુકાન રાખવાનું નક્કી કર્યું. એક દુકાન રાખ્યા બાદ તેનું ઉદ્ઘાટન કોની પાસે કરાવવું તે મૂંઝવણ હતી. કારીગરોએ નક્કી કર્યું કે બીડીની દુકાનના ઉદ્ઘાટન માટે બીડીની લિજ્જત માણનાર વ્યક્તિ જ હોવી જોઈએ. તે પછી બધાની નજર ઠાકોરભાઈ દેસાઈ પર ઠરી.

મહાગુજરાત ચળવળ વખતે ભદ્ર કોંગ્રેસ ભવન પરથી વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો હતો. વિદ્યાર્થીઓ શહીદ થયા. કોઈએ ઠાકોરભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું હતું : “બંદૂકની ગોળી પર કોઈનાં નામ-

સરનામાં હોતાં નથી.”

એકવાર તેઓ ભરૂચ કાર્યકર સંમેલનમાં ગયા હતા. એ વખતે દક્ષિણ ગુજરાતની અલગ યુનિવર્સિટી શરૂ થઈ હતી. એ વખતે કોઈકે તેમને

તેવી સ્થિતિ હતી. આજે સાત યુનિવર્સિટી થઈ જતાં વાર્ષિક ચાન્સેલર તો હવે બજારમાં મળે છે.” અખબારોએ ઠાકોરભાઈ દેસાઈના આ વિધાનને બોક્સ બનાવી છાપ્યા હતા.

## કચરો સાફ થઈ ગયો

એ જ રીતે ઈન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ વચ્ચે આભાવ થતાં કોંગ્રેસના ભાગલા થયા. તેની ઘણી મોટી અસર ગુજરાતમાં હતી. એ વખતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે ઠાકોરભાઈ દેસાઈ હતા. તેઓ મોરારજી દેસાઈની સ્પષ્ટ તરફણમાં હતા. ઠાકોરભાઈ દેસાઈ મોરારજી દેસાઈના ચુસ્ત સમર્થક હતા. એ વખતે ઈન્દિરા ગાંધી વડા પ્રધાન હતાં. એ સમયે મોરારજી દેસાઈ અને ઈન્દિરા ગાંધી વચ્ચે મતભેદો પરાકાષ્ટાએ પહોંચ્યા હતા ત્યારે ઠાકોરભાઈ દેસાઈ કોંગ્રેસ ભવનમાં પ્રવચન કરતાં જાહેરમાં કહ્યું હતું કે, “ઈન્દિરા ગાંધીને વડા પ્રધાનની પુરશીમાંથી ઉઠાડી મૂકો. જેમને કોંગ્રેસમાં વિશ્વાસ ના હોય તેઓ કોંગ્રેસ છોડી જાય.” આવું બોલવાની હિંમત બીજા કોઈ કોંગ્રેસીમાં નહોતી.

બીજા દિવસના અખબારોમાં ઠાકોરભાઈ દેસાઈનું આ વિધાન હેડલાઈન્સ તરીકે પ્રગટ થયું. તે પછી કોઈ પત્રકારે ઠાકોરભાઈને પૂછ્યું : “જે લોકો કોંગ્રેસ છોડી ગયા છે તેમના માટે તમે શું માનો છો?”

ઠાકોરભાઈ દેસાઈએ કહ્યું : “ગયા તે સારું થયું, કચરો સાફ થઈ ગયો.” ઠાકોરભાઈના આ વિધાને પણ ખૂબ ચર્ચા ઊભી કરી હતી.

## ચા અને બીડીના શોખીન

ઠાકોરભાઈ દેસાઈ ચા પીવાના શોખીન હતા. કોઈના ઘેર ગયા હોય અને યજમાન ચા પીવાની ઓફર કરે તો

ઠાકોરભાઈ ભાગ્યે જ નકારતા. રાત્રે લાંબા પ્રવાસને અંતે ઘેર આવે તો પણ એક કપ ચા પીને ઘસઘસાટ ઊઠી જતા. એ જ રીતે બીડી પીવાના પણ તેઓ શોખીન હતા. ઘરમાં કકળાટ છતાં તેઓ બીડી છોડી શક્યા નહોતા. ઘરમાં નિયંત્રણ આવતાં ક્યારેક બાથરૂમમાં જઈ બીડી પી લેતા. તે પછી કાળજીથી બાથરૂમ ધોઈ નાંખતા અને બાથરૂમમાંથી બીડીની વાસ ના જાય ત્યાં સુધી બહાર આવતા નહીં. બહાર ગયા હોય અને તેમની બીડીઓ ખલાસ થઈ ગઈ હોય તો કાર્યકર પાસેથી પણ બીડી માંગીને પીતા તેમને સંકોચ થતો નહીં.

નવસારીમાં બીડી વાળનાર કેટલાક મુસલમાન કારીગરોએ પોતે વાળેલી બીડી જાતે જ વેચવી તેમ નક્કી કર્યું હતું. તે માટે તેમણે દુકાન રાખવાનું નક્કી કર્યું. એક દુકાન રાખ્યા બાદ તેનું ઉદ્ઘાટન કોની પાસે કરાવવું તે મૂંઝવણ હતી. કારીગરોએ નક્કી કર્યું કે બીડીની દુકાનના ઉદ્ઘાટન માટે બીડીની લિજ્જત માણનાર વ્યક્તિ જ હોવી જોઈએ. તે બધાની નજર ઠાકોરભાઈ દેસાઈ પર ઠરી. બધા કારીગરો ઠાકોરભાઈ પાસે ગયા અને તેમની બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરવા આવવા વિનંતી કરી. ઠાકોરભાઈ દેસાઈએ તરત જ હા પાડી દીધી. ઠાકોરભાઈ દેસાઈ બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરી ઘેર આવ્યા ત્યારે તેમની પાસે પચાસેક બીડીની ઝૂડીઓ હતી. ઠાકોરભાઈ દેસાઈ જેવું તળપદું અને સ્વચ્છ વ્યક્તિત્વ આજે જાહેર જીવનમાં શોધ્યું પણ જડે તેમ નથી.

**દેવેન્દ્ર પટેલ**

**સંપર્ક**

**+91 98792 07102**

## જાણવા જેવું

### ઓસ્ટ્રેલિયાનો કાંટાવાળો કાચિંડો : થોર્નો ડેવિલ



ઓસ્ટ્રેલિયાનો થોર્નો ડેવિલ તો ગજબ છે. આમેય ઓસ્ટ્રેલિયા તેના અજબગજબનાં પ્રાણીઓ માટે જાણીતો છે. ઓસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં થોર્નો ડેવિલ નામનો કાચિંડો જોવા મળે. કદમાં નાનો પણ વિકરાળ ડાયનોસોર જેવા દેખાવના આ કાચિંડાના શરીર પર કાંટા હોય છે. આ કાચિંડો પૂંછડી સહિત ૨૦ સેન્ટીમીટર લાંબો હોય છે. સામાન્ય રીતે રણની રેતી જેવા રંગનો આ કાચિંડો જરૂર પડ્યે રંગ બદલી શકે છે. થોર્નો ડેવિલની પીઠ ઉપર એક મોટું ટીમચું હોય છે. આ ટીમચું તેના બીજા માથા જેવું દેખાય છે. ખરેખર તો આ ટીમચું શિકારી પ્રાણીઓને છેતરવા માટે હોય છે. કોઈ મોટું શિકારી પ્રાણી તેની ઉપર હુમલો કરે તો થોર્નો ડેવિલ પોતાનું અસલી માથું પગ વચ્ચે સંતાડી દે છે. શિકારી પ્રાણી પેલા ટીમચાંને માથું સમજી હુમલો કરે ત્યારે તે પોતે જ કાંટાથી ઘાયલ થઈ જાય છે અને કાચિંડો બચી જાય છે. થોર્નો ડેવિલ કીડી મકોડા જેવા નાના જંતુઓનો શિકાર કરે છે. તેની જીભ લાંબી હોય છે. રંગ બદલવા ઉપરાંત આ કાચિંડો શરીરમાં હવા ભરીને પોતાનું કદ પણ મોટું કરી શકે છે.

### લોહચુંબક કેવી રીતે બને છે?

લો પંડની વસ્તુઓને આકર્ષીને પોતાની તરફ ખેંચતા લોહચુંબક કે મેગ્નેટ એ લોપંડનો ટુકડો જ છે. પરંતુ તેમા ચુંબકીય શક્તિ હોય છે. આ શક્તિ કેવી રીતે આવે છે તે જાણો છો ? વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રચાય છે. આ ક્ષેત્રમાં લોપંડનો ટુકડો મુકવામાં આવે તો લોપંડના અણુઓ ચોક્કસ દિશામાં ગોઠવાઈ જાય છે. અને તે ચુંબક બની જાય છે. ચુંબક બે રીતે બને છે અને બે પ્રકારના હોય છે. લોપંડની આસપાસ ધાતુના તારનું ગુંચળું વિટાળી તેમાં વીજળી દાખલ કરવાથી તે કામ ચલાઉ ચુંબક બને એટલે કે વીજપ્રવાહ હોય ત્યાં સુધી તે ચુંબકનો ગુણ રહે છે. મોટા ચુંબકને બીજા-લોપંડ સાથે એક જ દિશામાં ઘસવાથી લોપંડનો ટુકડો, ચુંબક બને છે અને તે કાર્યમી ગુણ ધરાવે છે. ચુંબકના ટુકડાનો એક છેડો દક્ષિણ અને બીજો ઉત્તર ધ્રુવ કહેવાય છે. ચુંબકના આ ગુણનો ઉપયોગ ઘણા ઇલેક્ટ્રોનિક સાધનોમાં થાય છે. દિશા બતાવતાં હોકા ચંત્ર, ડોરબેલ, સ્પીકર, ઇલેક્ટ્રીક મોટર, જનરેટર, ડાયનેમાં વગેરે સાધનોમાં ચુંબક મુખ્ય ભાગ છે.





# ધોનીએ ચેન્નઈની કેપ્ટનશિપ છોડી, જાડેજા સુકાન સંભાળશે

આઈપીએલના બે દિવસ પહેલા ધોનીએ ટીમ મીટીંગમાં જાહેરાત કરીને તમામને સ્તબ્ધ કરી દીધાં



ચેન્નઈ ભારતના વર્લ્ડ કપ વિજેતા સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ વધુ એક વખત પોતાના નિર્ણયથી તમામને સ્તબ્ધ કરી દીધા છે. આઈપીએલની ૧૫મી સિઝન શરૂ થવાના બે દિવસ પહેલાં ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી છે અને તેના સ્થાને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સુકાની બનાવવામાં આવ્યો છે. જાડેજા ૨૦૧૨થી

ચેન્નઈની ટીમમાંથી રમી રહ્યો છે. તે ચેન્નઈનો ત્રીજો સુકાની બનશે. અગાઉ ધોની અને સુરેશ રૈના સુકાની બન્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સે ટિવટર ઉપર જણાવ્યું હતું કે ધોની ચેન્નઈની વર્તમાન સિઝન અને આગામી સિઝનમાં પણ ચેન્નઈનું પ્રતિનિધિત્વ કરતો રહેશે. સીએસકેના કાશી વિશ્વનાથને જણાવ્યું હતું કે ધોની લીડરશિપમાં ફેરફારને ઘણી આસાનીથી

કરી શકે છે અને તેનું માનવું છે કે જાડેજા ટીમનું નેતૃત્વ કરવા માટે પરિપક્વ થઈ ચૂક્યો છે.

ધોનીએ ગુરુવારે ટીમની ટ્રેનિંગ પહેલાં યોજાયેલી પ્લેયર્સની મિટિંગમાં આ બાબતની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે ૨૬મી માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઓપનિંગ મુકાબલો રમીને ચેન્નઈ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.



## જાડેજા ચેન્નાઈનો ત્રીજો કેપ્ટન

જાડેજા ૨૦૧૨થી ચેન્નાઈની ટીમ સાથે છે. તે CSK ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે ૨૦૦૮થી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. ૨૧૩ મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ ૧૩૦ મેચમાં ટીમને જીત અપાવી છે. આ વચ્ચે સુરેશ રૈનાએ ૬ મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે જેમાં ટીમ માત્ર ૨ મેચ જીતી શકી છે.

## અંતિમ સિઝન બની રહે તેવી સંભાવના

ચેન્નઈની કેપ્ટનશિપ છોડ્યા બાદ ઘણી બાબતો સ્પષ્ટતા થઈ ચૂકી છે કે ધોની પોતાની છેલ્લી આઈપીએલમાં રમી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહ્યા બાદ ધોની માત્ર આઈપીએલમાં રમે છે. ૨૦૨૦ની સિઝનમાં તેણે ૧૪ મેચમાં માત્ર ૨૦૦ રન બનાવ્યા હતા. ૨૦૨૧ની સિઝનમાં તેણે ૧૬ ઇનિંગ્સમાં ૧૬.૨૯ની એવરેજથી ૧૧૪ રન બનાવ્યા હતા.

## ચાર ટાઇટલ અને ૧૩૦ મેચમાં વિજય અપાવ્યા

ધોનીએ આઈપીએલની ૧૪ સિઝનમાં ચેન્નઈની ટીમને ચાર વખત ચેમ્પિયન બનાવી છે. તેણે સીએસકે માટે ૨૦૪ મેચમાં કેપ્ટનશિપ કરી હતી અને ટીમને ૧૨૧ મેચમાં વિજય અપાવ્યો હતો. વચ્ચેના ગાળામાં સુરેશ રૈનાએ પણ છ મેચમાં કેપ્ટનશિપ કરી હતી જેમાં ટીમે બે વિજય મેળવ્યા હતા. આ બંને સિવાય અન્ય કોઈ ખેલાડીએ ચેન્નઈની કેપ્ટનશિપ કરી નથી.

## સાઈના, પીવી સિંધુ તથા પ્રણોય-ક્રિદામ્બી સ્વિસ ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા

બાસેલ

સ્વિસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતના સ્ટાર ખેલાડીઓએ અપેક્ષા મુજબ વિજયી પ્રારંભ કર્યો હતો. મેન્સ સિંગલ્સમાં ક્રિદામ્બી શ્રીકાંત, સમીર વર્મા, એચએસ પ્રણોય, પી. કશ્યપે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બીજા તરફ સાઈના નેહવાલ, પીવી સિંધુ અને અસ્મિતા ચાહિલાએ પોતપોતાના પ્રથમ મુકાબલા જીત્યા હતા. બે વખતની ઓલિમ્પિક મેડાલિસ્ટ સિંધુએ ઈન્ડોનેશિયાની લાઈન હોઝમાર્ક જેસફેલને સીધી ગેમમાં ૨૧-૧૪, ૨૧-૧૨ના સ્કોરથી પરાજય આપ્યો હતો. લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટ સાઈનાએ યાએલે હોયાઉને ૨૧-૧૮, ૨૧-૧૩ના સ્કોરથી હરાવી હતી. મેન્સ સિંગલ્સમાં શ્રીકાંતે ડેનમાર્કના હરીફ મેડુસ

ક્રિસ્ટોફરસેનને સીધી ગેમમાં ૨૧-૧૭, ૨૧-૧૬થી હરાવ્યો હતો. કશ્યપે ફાન્સના ઈનોગત રોયને ૨૧-૧૭, ૨૧-૮થી, એચએસ પ્રણોયે ભારતના અન્ય ખેલાડી સાઈ પ્રણીથને સીધી ગેમમાં ૨૫-૨૩, ૨૧-૧૬થી તથા સમીર વર્માએ એડે રેસ્કીને ૧૮-૨૧, ૨૧-૧૫, ૨૧-૧૧થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. વિમેન્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીની જોડીએ સ્થાનિક સ્વિસ જોડી એલાઈન મુલર અને જેનજિરા સ્ટેડેલમેનને ૨૧-૧૫, ૨૧-૧૬થી પરાજય આપ્યો હતો. મિક્સ ડબલ્સમાં એમઆર અર્જુન અને પ્રુવ કપિલાની જોડીનો પ્રથમ રાઉન્ડમાં ઈન્ડોનેશિયાના ફરર અલ્કિયાન અને મોહમ્મદ રિયાન અરિયાન્તોની જોડી સામે ૧૮-૨૧, ૧૩-૨૧થી પરાજય થયો હતો.

## સ્મિથના ફાસ્ટેસ્ટ આઠ હજાર રન પૂરા, સંગાકારાનો ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો



લાહોર : ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન સ્ટિવ સ્મિથે પાકિસ્તાન સામે રમાતી ત્રીજી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૮,૦૦૦ રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. તેણે લાહોર ટેસ્ટમાં શ્રીલંકાના દિગ્ગજ સુકાની કુમાર સંગાકારાનો ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. ૩૨ વર્ષીય સ્મિથે ૧૫૧મી ટેસ્ટ ઈનિંગમાં (૮૫ ટેસ્ટ) આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

## વરસાદને કારણે વિન્ડીઝ સામેની મેચ રદ થતાં સા. આફ્રિકા સેમિફાઇનલમાં

કાઈસ્ટરચર્ચ

આઈસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બન્ને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો હતો. સાઉથ આફ્રિકાના છ મેચમાં નવ પોઈન્ટ થયા છે અને તે ઓસ્ટ્રેલિયા બાદ અંતિમ-૪માં સ્થાન મેળવનાર બીજી ટીમ બની ગઈ છે. વિન્ડીઝે પોતાના લીગ તબક્કાનો અંત આણ્યો છે અને તે સાત મેચમાં સાત પોઈન્ટ મેળવીને ત્રીજા ક્રમે છે. મેચમાં માત્ર ૧૦.૫ ઓવરની રમત શક્ય બની હતી. સાઉથ આફ્રિકાએ ચાર વિકેટ ૬૧ રન બનાવ્યા હતા અને પછીથી રમત શક્ય બની નહોતી. મેચ રદ થતાં ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે રવિવારે સાઉથ આફ્રિકા સામેની મેચમાં કોઈ પણ ભોગે વિજય હાંસલ કરવો પડશે. જો મેચનું પરિણામ આવશે નહીં તો ભારતને ફાયદો

થશે કારણ કે વેસ્ટ ઈન્ડિઝ કરતાં તેનો રનરેટ વધારે સારો છે. ભારતના છ મેચમાં છ પોઈન્ટ છે અને તે પાંચમા ક્રમે છે.

## ઈંગ્લેન્ડે સેમિ. માટેની દાવેદારી મજબૂત કરી

કાઈસ્ટર ચર્ચ : બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ ઓપનર ડેની વાયટની આક્રમક અડધી સદીની મદદથી ડિકેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે પાકિસ્તાનને નવ વિકેટ હરાવીને આઈસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશવા માટેની પોતાની આશા જીવંત રાખી હતી. પાકિસ્તાનના ૪૧.૫ ઓવરમાં ૧૦૫ રનના સ્કોરને ઈંગ્લેન્ડે ૧૯.૨ ઓવરમાં એક વિકેટે ૧૦૭ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.

## ફીફા વિશ્વકપની સત્તાવાર સ્પોન્સર બની ભારતીય ફર્મ BYJU'S નવી દિલ્હી

ફીફા વિશ્વકપ ૨૦૨૨નું આયોજન નવેમ્બર-ડિસેમ્બરમાં કરવામાં થવાનું છે. ટૂર્નામેન્ટની શરૂઆત ૨૧ નવેમ્બરે થશે અને ફાઇનલ મુકાબલો ૧૮ ડિસેમ્બરે રમાશે. ફીફા ફુટબોલ વિશ્વકપને ઓલિમ્પિક બાદ સ્પોર્ટ્સની બીજી સૌથી મોટી ઈવેન્ટ માનવામાં આવે છે. તેમાં દુનિયાના ૩૨ દેશ ભાગ લેશે. ભારતીય એડ ટેક ફર્મ બાયજૂસ કંપની રમાનાર ટૂર્નામેન્ટ માટે સત્તાવાર સ્પોન્સરના રૂપમાં જાહેર કરવામાં આવી છે. બાયજૂસની પાસે હવે ફીફા વિશ્વકપના ચિન્હ, પ્રતીક અને સંપત્તિ સુધી પહોંચી હશે. તે જાહેરાતમાં તેનો ઉપયોગ કરી શકે છે. જેનાથી દુનિયાભરમાં ફુટબોલ ફેન્સ સુધી તેની પહોંચ હશે. ફર્મ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેની જાણકારી આપી છે.

## ચાર વર્ષમાં ત્રણ ગ્રાન્ડસ્લેમ જીતનાર એશ્લે બાર્ટીની ૨૫ વર્ષની વયે ટેનિસને અલવિદા



મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાની ટેનિસ સ્ટાર એશ્લે બાર્ટીએ ટેનિસમાંથી નિવૃત્તિ લઈને તમામને સ્તબ્ધ કરી દીધા છે. છેલ્લા ચાર વર્ષમાં ત્રણ ગ્રાન્ડસ્લેમ જીતનાર બાર્ટીએ માત્ર ૨૫ વર્ષની વયે ટેનિસ જગતમાં દબદબો મેળવ્યા બાદ રમતને અલવિદા કરી દીધી છે. બાર્ટીનો અનેક રમતો સાથે નાતો રહ્યો છે. ટેનિસ પહેલાં તે ગોલ્ફમાં ટાઈટલ જીતી ચૂકી છે અને ક્રિકેટમાં પણ તે પોતાની બેટિંગથી તમામને પ્રભાવિત કરી ચૂકી છે. ટેનિસમાં પુનરાગમન કર્યા બાદ તેણે પોતાની નાની કારકિર્દીમાં ઘણી સિદ્ધિઓ મેળવી હતી. ટેનિસમાં પાછા ફર્યા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ત્રણ ગ્રાન્ડસ્લેમ જીત્યા હતા. તેણે ૨૦૧૮માં ક્લે કોર્ટ ઉપર રમાતા ફ્રેન્ચ ઓપનને પોતાના નામે વિમ્બલ્ડનને પોતાના હાથે ૨૦૧૮માં સિંગલ્સમાં મહિલા

## બાંગ્લાદેશ સા. આફ્રિકામાં ઈતિહાસ રચ્યો, પ્રથમ વખત વન-ડે શ્રેણી જીતી સેન્ટ્યુરિયન

બાંગ્લાદેશની ટીમે સાઉથ આફ્રિકાને ત્રીજી વન-ડેમાં હરાવીને ઈતિહાસ રચ્યો હતો. અંતિમ વન-ડેમાં બાંગ્લાદેશે કોઈ પણ મુશ્કેલી વિના સાઉથ આફ્રિકાને નવ વિકેટે પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશે ત્રણ મેચની શ્રેણી ૨-૧થી જીતી હતી. આ પહેલાં બાંગ્લાદેશ સાઉથ આફ્રિકામાં રમેલી તમામ ૧૮ મેચમાં પરાજિત થઈ હતી. સાઉથ આફ્રિકાની ટીમ ૩૭ ઓવરમાં ૧૫૪ રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. મલાન અને ડી કોકે પ્રથમ વિકેટ માટે ૪૬ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ બેટિંગ હારોળ વેરવિખેર થઈ ગઈ હતી. બાંગ્લાદેશ માટે તસ્કિન અહમદે ૩૫ રનમાં પાંચ વિકેટ ખેરવી હતી. બાંગ્લાદેશે ૨૭ ઓવરમાં એક વિકેટના ભોગે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.





# ચીનમાં વિમાન તૂટી પડતા 132 પ્રવાસીઓનાં મોત

બોઈંગ-737 વિમાન દક્ષિણ ચીનના કુનમિંગથી ગોન્ઝાઉ જવા ઉડ્યું હતું : 29,100 ફૂટની ઊંચાઈએથી વિમાન માત્ર અઢી મિનિટમાં ક્રેશ થયું

## બોઈંગ

ચીનના કુનમિંગ શહેરથી ગુઆનઝોઉ જવા નીકળેલું બોઈંગ-૭૩૭ પેસેન્જર વિમાન ટેન્શિયાન કાઉન્ટીની પહાડીઓમાં તૂટી પડ્યું હતું. એમાં ૧૨૩ મુસાફરો અને ૯ કુ મેમ્બર્સ સવાર હતા. એ તમામના મોત થયાની આશંકા છે. જે ગતિએ વિમાન ક્રેશ થયું તે જોતાં દૂર્ગમ પહાડીઓ વચ્ચે મુસાફરો જીવતા હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ચીનના પ્રમુખ જિનપિંગે ઘટનાના કારણ માટે તપાસપંચની રચના કરી છે.

ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું વિમાન બોઈંગ-૭૩૭ દક્ષિણ ચીનના કુનમિંગ શહેરથી ગુઆનઝોઉ જવા માટે નીકળ્યું હતું. એ દરમિયાન વચ્ચે વિમાનમાં કંઈક ખામી સર્જાઈ હોવાની શક્યતા છે.

તેના કારણે વિમાન ૨૯,૧૦૦ ફૂટની ઊંચાઈએથી ટેન્શિયાન કાઉન્ટીમાં આવેલી પહાડીઓ વચ્ચે તૂટી પડ્યું હતું. ૨૯,૧૦૦ ફૂટની ઊંચાઈએથી સામાન્ય રીતે વિમાનને નીચે આવતા ૩૦ મિનિટ જેટલો સમય લાગતો હોય છે. તેના બદલે આ વિમાન માત્ર અઢી મિનિટમાં નીચે ખાબક્યું હતું. એનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એ વીડિયો પરથી જણાય છે કે વિમાન તૂટીને તીવ્ર ગતિએ નીચેની તરફ ખાબક્યું હતું. ચીનની સરકારે ૬૫૦ ફાયર ફાઈટર્સને પહાડીઓની બંને તરફથી પ્લેનકેશની સંભવિત સાઈટ તરફ રવાના કર્યા હતા. જોકે, વિમાન ખૂબ જ દૂર્ગમ પહાડીઓની વચ્ચે તૂટી પડ્યું હોવાથી તુરંત ત્યાં સુધી પહોંચવાનું ખૂબ જ મુશ્કેલ હોવાનું સ્ટેટ ઈમરજન્સી વિભાગે કહ્યું હતું.



## US મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમોના અત્યાચારને નરસંહાર જાહેર કરશે

### વોશિંગ્ટન

જો બાઈડેનનું વહીવટી તંત્ર મ્યાંમારમાં રોહિંગ્યા મુસલમાનો પર વર્ષોથી ચાલી રહેલા અત્યાચારને નરસંહાર જાહેર કરવાની તૈયારી કરી રહ્યાં છે તેમ અમેરિકાના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકનની સોમવારે યુએસ હોલોકોસ્ટ મેમોરિયલ મ્યુઝિયમમાં થનારા કાર્યક્રમમાં રોહિંગ્યા મુસલમાનોના દમનને નરસંહાર જાહેર કરવાની યોજના છે. મ્યાંમારની સૈન્ય સરકાર સામે નવા પગલાં ભરવાનો નથી કારણકે તે અગાઉથી જ રોહિંગ્યા જાતીય લઘુમતિઓ

વિરુદ્ધના અભિયાન અંગે અમેરિકાના અનેક પ્રતિબંધોનો સામનો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મ્યાંમારની સેનાએ વર્ષ ૨૦૧૭માં પશ્ચિમી રખાઈન પ્રાંતમાં રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. અમેરિકાની આ જાહેરાતથી મ્યાંમારની સેના પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી શકે છે. મ્યાંમારની સેના અગાઉ થી જ હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં નરસંહારના આરોપોનો સામનો કરી રહી છે. માનવ અધિકાર સંગઠનો અને સાંસદો અગાઉ ટ્રમ્પ પર અને હવે બાઈડેન પર રોહિંગ્યા મુસ્લિમો પર થયેલા અત્યાચારને નરસંહાર જાહેર કરવા સતત દબાણ બનાવી રહ્યાં છે.

## ઓસ્ટ્રેલિયાએ 29 જેટલી પ્રાચીન મૂર્તિઓ તેમજ કલાકૃતિઓ ભારતને પરત સોંપી

### કેનબરા

નેશનલ ગેલેરી ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા એક પ્રોજેક્ટ હાથ ધરીને 2014 થી માંડીને 2021 સુધીમાં ઓસ્ટ્રેલિયાના સંગ્રહાલયે મૂળ ભારતની 29 જેટલી પ્રાચીન મૂર્તિઓ અને કળાકૃતિઓ ભારતને સોંપી છે. જેમાં એન્ટીક સેન્ડ સ્ટોન શિવ ભૈરવની મૂર્તિ 9 થી 10 મી સદીની હોવાનું માનવામાં આવે છે. તમિલનાડુની પિતળની એક નૃત્ય પ્રતિમા 14મી સદીની છે. જેમાં સાતમી સદીના બાલસંત સંબંધાર નૃત્ય કરતા જણાય છે. આ બાલસંતે 16 વર્ષની ઉંમરે શિવસ્તૂતિમાં 16 હજાર પદોની રચના કરી હતી. બાલ સંતની ત્રણ પ્રતિમા ભારત લાવવામાં આવી છે. 12 મી અને 13 મી શતાબ્દીની દેવી મહિષાસૂર મર્દિનીની પ્રતિમાને દુર્ગારૂપમાં દર્શાવાયા છે. આક્રમક ચહેરો અને જીભ બહાર નિકળી ગયેલી છે. જ્યારે લક્ષ્મી નારાયણની મૂર્તિ 10 મી થી 11 મી સદીની મનાય છે જે ઉત્તરપ્રદેશ કે



રાજસ્થાનની હોઈ શકે છે. આ કલાકૃતિમાં લક્ષ્મી અને નારાયણ બંને ઉભા રહીને બ્રહ્મા અને શિવની આરાધના કરી રહ્યા છે. લક્ષ્મી નારાયણની મૂર્તિ ૧૦ મી સદીની છે જેને ઓસ્ટ્રેલિયાની ગેલેરીએ ૨૦૦૬માં ખરીદી હતી. આ મૂર્તિ રાજસ્થાન કે ઉત્તરપ્રદેશમાંથી ચોરાઈ હતી. બીજી એક જૈન ભગવાનની ૧૧ મી સદીની મનાતી મૂર્તિ માઉન્ટ આબુ રાજસ્થાનથી ચોરાઈ હતી. દૂર્ગા મહિષાસૂરમર્દીની પ્રાચીન મૂર્તિ મૂળ ગુજરાતની છે જે ગેલેરી દ્વારા ૨૦૦૨માં ખરીદવામાં આવી હતી.

## શ્રીલંકામાં ભયંકર આર્થિક સંકટ, પેટ્રોલ પંપો પર હવે સેના તૈનાત કરવાનો નિર્ણય

### કોલંબો

પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટ એટલું ઘેરૂ બન્યું છે કે, હવે પેટ્રોલ પંપો પર સેના તૈનાત કરવાની નોબત આવી છે. શ્રીલંકામાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ તો આસમાનને આંબી જ રહ્યા છે પણ પેટ્રોલ ડિઝલ અને ગેસની સ્થિતિ વધારે ગંભીર બની છે. પેટ્રોલ ડિઝલ ખરીદવામાં કેટલાક લોકોના મોત પણ થઈ ગયા છે.

જોકે પેટ્રોલ પંપ જે રીતે ભીડ ઉમટી રહી છે તેના કારણે હવે પેટ્રોલ પંપો પર સેના તૈનાત કરવાનો નિર્ણય સરકારે



લીધો છે. લોકો પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લગાવી રહ્યા છે. કારણકે પેટ્રોલ ડિઝલની પણ અછત અનુભવાઈ રહી છે. લોકો કલાકો સુધી લાઈનોમાં ઉભા

રહીને પેટ્રોલ અને ડિઝલ ખરીદે છે.

કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાના કારણે ૩ વૃધ્ધોના મોત પણ થઈ ચુકાય છે ત્યારે હવે સરકારે પેટ્રોલ પંપો પર સ્થિતિ નિયંત્રણમાં રાખવા સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

જોકે સરકારનું કહેવું છે કે, સૈનિકો પેટ્રોલ કે ડિઝલનું વિતરણ કરશે. ભીડ કંટ્રોલ નહીં કરે. દરેક પંપ પર ઓછામાં ઓછા બે જવાનોની તૈનાતી કરાશે. ખોટી રીતે પેટ્રોલ વિતરણ અને સંઘરાખોરીની ફરિયાદો બાદ સેનાને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.

## અક્સાઈ ચીનને ચીનના જમ્મુ-કાશ્મીર તરીકે માન્યતાની માંગ

જુનૈદે આપેલું નિવેદન ચીનની ક્ષેત્રીય અખંડિતતા અને સંપ્રભુતાની વિરુદ્ધ છે : ચીને બળાપો કાઢ્યો

### જિનેવા

જિનેવા ખાતે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૪૯મા સત્ર દરમિયાન કાશ્મીરી માનવાધિકાર કાર્યકર જુનૈદે કુરૈશીએ અક્સાઈ ચીન પર ચીનના ગેરકાયદેસર કબજાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, અક્સાઈ ચીનના એક ખૂબ મોટા હિસ્સા પર ચીને કબજો જમાવેલો છે માટે તેને ઔપચારિક રીતે 'ચીનના કબજાવાળા જમ્મુ અને કાશ્મીર' તરીકે માન્યતા મળવી જોઈએ.

જુનૈદે કુરૈશી બ્રસેલ્સ સ્થિત યુરોપીય ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝના ડિરેક્ટર છે. જવાબમાં જુનૈદે કહ્યું કે, હું મારા પૂર્વજોની ભૂમિ જમ્મુ અને કાશ્મીરના મુદ્દે પરિષદનું ધ્યાન આકર્ષિત કરવા ઈચ્છું છું. આ અંગે પરિષદમાં અનેક દશકાઓથી ચર્ચા થતી આવી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ મુદ્દા અંગે જે શબ્દાવલિઓ રચવામાં આવેલી છે તે પૈકીની મોટા ભાગની અનેક વર્ષોથી સામાન્ય ઉપયોગમાં લેવાય છે.

## અમેરિકાના પ્રથમ મહિલા વિદેશ મંત્રી મેડેલીન આલ્બ્રાઈટનું અવસાન

### વોશિંગ્ટન

અમેરિકાની પ્રથમ મહિલા વિદેશ મંત્રી મેડેલીન આલ્બ્રાઈટનું 85 વર્ષની વયે કેન્સરને કારણે અવસાન થયું. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને આલ્બ્રાઈટને 1996માં અમેરિકાના ટોચના રાજદ્વારી બનાવ્યા હતા. મેડેલીને ક્લિન્ટન સરકારના કાર્યકાળના છેલ્લા 4 વર્ષ સુધી મજબૂતાઈથી કામ કર્યું. તે અમેરિકાના 64મા વિદેશ મંત્રી હતા. ક્લિન્ટનના કાર્યકાળ દરમિયાન મેડેલીન અમેરિકાના ઈતિહાસમાં સર્વોચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરનાર મહિલા હતી. જો કે, મેડેલીન ક્યારેય રાષ્ટ્રપતિની રેસમાં ભાગ લઈ શકી ન હતી. તેનું કારણ એ હતું કે તે ચેકોસ્લોવેકિયાની વતની હતી.

## ગંદા પાણીને કારણે લાખો લોકો ટાઇફોઇડથી પીડાય છે વિશ્વના 79 કરોડ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી : યુએન

### લંડન

આપણે સૌ જાણીએ છીએ કે ધરતી પર ૭૫ ટકા પાણી છે. આમ છતાં વિશ્વના અનેક દેશો પાણીની અછતનો સામનો કરી રહ્યાં છે. વિશ્વના અનેક દેશો અને શહેરો એવા છે જ્યાં લોકોને પીવાના પાણી અને પોતાની અન્ય જરૂરિયાત માટેના પાણી માટે અનેક માઈલ દૂર સુધી જવું પડે છે. આટલું લાંબુ અંતર કાપ્યા પછી પણ તેમને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. આ આપણા વિશ્વની વિટંબણા છે.

સંયુક્ત રાષ્ટ્રની તરફથી આ સમસ્યા પ્રત્યે લોકોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર પણ પાણીની સમસ્યા દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે આમ છતાં આ સમસ્યા સતત વિકારણ બની રહી છે. યુએનના એક અહેવાલ મુજબ વિશ્વના ૭૯ કરોડ લોકોને જરૂરિયાત મુજબનું પાણી મળતું નથી. દર વર્ષે ગંદા પાણીને કારણે વિશ્વમાં લાખો લોકો ટાઇફોઇડની ચપેટમાં આવે છે.

## ભારતીય અર્થશાસ્ત્રી જયતી ઘોષની યુએનના સલાહકાર બોર્ડમાં નિમણૂક

### યુન

યુએન સેક્રેટરી જનરલ એન્ટાનિયો ગુતારેસે ભારતીય વિકાસ અર્થશાસ્ત્રી જયતી ઘોષની એક નવા ઉચ્ચ સ્તરીય સલાહકાર બોર્ડમાં નિમણૂક કરી છે. ૬૬ વર્ષીય ઘોષ યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ એમહર્સ્ટમાં પ્રોફેસર છે. આ અગાઉ તેઓ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સમાં સેન્ટર ફોર ઈકોનોમિક સ્ટડીઝના ચેરમેન અને અર્થશાસ્ત્રના પ્રોફેસર હતાં. તેઓ અર્થશાસ્ત્ર અને સામાજિક બાબતો અંગે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય સલાહકાર બોર્ડના પણ સભ્ય છે.





# રશિયા યુક્રેન પર કેમિકલ હુમલાની તૈયારીમાં : US

કીવના પરાં વિસ્તારો પર યુક્રેનનો ફરી કબજો, રશિયા સામે નરમ વલણ છોડી આકરાં થવા ભારત પર જો બાઈડેનનું દબાણ

વોશિંગ્ટન

યુક્રેન પર રશિયાના આક્રમણને લગભગ એક મહિનો પૂરો થવા આવ્યો છે. આ સમયમાં રશિયાએ યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલા કર્યા છે. પરંતુ તે આ યુદ્ધ જીતવામાં સફળ થયું નથી. ઉલટાનું યુક્રેને કીવનાં પરાં વિસ્તારો પર ફરી કબજો જમાવ્યો છે જ્યારે મારીયુપોલમાં આત્મસમર્પણ કરવાની રશિયાની દરખાસ્ત યુક્રેને ફગાવી દીધી છે. ઉપરાંત આ યુદ્ધમાં રશિયાએ ભારે ખુવારીનો સામનો કરવો પડ્યો છે. પરિણામે રશિયા યુક્રેન પર કેમિકલ હથિયારોથી હુમલો કરે તેવી આશંકા છે તેવી અમેરિકાએ ચેતવણી આપી છે.

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચોથા સપ્તાહમાં પ્રવેશ્યું છે. આ સમયમાં રશિયાએ યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી લઈને અન્ય હથિયારોથી હુમલા કર્યા છે. આ હુમલામાં યુક્રેનના અનેક શહેરોનો કચ્છરઘાણ નીકળી ગયો છે. મારિયુપોલ સહિતના શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. આમ છતાં યુક્રેને રશિયા સામે ઘૂંટણીયા ટેકવાનો ઈનકાર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું હતું કે યુક્રેનમાં શરણાર્થીઓની સંખ્યા ૩૫ લાખને પાર થઈ ગઈ છે.

રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન સાથે યુદ્ધવિરામ માટે અનેક માગણીઓ કરી છે, જેમાં યુક્રેનની તટસ્થ અને બીન પરમાણુ સ્થિતિ, વિસૈન્યીકરણ અને વિમુદ્રીકરણ, તેના કબજાવાળા કિમિયાને રશિયાના ભાગ તરીકે સ્વીકૃતિ વગેરેનો સમાવેશ થાય છે. જોકે, તેના જવાબમાં યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેન તેની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતા સાથે ક્યારેય સમજૂતી નહીં કરે. આખું યુક્રેન ખતમ થઈ જશે ત્યાર પછી જ રશિયાનું અલ્ટીમેટમ પૂરું થઈ શકે છે.



## રશિયાના વિરોધમાં વિશ્વને રસ્તા પર ઉતરવા ઝેલેન્સ્કીનો અનુરોધ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સમગ્ર વિશ્વના નાગરિકોને યુક્રેન પરના રશિયાના હુમલાના વિરોધમાં રસ્તાઓ પર ઉતરવા માટે અનુરોધ કર્યો હતો. યુક્રેનના વિદેશ મંત્રાલયે ઝેલેન્સ્કીના વીડિયો મેસેજને ટિવટ કર્યો હતો. આ વીડિયો મેસેજમાં ઝેલેન્સ્કી કહે છે કે, રશિયાનું યુદ્ધ માત્ર યુક્રેનની સામે નથી. આ યુદ્ધ સ્વતંત્રતાની વિરૂદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. માટે હું તમને યુદ્ધ વિરૂદ્ધ ઉભા થવા માટે કહું છું. ઝેલેન્સ્કીએ અંગ્રેજીમાં કહ્યું હતું કે, આ દિવસ બાદથી તમારું વલણ શું છે તે બતાવી દો, તમારા કાર્યાલયો, તમારા ઘરો, તમારી શાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાંથી આવો. યુક્રેનનું સમર્થન કરવા માટે, સ્વતંત્રતાનું સમર્થન કરવા આગળ આવો.

## ટિકટોકના શોભે આઠ લોકોનો જીવ લીધો

યુક્રેનના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર સેન્સેશન ફેલાવવા માટે તેના દેશની બાતમીદારી કરી દેતાં યુક્રેનની સેના દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. ટિકટોકર યુક્રેનની રાજધાની કિવનો રહેવાસી છે અને તેણે શહેરના એક વ્યસ્ત સુપરમાર્કેટની સામે પોતાનો ટિકટોક વીડિયો બનાવતી વખતે ત્યાં પાર્ક કરેલી કાર અને લોકોની લાઈન વિશે જણાવ્યું હતું. આ વીડિયો પછી તરત જ વિસ્ફોટ થયો અને ૮ લોકોના મોત થયો હતો. આ ઘટના કિવના રેટ્રોવિલે મોલની છે.

## રશિયા આઘટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઇબર હુમલો કરી શકે છે : બાઈડેન

જો બાઈડેને US કંપનીઓને કહ્યું રશિયા અત્યંત મહત્વના આઘટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઇબર હુમલો કરી શકે છે. બાઈડેનના ટોચના સાઇબર સિક્યોરિટી સહાયક એન ન્યુબર્ગરે વ્હાઇટ હાઉસમાં તે બાબત અંગે નિરાશા વ્યક્ત કરી છે કે કેટલીક અમેરિકન કંપનીઓએ સરકારની ચેતવણીની અવગણના કરી છે. આ કંપનીઓ જો તેમના સોફ્ટવેરમાં સુધારો નહીં કરે તો તે રશિયાના સાઇબર હુમલાનો ભોગ બની શકે છે.

## રશિયાના 15 હજાર કરતાં વધારે સૈનિકોને માર્યાનો યુક્રેનનો દાવો

યુક્રેને દાવો કર્યો કે યુદ્ધમાં રશિયાના 15,300 સૈનિક માર્યા ગયા છે. જેમાં રશિયાની 509 ટેન્ક, 123 હેલિકોપ્ટર, 99 વિમાન અને 15 વિશેષ ઉપકરણોને પણ નુકસાન પહોંચાડ્યું છે. તો બીજી તરફ રશિયાના હુમલામાં યુક્રેનમાં ભારે તારાજ ફેલાઇ છે. આ હુમલામાં હજુ સુધીમાં 651 મકાન અને 3780 ઘર નાશ પામ્યા છે.

## રશિયાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 26 દિવસ થઈ ગયા છે. વિશ્વના મોટાભાગના દેશો રશિયાનો બહિષ્કાર કરી ચુક્યા છે. તથાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે રશિયાએ પોતાના દેશમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયાએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સને ઉગ્રવાદી સંગઠન ગણાવ્યા છે. રશિયાની એક અદાલતે મેટાને ચુકાદો સંભળાવ્યો છે કે ઉગ્રવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી રશિયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે.

**MOTEL  
for  
SALE**

**NIRAJ PANCHOLI, REALTOR®**

ASQ CQT (Toronto) Mechanical Engineer (Ahmedabad)

Cell: 647-866-2790

Email: ncpancholi@gmail.com

Website: https://niraj-pancholi.c21.ca/

Multi Award Winner Agent Since 2011, Proven Result through Honesty & Experience  
Outstanding Achievement Award of Excellence: every year since 2011 to 2021 ...  
Among TOP 75 PRODUCER IN CANADA & CENTURION PRODUCER AWARDS and many more ...

Selling BUSINESS, COMMERCIAL & RESIDENTIAL PROPERTIES since 2011  
Visit my website for NEW & UPDATED Exclusive & MLS listings



**MOTEL KING: Specializing in Selling Motels: LIST & SELL with confidence**

Major Achievements: Among TOP 75 PRODUCERS IN CANADA AWARD & CENTURION PRODUCER AWARDS 2017-2021

**New: 30+ Room Motel in Sault Ste Marie City**

With 3 BR house, main street of downtown, minutes away form all amenities such as shopping malls, schools, college, airport. Close to USA border. - Asking Price: \$1.7M

**URGENT LISTINGS REQUIRED MOTELS & HOTELS**

MANY Qualified Buyers are Ready to sign the OFFER and CLOSE the Deal in 1 to 3 months. Closing in 3 Weeks if the Seller willing to Hold a Mortgage. Call me ASAP if interested to SELL quickly.

**New: Franchise Hotel near Ottawa Airport**

60+ Room, full-service hotel, Asking under \$8M

**12 to 45 Room Motels Northern Ontario**

Asking Price: \$1,300,000 To \$5,000,000  
(40% to 50% down payment require)

**MOTEL OPERATOR REQUIRED FOR NORTHERN ONTARIO**

Good pay & free accommodation, family preferred  
Partnership OR Revenue Bonus for the right candidate

**Recently SOLD Motels Near**

Welland, London, Sarnia, North Bay, Cochrane, Sudbury,  
Pembroke, Ottawa, Thunder Bay

**JOB AVAILABLE : For the Motel located in Northern Ontario**

- **Housekeeper** for room cleaning and general work in the motel, accommodation available for the couple / small family
- **Working Partner** Willing to invest min \$200K, stay & operate/manage the motel offering Partnership + Salary to operate









Lapoto Finish



Matt Finish

પોર્સેલિન ટાઇલ્સ શરૂ થાય છે ફક્ત \$ 0.89 થી

**Porcelain tiles starting from \$0.89 per square feet only**

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking

સિરામિક ટાઇલ્સ શરૂ થાય છે \$ 0.50 થી

**Ceramic tiles starting from \$0.50 per square feet only**

- ◆ પોર્સેલિન ટાઇલ્સ અને સિરામિક ટાઇલ્સ ફેક્ટરી ભાવે મળશે
- ◆ અમારા ભાવની ખાત્રી કરી શકો છો. વધારાના ૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે
- ◆ ફ્લોર, દિવાલ અને આઉટડોર પાર્કિંગની ટાઇલ્સ મળશે

**:- Available Size :-**

**24" \* 24" | 12" \* 24" | 24" \* 48" | 4" \* 8" | 4" \* 12"**

**MONTREAL**

3590, Rue Griffith, Saint Laurent, QC, H4T 1A7  
Phone: +1-514-260-2242 / +1-514-813-3850


**OTTAWA**


Unit #4+5, 200 Colonnade Road, Nepean, ON, K2E 7M1  
+1-613-601-1474

**MISSISSAUGA**

5030 Maingate Drive, Unit#1, Mississauga, L4W 1X5  
Phone: +1 (647) 527-6030 / +1-514-813-3850


<https://clubceramic.com> Email : [sales@clubceramic.com](mailto:sales@clubceramic.com)





**Chapel Ridge**  
FUNERAL HOME & CREMATION CENTRE

**416.993.0826**  
**24/7 # 905.305.8508**



તમારી સગવડ માટે અમે બે ફ્યુનરલ સેન્ટર ઓફર કરીએ છીએ. મારખમ અને મિસિસાગા. સંપૂર્ણ હિન્દુ તથા જૈન વિધિની સગવડતા. (St. John's Dixie, 737 Dundas St. E., Mississauga, ON L4Y 2B5)

ફ્યુનરલ સર્વિસ, બેઝિક કાસ્કેટ, ક્રિમેશન અને ટેક્સ બધાં સાથે ટોટલ ફક્ત **\$4270**

વધુ માહિતી માટે ફોન કરો. અમારો પ્રોફેશનલ સ્ટાફ તમારી ભાષામાં તમને માહિતી આપશે.  
**પ્રિપેઇડ ફ્યુનરલ અને ટ્રાવેલ ઈન્સુરન્સ**

1. તમારા ડોલર ફ્યુનરલ હોમમાં જમા નહિ થાય. પરંતુ સરકારે નીમેલી ટ્રસ્ટ કંપની પાસે રહેશે.
2. એક વખત પ્લાન ખરીદ્યા પછી તમે કે તમારા ફેમિલીએ કદીપણ વધુ પૈસા નહિ આપવા પડે.
3. ટ્રાવેલ ઈન્સુરન્સ - ફક્ત **\$595** એક વખત આપી જિંદગી ભર તમે ક્યાંય પણ નિશ્ચિત ટ્રાવેલ કરી શકશો. \*

\* This is not a general insurance. Applies only in case of a death away from home.

8911 Woodbine Avenue, Markham, Ontario L3R 5G1  
[www.chapelridgefh.com](http://www.chapelridgefh.com) • [info@chapelridgefh.com](mailto:info@chapelridgefh.com)